



# શૃંગ મિયા



ડૉ. મનુ જીવી.

સ્તુતિ

હે ઈશ્વર !

સૃજિના સર્જનહાર,

મારા જડ શરીરમાં થૈતન્યનો સંચાર કરનાર તારા  
દિવ્ય અંશને મેં મારા હૃદયના સિંહાસન પર  
વિરાજમાન કરેલ છે.

અને જ્યાં સુધી મારી બુદ્ધિમાં તારો જ આપેલ  
સારાસારનો વિયેક છે, ત્યાં સુધી હું એ આસનને  
કોઈપણ કારણોસર અપવિત્ર નહીં જ થવા દઉ  
હે ઈશ્વર !!





**DR. PRAGNA PAI**

DEAN

SHETH G. S. MEDICAL COLLEGE

& K. E. M. HOSPITAL, PAREL

MUMBAI.

### હદ્ય મંથન ની પ્રસ્તાવના

“માંદગી એ શરીરનો ધર્મ છે, અને  
મૃત્યુ એ સમયનો ધર્મ છે”

વિદૃષિ ડૉ. પ્રજા પે કહે છે :

નેટ્યું મહત્વ હૃદયને આપવામાં આવે છે તેણું ધ્યાન શરીરના કોઈપણ અવયવ પ્રત્યે નથી આપાતું, સિવાય કે શરીરનો તે ભાગ આંગળી, હાથ, પગ, ચેલ, માથું, કીડની કે બીજે કોઈ અવયવ આપણને તકલીફ આપતો હૈય.

જ્યાં સુધી હૃદય ધબકતું હોય ત્યાં સુધી માનવી જીવંત છે એવી ઓછ સર્વસામાન્ય માન્યતા છે. આથી જ કોઈપણ ભોગે, કૃત્રિમ ઉપકરણો

વાપરીને પણ હદ્યના ધબકારા તાલબદ્ધ ચાલુ રાખવાનો મરણિએ પ્રયાસ કરવાની લાલચ ભલભલા સ્પેશીઆલીસ્ટ પણ નથી રોકી શકતા.

જીવંત રહેવાની, હદ્યને ધબકૃતું રાખવાની લાલસા લગભગ બધી જ વ્યક્તિને ગમે તે ભોગે હદ્યની, હાઈની વધુ પડતી આળપંપાળ કરવા પ્રેર છે. આ જ વૃત્તિને લીધે પ્રત્યેક વ્યક્તિ હદ્ય વિષ વધુને વધુ જણવા તત્પર હોય છે.

ડૉ. મનુ જીપીએ “હદ્ય મંથન”માં હદ્યને લગતી બધી જ વિગતોનો સવિત્તસર ચિત્તાર આચ્છો છે. સ્વાસ્થ્ય જળવવા માટે લેવાતાં રોગ પ્રતિકારક પગલાં એટલાં સખત ન હોવાં જોઈએ નેથી અસ્તિત્વનો આનંદ માણવાને બદલે જીવનની પ્રત્યેક ક્ષણ માંદગી અને મૃત્યુના ભયમાં ગાળી આપણે આપણી પોતાની અને આસપાસની વ્યક્તિનાં સુખ-શાંતિનો સંદર્ભ નાશ કરી નાંખીએ.

માંદગી શરીરનો ધર્મ છે અને મૃત્યુ સમયનો ધર્મ છે એટલું ચાદ રહે તો હદ્યની જાળવણીની હાયપોયમાં આર્થિક રીતે પાયમાલ થતાં કુટુંબોની સંખ્યામાં ઘટાડો જરૂર થશે.

ડૉ. જીપીનાં પુસ્તકોમાંથી ડૉક્ટરો પાસે કચારે જવું ? તેને બદલે કચારે ન જવું, તેની વિવેકબુદ્ધિ, પોતાના હદ્યને નોર્મલ, મજબૂત કે નબળું ગણાતી બધી જ વ્યક્તિને મળી શકશે.

પ્રજ્ઞા પૈ

૧૪-૨-૯૯.

၁ ၄၃၁ နဲ့ အမြတ် အမြတ် အမြတ် အမြတ် အမြတ် အမြတ် အမြတ်

ଛଦ୍ୟନେ କଂୟକ କଣ୍ପୁଁ ଛେ

'હાઈ ટ્રેન' શબ્દ સાંબળીને જ ઘણાં ને 'હાઈ એક' આવી મન્ત્ર છે.

‘આલીકી લયલા’ નેવી રી.વી. સીરીયલોમાં દેખાડવામાં આવતા રામસો - પિશાચો નજર સામે ડાકલાં વગાડતાં દેખાય છે તેમ આ હદ્ય રોગોનાં જુદા જુદા અટપણું ઉપયંગ નામો સંભળી, આવા રાક્ષસો નજર સામે પિશાચિ નૃત્ય કરતા દેખાય છે. એમના માથે રિંગડાં ઉગેલાં હોય છે. લોહીયાળ લાંબી લપકતી લુલ, અને લખડાં હોઠ હોય છે. ડેકે પૌપાણીઓની માળા પહેરી બીજને રીખાવી, એનું દુઃખ જોઈ, ભયાનક હાડપદાટ હાસ્ય કરતા હોય છે.

હાઈ ટ્રબ્યુલના શિર્ખક નીચે મુકી શકાય એવા રોગોની યાદી ઘૂંઘ લાંબી છે અને વાર તહેવારે એમાં વધુ નામો ઉપરોક્તાનું જાય છે.

આ રાક્ષસોની ચૂડમાં બીજાઈને કણસત્તા દઈયોની (એમના શિકાર બનેલાયોની) યાદી તો હવે અંકડાના સિમાડાઓ પણ વટાવી ગઈ છે.

માનવી ને ક્ષણેથી પોતાની જતને બીજ પ્રાણીઓની સરખામણીમાં  
એ અકલલવાળો માનતો થયો તેજ ક્ષણેથી એહે પોતાના શરીરનું રક્ષણ

કરવા, રોગોનો પ્રતિકાર કરવા, બિમારીઓના ઈલાજ કરવા અને મોતને હાથતાળી આપવા વે કંઈ ધમપણાડા કર્યા છે અને એનાં જે કંઈ પરીણામો ભોગવી રહ્યો છે, એ જ પુરવાર કરે છે કે, “હુનિયાના બધાં પ્રાણીઓન નહીં, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવન્તુંઓની સરખામણીમાં પણ માનવી વધારે કંઈ અક્કલ અને બેવફૂફ છે.

માનવીને કુદરતી ઋતુઓ સાથે એડજસ્ટ (Adjust) થતાં પણ નથી આવડતું. ઉન્હાળામાં A.C., શિયાળામાં હીટર્સ અને ચોમાસામાં રેઇનકોટ - છત્રી - ગમબૂટ વગર એનું રક્ષણ થતું નથી. પોતાના જ જનતું રક્ષણ કરવા એને હથિયાર બંધ કર્માન્ડોની ટુકડીઓ રાખવી પડે છે.

રોગોનો પ્રતિકાર કરવા, જેટલા રોગ એટલાં વેક્ટીનો એને બનાવવાં પડે છે. બિમારીઓના ઈલાજો માટે આજની તારીખમાં એની પાસે ફક્ત એલોપેથીની આઠ લાખુથી વધારે ઔષધિઓ પર નભતું પડે છે.

મોતને ધકેલવા માટે, હાથતાળી આપવા માટે, એને પોતાના શરીરના અગત્યના અવયવોની કાપકૂપી કરાવવી પડે છે, હદ્ય, કીડની કે લીવર જેવા સુંદર અવયવો, ઉધાર ઉછીનાં કે કાળા બજાર માં વેચાતા લઈ પોતાના શરીરમાં ફીટ કરાવવા પડે છે.

### પરિણામ ?

માના ગર્ભમાં બાળકને આકાર લેતાં નથી આવડતું. સામાન્ય રીતે જન્મ લેતાં (Normal Delivery) નથી આવડતું. જન્મની ઉછરતાં નથી આવડતું. મોટા થઈને બધી વાતમાં બીજી કોઈની સલાહ વગર ડગલું બરતાં નથી આવડતું. અરે બીજું તો ટીક એના હદ્યને ધબકતું રાખવા પણ એને બીજાની મદદની જરૂર પડે છે.

સામાન્ય બિમારીઓના અતિશયોક્તિ ભર્યા ઈલાજોથી એની અન્ન-પ્રતિકાર શક્તિ ક્ષીણ થવાથી “ઓઈડજ” જેવી ભયાનક બિમારીઓને શરીરમાં લઈ એ જુએ છે, મૃત્યુને હાથતાળી આપવાનું તો બાજુએ રહ્યું, પોતાનું કુદરતી મોત આવે એ પહેલાં એ રીબાઈ રીબાઈને મરે છે.

આ પુસ્તકમાં આપણે ફક્ત હદ્યની જ વાતો કરવાના છીએ એટલે હદ્યને “ધબકતું” રાખવા માટે જ પોતાની જતને હદ્યના નિષ્ણાત Heart Specialist ગણાવતા માનવીઓએ આજ સુધી શું કર્યું છે તે કિર ઉપરથી લેઈ લઈએ, એટલે અંદરખાનેથી શું ચાલી રહ્યું છે એનો અંદરાં આવી જશે.

ડ.સ. ૧૭૭૬માં આંકસફર્ડના બ્રાસીનોસ (Brasenose) ના એક માણસને હદ્યની તકલીફને લીધે સ્નાયુઓમાં પાણીનો ભરાવો (Waterlog) હતો હતો. કોઈ ઈલાજ માફક આવતો ન હતો. શ્રોપશાયર (Shropshire) ની એક ઘરડી ડેરીએ વીસેક જાતના જુદા જુદા મસાલા અને વનસ્પતિના પાંડાં નાંખી એક કિકાળો તેયાર કરી આ સાહેબને પાયો અને એનાથી જોને ઘણો ફાયદો થયો.

હંમેશાં બનતું આવ્યું છે તેમ પેલી દાદીમાનું નામ તો કોઈને યાદ નથી નહીં પરંતુ શ્રોપશાયરના વીલીથમ વ્હીધરીં (William Withering) નામના ડૉકટરે પેલા વીસેક જેટલા વસાણા-મસાલા-વનસ્પતિનું વિશ્લેષણ કી એવું તારણ કાઢ્યું કે એ બધામાં Fox Glove ફેક્સગ્લેવ નામની વનસ્પતિએ જ પેલા હદ્યની બિમારી વાળાને ફાયદો કર્યો છે. આ ડૉકટરને લેટિન ભાષામાં ડિલ્યુલીન (DIGITALIN) કહેવાનું હતું એટલે એ ડૉકટર સહેલ હદ્યના દ્વારા વારસામાં ડિલ્યુલીનસ આપી, ઔષધિઓના ડિલિલાસમાં સુવાર્ણાક્ષરે પોતાનું નામ નોંધાવી (કદાચ હાઈ ટ્ર્યુલસથી જ) ગુજરી ગયા.

૧૯૭૬ થી ૧૯૮૭ સુધીના બસો વર્ષના ગાળામાં ડૉક્ટરો માનવ શરીરના બીજા બધા જ અવયવો કરતાં હદ્યને વધુ ઈજાતથી જોતા હતા. સમગ્ર શરીરની સારવાર કરતાં હદ્યને ભૂલે ચૂકે પણ નુકશાન ન થાય એની તકેદારી રાખતા હતા અને હદ્ય ખુદ રોગિઓ હોઈ શકે તે હોય તો એનો ઈલાજ થઈ શકે એ વાત સામાન્ય રીતે કબૂલ કરવામાં આવતી ન હતી. હદ્યને સીધે સીધું અખતરા કરી કે એની સાથે ઈલાજેના નામે રમત રમવાનું સાહસ ભાગે જ કરવામાં આવતું. કારણ ?

કારણ ત્યાં સુધી, કોઈ મેડિકલ કોલેજેએ જથ્થાબંધ રેશેશીઆતીસ્થે હદ્ય રોગોના નિઝાતો પેદા નહોતા કર્યા. અને જે કંઈ ગણ્યા ગાંધ્યા પોતાની જતને હાઈ - રેશેશીઆતીસ્થ કહેવાવતા તે બધા જ હદ્ય નામના અવયવને ખૂબ જ માનભરી અહોભાવની નજરે જોતા હતા.

હદ્ય નામના 'હેવી' કહી શકાય એવા અવયવ પર આફ્ટોના આક્રમણ થવાની શરૂઆત ૧૯૮૭ થી થઈ.

CHRISTIAAN BARNARD ફીસ્ટીયન બન્ડિના ડૉક્ટરે, સાઉથ આફ્રિકાના કેપ-યાઉનના રહેવાસી ત્રેપન વર્ષની ઉમર ના લુઈ વાશ્કાન્સી (LOUIS WASHKANSY) પર સર્વ પ્રથમ હાઈ ટ્રાન્સ્પલાન્ટ (HEART TRANSPLANT)નું આપોરેશન કર્યું - તે ઘડીને આજનો દિવસ.

બન્ડિના આ પરાક્રમના સમાચાર આખી દુનિયાના પ્રચાર માધ્યમોએ જેર શોરથી દોલ - નાસાં પીઠી પીઠીને કર્યા. બ્યુગલોને લાઉડસ્પીકરોનાં ભૂંગળાં વાગ્યાં, કાન કુટી જય ને મગજ બેર મારી જય એટલા જેરથી એક જરૂરી ચમત્કાર થવાનું જહેર કરવામાં આવ્યું.

બન્ડિ તો નામ કર્માઈ ગયો. રાતો રાત હીરો બની ગયો. પણ બલિનો બકરો બનેલા પેલા લુઈ વાશ્કાન્સીનું શું થયું ?

એ કોઈને કહેવામાં કોઈને ય રસ ન હતો. જ્યાં જ્યાં ન છૂટે કહેવું પડે તેવું હતું, ત્યાં ત્યાં ગુસ્પુસ કાનમાં કહેવાયું, મેડિકલ જર્નલોમાં, છાપાઓમાં, મેગેઝીનોમાં બે ચાર લીટીમાં ક્યાંક ખૂશો ખાંચે એની નોંધ લેવાઈ - વંચાઈને સગવડ પૂર્વક ભૂલાઈ પણ ગઈ.

'હદ્ય મંધન' તમારી સમક્ષ રણુ કરવા બેઠો છું. એટલે એ લુઈને પેલા બન્ડિ જેટલો જ નજીકથી ઓળખવો જરૂરી છે. એટલે આવો 'ફ્લેશ બેક'માં એને ફ્રી એકવાર જેરી લઈએ.

કાઈ-ટ્રાન્સ્પલાન્ટના બરાબર અઠારેમે દિવસે લુઈ વાશ્કેન્સી મરી અયો.

જેટલાં દોલ આપોરેશનનાં પીઠયાં એની સરખામણીમાં કોઈએ લુઈના અરખરામાં 'ઉહ્કારો' સુધ્યાં ન કર્યો.

ડૉક્ટરની ગોળ ગોળીઓ ભાખામાં એમ કહેવામાં આવ્યું કે "લુઈના રાસીસમાં રોપેલું હદ્ય પંદર દિવસ ધબકયું" (એટલે કે આપોરેશન સફળ થયું) પછી સોળમે દિવસે લુઈને ન્યુમોનીયા થયો અને પછીના ત્રણ દિવસમાં એ ન્યુમોનીયાથી મરી ગયો" (પેલું ઉધાર લઈને લાખો ડોલરના અંદે નીટ કરેલું હદ્ય બંધ પડવાથી નહીં)

આખું તો ન છૂટે કહેવું પડે એટલે ગુસ્પુસ કહી દીધું પણ ખરેખર બીજો પાડીને જે કહેવું જેરી હતું તે તો એ હતું કે

"લુઈનું પોતાનું બગડેલું હદ્ય એમને એમ ધબકવા દીધું હોત તો એ ટ્રાન્સ્પલાન્ટ પછીના અઠાર દિવસ જીવ્યો એ કરતાં ધણો વધારે એટલે કે બીજાં અઠાર વરસ પણ જીવ્યો હોત. અને હા... એના

ઓપરેશનનો જે બે ગ્રામ લાખ ડૉલર ખરચો આવ્યો તે પણ બચી ગયો હોત."

પરંતુ પેલા બનાડો અને એમના એજન્ટો આવું બધું બોલતાં શરમાય છે અને એમને બોલવુંથી હીય તો એમને ઘોળે બેસાડી પંપાળનારાઓ એમનાં મોઢાં દાબી હે છે. લુઈ મરી ગયો છે એટે એ બોલી શકવાનો નથી એ બધાંને સારી રીતે ખબર છે.

એટે પરિણામ જે આવવું જોઈએ તેજ આવે છે.

બનાડી કેલાં ઓપરેશન પછી રાતો રાત દુનિયાભરમાં હાઈ સ્પેશિયાલીસ્ટોનો રાફ્ટો ફાટી નીકળ્યો. આકાદે મધુ જે લાગ્યું હતું ? અને બિલાડીના દેપની માફક રાતોરાત કુઠી નીકળેલા આ નિષ્ણાતોને લુઈ જેવા અનેક બકરાઓ પેલી દોલ ત્રાંસાની જહેરાતોના જવાબમાં મળી જવાના જ હતા.

DEMAND & SUPPLY માંગ અને પુરવઠાના નિયમ પ્રમાણે

વધુ હદ્યરોગના નિષ્ણાતો = વધુ હદ્યરોગની બિમારીઓ

વધુ બિમારીઓ = વધુ જલદ ઈલાજે

વધુ જલદ ઈલાજે = વધુ ઈલાજેનાં રીએક્શનો + હદ્યની કમનેરીઓ

વધુ હદ્યની કમનેરીઓ = હદ્યનાં વધુને વધુ ઓપરેશનો

વધુ ઓપન હાઈ સર્જરી = વધુને વધુ મૃત્યુ (દ્વારાઓનાં જ વળા)

બનાડીના હાઈ દ્રાન્સ્પલાન્ટ ઓપરેશન પછી ફક્ત એક જ વરસમાં સતત જુદા જુદા દેશોમાં કુલ નવ્યાણું હાઈ દ્રાન્સ્પલાન્ટ થવાનું નોંધાયું. ૧૯૭૦ એટે ત્રણ વરસમાં એ આંકડો ઉપર સુધી પહોંચી ગયો.

આ આંકડામાં નોંધાયા વિનાનાં કેટલાં દ્રાન્સ્પલાન્ટ થયાં એની ફોઇન ખબર નથી. એ તો સારું છે કોઈ કે આ નોંધાયેલાં ઓપરેશનોમાં કેટલાં સફળ થયાં એની નોંધ લેવાની કાળજી રાખી છે.

હદ્ય મંથનના આ પુસ્તકમાંના લખાણના સમર્થનમાં આ આંકડાનું મહત્વ વધું છે એટે ખૂબ વિચારપૂર્વક એ વાંચવાની વિનંતી કરું છું.

બનાડીના દ્રાન્સ્પલાન્ટ પછીના એક વરસમાં જે નવ્યાણું ઓપરેશનો થયાં એ બધા જ દ્વારાઓ ઓપરેશનની તારીખના ત્રણ મહિનાની અંદર જ મરી ગયા. ૧૯૭૦ સુધીમાં જે ઉપર ઓપરેશનો થયાં એના સિસ્ટેર લા માંના કેટલાક વધુમાં વધુ એક વરસ જીવ્યા (એટે કે ઉપર માંના મૌલા બાળના ગણતરીના દિવસોમાં, થોડાક બે ચાર મહિના અને જૂદી ગાળા ગાળા એકાદ વરસ જીવ્યા) આ નોંધમાં બાકીના ત્રીસ છાન્યું શું થધું એ જણાવવામાં આવ્યું નથી પણ મેડીકલ શાસ્ત્ર એવી વાતો જહેરમાં ફોઇન નથી એટે આવો આપણો આપણી અકકલ પ્રમાણે એ ત્રીસ છાન્યું જુદું એ સમજી લઈએ. ઉપર માંના ત્રીસ છા દ્વારાઓ એટે કે એકસોને પાંચ દ્વારાઓ ઓપરેશન ટેબલ પર જ મરી ગયા. આપણો હિસાબ ચૂકતે શરૂઆતી ચોખવટ કરવી જરૂરી છે. ૧૯૬૭ થી ૧૯૮૬ના ફક્ત ત્રીસ વરસમાં ગાળામાં આખી દુનિયાની ફીકરના કરીએ, ફક્ત આપણા મુંબઈ રહેણની જ વાત કરીએ તો ?

- (૧) હાઈ સ્પેશિયાલીસ્ટોની સંખ્યા કેટલી ?
- (૨) હદ્ય રોગો કેટલી જાતના થાય છે ?
- (૩) હદ્ય રોગનાં નિદાન કરવા માટે કેટલા કરોડ રૂપિયાના મરીનો અહીં લવાય છે ? એને ઉપયોગમાં લેવાય છે ને નિદાન કરવા જાતાના કેટલા પેસા વપરાય છે ?

- (૪) નિરાન થયા પણી જુદા જુદા રોગોના ઈલાજે કરતી કેટલા પ્રકારની દવાઓ વેચાય છે ? એના વાર્ષિક વેચાણનો આંકડો કેટલો ? (ફક્ત એલોપેથીની જ વાત કરીએ)
- (૫) ઑપન હાઈ સર્જરીનાં કેટલાં ઑપરેશનો રોજનાં થાય છે ?
- (૬) અને આ ઓપરેશનો કરાવેલા કેટલા દર્દીઓ કેટલું જવે છે ?

આ ગણતરી કરવા સુપર કેલ્ક્યુલેટર્સ પણ નકારામાં પડે એટલો આ રોકડીયો ઉધોગ કુલ્યો ફાલ્યો છે. I.C.U. ને હળવી ભાષામાં “હું તને જેઈ લઈશ” કે “ઈન્સ્ટન્ટ ડેશ યુનીટ” તરફક ઓળખવામાં આવે છે.

ઉપરના પ્રશ્નોના જવાબ તો કોઈની પાસે નથી પરંતુ તમને કુતુહલ થતું હોય તો પણ્યમના દેશોના આ આંકડા વાંચી એનો અંદાજ બાંધી શકો છો. પણ્યમના દેશોમાં ફક્ત હાઈ-ડ્રાન્સ્પ્લાન્ટ કરાવવા તેથાર થઇને બેઠેલા ૨૦ થી ૩૦ હજાર દર્દીઓ દર વર્ષે પોતાનું નામ નોંધાવી રાખે છે. કીડીની જેમ હાઈ કાળાબજારમાં મળતાં નથી અને પ્રેર્ફિન ડેથ પામેલાની સરખામણીમાં આ માંગ ઘણી ઉચ્ચી છે એટેલે COMA ના પુસ્તક ને પીકચરમાં બતાવાય છે તેવી મેઠીકલ એથેક્સ બ્યાબ્સાથિક નિતિ નિયમોની એસી તેસી કરી વેપલો કરનારા ડૉક્ટરો અને તમને મદદ કરતી હોસ્પિટ્લોનો એક જુદો જ રાફડો ફાટી નીકળે છે.

આવા એક જ ઓપરેશનનો ખર્ચ (બ્લાઇટ એન્ડ બ્લેક) બે થી પાંચ લાખ ડાલરનો થાય છે અને ઓપરેશન પણ્યાત લેવામાં આવતી દવાઓની કિંમત ૧ થી ૨ લાખ ડાલર જેટલી આંકડવામાં આવે છે.

૧૯૬૭ વાગા બનર્ડિના “હદ્ય એક કમબેર અવયવ છે અને અમે (એટે ડૉક્ટરો - નિષ્ણાતો) એને ધબકતું રાખવા સર્વશક્તિમાન છીએ

અનુ અમને રેસા આપો તો જુનુ પુરાણું હદ્ય કાવીને કચરા દેપલીમાં (બંગારમાં) નાંખી, સાવ નવેનવું ફીટ કરી આપીશું” એમ દાવા કરવાની બાબત કરી આજની તારીખમાં પેલા લાઈનમાં ઉલેલા વરસના વીસથી નીચ કાંઈ ઉમેદવારોમાંનો એક પણ દર્દી ખુદ પોતે ડૉક્ટર છે ખરો? મુખ્ય જેવા શહેરમાં તમારા પોતાના જ વર્તુળમાં કોઈને કોઈ તો અહ્યાડીએ બે વાર કાડીઓગ્રામ કઢાવતો હો, સોરબીટ્રની ગોળી ખીસામાં લઈને ફરતો હો, અન્યુયોપ્લાસ્ટી, વાલ્ય રીપ્લેસમેન્ટ કે બાબુ પણ કરાવી ચુક્યો હો, પેસ મેકર નેસાડી ફરતો હો - આમાંલો કોઈ એકાદ દર્દી પણ ડૉક્ટર ખુદ પોતે છે ખરો?

માઝ દર્દીઓનું સર્કલ હજરોનું થવા જથું છે અને ઓળખીતા પાળખીતાઓનું પણ સાવ નાનું વર્તુળ તો નથી. પરંતુ મેં હજુ સુધી હાઈન્ડ્રબલ થઈ હોય અને એને માટે હજારો ઇપિયા ખર્ચી ઈલાજ કરાવતો હોય કે લાખો ઇપિયા ખર્ચી ઓપન હાઈ ઓપરેશનો કરાવ્યું હોય એવો એક પણ - રીપીટ એક પણ ડૉક્ટર જોયો નથી. હું તો એવા નિર્જર્ખ પર આવ્યો છું કે “ભગવાને આ દુનિયામાં એક ડૉક્ટરને છોડીને બધા જ માનવીઓનાં હદ્ય કમનોર બનાવ્યાં હોય એવું લાગે છે. હદ્ય ડૉક્ટરને બનાવતી વખતે એહો એનું હદ્ય કોઈ સ્પેશીયલ પત્થરમાંથી ઘડકું હોય તો કહેવાય નહીં....

મને જે લાગે છે તેવું હમણાં હમણાં બીજાઓને પણ લાગવા માંયું છે. અંદરોઅંદર વાતો થાય છે, છાપાઓમાં કેસો હેડલાઈનમાં છપાય છે, જવાબદી ડૉક્ટરોને ધમકીઓ અપાય છે, કોરટમાં ધસડી જવાય છે, ડૉક્ટરના ધંધાને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ લઈ જવામાં આવે છે, સરકાર નપૂંસક કાયદાઓ પસાર કરે છે.

પણ આ તો આખલું ફાયું છે. આવા ટેટલાંય થીગડાં દેવાશે તો ય હવે કંઈ વળવાનું નથી. રોજ ડનના લિસાબે નવા બનાડોને પોર્ટરો પેદા થાય છે, હદ્યને જુદા જુદા ભયાનક બિહામણા મહોરાં પહેરેલા પિશાચી-રાક્ષસો લેવા રોગો ખાઈ જવા તત્પર થઈને બેઠા છે એવું માનવીના હદ્યમાં ઢોકીને ઠસાવી દેવાય છે. પોતાના હદ્યને કમનેર માની લેતી લોળી પ્રજામાંથી બીજા લાખો લુઈ રોજ શરીર પર પરવાના જ્યે તેમ ઓપરેશન ટેબલ પર સુઈ જાય છે ને.....

આધેર હેઈલીની ઘ “ફુયનલ ડાયાનોસીઝ” કે ફેન્ક જી સ્લોટની “ઘેટ નન શુડ ડાય” નેવી ચોપડીઓમાં તમે ગેડીકલ માલપેક્ટીસીસ વિચે વાંચ્યું હોય. આપણે એવા વાચનમાં કોઈ વધારો કરવો નથી. વળી આવું વાંચવાથી આપણને જે હદ્ય સાવ કમનેર છે એમ ઠસાવમાં આવ્યું છે તે હદ્ય કંઈ મજબૂત બની જવાનું નથી, આપણને બતાવવામાં આવતી પેલા હદ્ય રોગના રાક્ષસોની બ્હીક કંઈ ઓછી થવાની નથી કે આપણા જ હદ્ય પરથી ગુમાવેલો વિશ્વાસ આપણે પાછો મેળવી શકવાના નથી. વળી ફ્લાઝો ચોર છે એણે ચોરી ન કરવી જેઈએ એમ કહેવાથી ચોર સુધરવાનો નથી કે ચોરી થતી અટકવાની નથી. ચોરને સુધરવો કદાચ શક્ય નથી પણ જે લુંટાય છે તેને સાવધાન તો જરૂર કરી શકાયછે.

આ પુસ્તકના હવે પછીના પાને પાને અને લીટીએ લીટીએ હું આ કાર્ય કરવાનો સભાનપણે પ્રયત્ન કરી રહ્યો છું. ‘અવયવ દર્પણ’ નામના પુસ્તકથી શરૂઆત કરી આજ દિવસ સુધી લખાએલાં બધાં જ પુસ્તકોમાં આ એક જ દ્રાચ્ચિકોણથી રન્જુઆત કરવામાં આવી છે.

(૧) શરીર અને એના અવયવો તમને જેવા બતાવવામાં આવે છે ટેટલા કમનેર, માંયકાંગલા કે રોગિઝ નથી જ નથી.

(૨) વિવિધ પ્રકારના રોગો કે બિમારીઓની કે બિહામણી વિકૃત રન્જુઆત થાય છે એમાં પણ પાર વિનાની અતિશાયોકિત હોય છે અને હેઠાં રોગની પોતાની એક સૌખ્ય, અસલ ઉજ્જવળ બાંજ હીએ એ બૂલમાં પણ બતાવવામાં આવતી નથી.

(૩) હેઠાં બનાવવાનારો (કોઈપણ થેરેપી વાળો હોય) પોતાની દવા અમૃત રોગમાં અક્સીર છે, ખૂબ ખૂબ ફાયદા જ કરે છે. એમ જ દવાવા પ્રયત્નશીલ હોય છે અને પરીક્ષામે પેલા રોગથી બ્હી ગમેલ દર્દી સારા સારનો વિવિધ રાખ્યા વિના દવાઓનું સેવન કરવા ઉત્તાવણો થઈ જાય છે.

આ જાણ મૂળજૂત હ્યુક્ટોને નજર સમજ રાખી હું ખૂબ જ જાણાબાતી પૂર્વક શરીરની અદ્ભૂત કાર્યક્રમિતનું યથારાક્તિ વર્ણિન કરું છું. રોગોની જાપાનકતાનો અંચળો ચીરી એનું અસલ સૌખ્ય સ્વરૂપ બતાવું હું અને દવાઓના ફાયદાના દાવાઓ ટેલા પોકળ છે અને દવાઓ કેવા અધારક પરીક્ષામો લાંબી શકે છે એ સામાન્ય માનવી સમજ રક્ત તેવી જાળ બાધામાં રન્જુઆત કરવા પ્રયત્ન કરું છું.

હદ્ય વિચે તમને જે કંઈ જણાવવામાં આવે છે, એ બધું જ તમને જાણું લાગતું હોય, તમારું હદ્ય તમને પોતાને કમનેર માંયકાંગલું કે રોગિઝ લાગતું હોય, કાર્ડીઓગ્રામની પછી પર અક્સીલા આડાઅવળા લાંબાખૂબા લીધા તમારા હદ્યને રોગિઝ પુરવાર કરવાનું એક ખાતી પૂર્વકું અરીસાપાત્ર સાધન છે એવી તમારી દ્રદ માન્યતા હોય, તમારા હદ્યને જાતત પબકું રાખવા માટે દવાઓ ખવડાવવાની જરૂર છે, લાખો ડ્રિપિયાના ખર્ચ કરવામાં આવતાં આપોરેશનો તમારા હદ્ય વધુ મજબૂત બનાવરો, જાવ રોગ મુક્ત કરી તમને સામાન્ય, તંહુરસ્ત સુખી (Normal Healthy) જીવન જીવવામાં મદદ કરશે. આ અને આવું બધું તમે સાચું જ માનતા

હો, તો શરાતમાં જ કહી દઉં કે આ પુસ્તકનું લખાણ તમને રતીભાર પણ ઉપયોગી નહીં થાય.

પરંતુ મારી અગાઉ જણાવેલી વાતમાં કંઈ તથ્ય લાગતું હોય, હદ્યને વગોવતી નિષણાતોની વાણીમાં તમને સ્વાર્થ અને ગેરમાર્ગ દોરવાના પ્રયત્નની બદલું આવતી હોય, તમારી સામાન્ય બુધિ Common Sense ને જે કંઈ થઈ રહ્યું છે એ ન થવું જોઈએ એવું લાગતું હોય, તમારામાં જે કંઈ સ્વ-નિષ્ણિય શક્તિ છે, સારા સારનો વિવેક છે, એને ઉપયોગમાં લઈ, સિક્કાની બીજી બાજુ જેવાની, સમજવાની, વાંચીને વિચારવાની તૈયારી હોય તો -

તો વિના સંકોચે આગળ વાંચો.

આમાં જે કંઈ લખાયું છે તે મારા જ હદ્યના ઉડાણમાં ઉદ્ભવેલા સ્પંદનોમાંથી નિપણું છે. જે કંઈ લખાયું છે એમાં એક Conviction દુદ સંકલ્પનું આત્મબળ છે. ઉડાણપૂર્વકનો આ વિષયનો અભ્યાસ ને અનુભવ છે અને ભરપુર મનન અને મંથન છે.

આ પુસ્તકના લખાણનો અક્ષરે અક્ષર વાચકના જીવનમાં ડાઢેને પગલે ઉપયોગમાં આવે એ હેતુથી લખાયો છે, લખાઈ ગયો છે.

“હદ્યના રોગી” તરીકે સિક્કાની મારેલા દાદીઓમાંનો હું પણ એક છું અને અને નિષણાતો દ્વારા જે કંઈ કરવાનું કહેવામાં આવે તો એ વેળાએ મારું પોતાનું હદ્ય શું કહે ? એ ભાવોનું પ્રતિબિંબ હદ્ય મંથનના આ પુસ્તકમાં છે. તમારા હદ્યમાં આ ભાવોનું પ્રતિબિંબ પડશો તો મારી યાત્રા ફળશો.

**શેઠને વાણોતાર નો  
આ સંઘ કાશીએ ના પહોંચે**

અલ્લાખરાય છેલ્લાં પચાસ વર્ષથી શેઠ શંકાલાલની પેઢીના વફાદાર, નિષાય મેતાળ તરીકે નોકીની કરી રહ્યા છે. શેઠનો લાઘો કરોડોનો વેપાર ને હિમાનારીથી સંભાળે છે. એક પર્દનું પણ નુકસાન એમણે કદી થવા હીથું નથી. શેઠના દેશ પરદેશના સોદાઓ એમણે અત્યંત કાળજીપૂર્વક હુલાળાથી નિપટાવ્યા છે. રાત્રિ અને દિવસ પોતાનો કોઈપણ સ્વાર્થ નોયા વિના એમણે ફક્ત શેઠનું જ બલું ઈરછાયું છે. કદી રજન લિંગી નથી, કદી આરામ છોડો નથી, કોઈ પગાર વધારો માંગ્યો નથી, ક્યારેય કામચોરી નથી, ક્યારેય સ્વભાવમાંથી બેઈમાની કરી નથી, કોઈ હડતાલ કરી નથી. એક દિવસ તો શું એક મિનિટની પણ કદી છુટી માંગી નથી અને

આ બધું એમણે પોતાની એક ફરજ સમજને કર્યું છે અને એમણે અપેક્ષી રેવાની બદલીમાં શેઠ પાસેથી એમણે કદી પણ ઠાલા - “માઝું”ની પણ અપેક્ષા રાખી નથી. આવા વફાદાર, જવાબદાર કાર્યક્ષમ અને નિષાય દલસુખરાયને એક દિવસ શેઠ શંકાલાલે સાવ સહજ રીતે જાણ રહી મોં પર તમારો મારીને અપમાનપૂર્વક કહી દીધું.

"દલસુખીયા, તું હરામખોર, બેઈમાન, વિભાસઘાતી, કામચોર,  
બેજવાબદાર, લુચ્ચો, લંઝો અને બદમાસ આઈથી છે. મને તારા ચારિન્ય  
પર બરપૂર શંકા છે, તું શું કે છે તેની તપાસ કરવા મેં જસુસોને રોકી  
દીધા છે. તને જરાય કામ કરતાં આવડતું જ નથી, મારે તને કેમ કામ  
કરવું તે નવેસરથી શિખવાડવા માટે નિષ્ણાતોને બોલાવવા પડ્યો એ તને  
ધંધો કરતાં શીખવરો, સોદા કરતાં શીખવરો, નોટે ગણતાં ને ચોપડા  
લખતાં શિખવરો અને એમ છિતાંય જે તું નહીં સુધરે તો તને બાય પાસ  
કરી બીજા ફાલતું ચમગાને મે'તાળ બનાવી દઈશું ને તોથ તને અક્કલ  
નહીં આવે તો ? તો... તને ધક્કો મારી નોકરીમાંથી પાણીચું આપી તારી  
જગ્યાએ નવો નક્કોર બીજો દલસુખ ફીટ કરાવી દઈશું - શું સમજયો ?"

જે દિવસે તમને કાઈઓગ્રામ કદાવવાની દુખુંદિધ સૂઝે છે એજ જાણેથી તમારો અને તમારા હદ્ય વચ્ચેનો અતૃપ્ત સંબંધ તૂટવાના શ્રી  
ગણેશ મંડાઈ જય છે. તમારા અને તમારા હદ્યની વચ્ચે રહેલો એકબીજા  
પ્રચેનો વિભાસ તૂટી જય છે. શંકાના બીજ રોપાઈ જય છે. તમે અને  
તમારા હદ્યે છેલ્લા ખાસ સુધી એકબીજાને વફાદાર રહી તાલખદ્ધ જીવન  
જીવવાના આપેલા કોલ તૂટી જય છે.

વળી પાછા પેલા દલસુખરાય અને એમના રોઠ શંકાલાલની વાત  
કરીએ. પચાસ વર્ષની એકધારી વફાદાર સેવાઓના બદલામાં જ્યાં એમને  
"આભાર"ની પણ અપેક્ષા ન હતી ત્યાં જ્યારે રોઠ શંકાલાલે એમનું જે  
રીતે હડહડતું અપમાન કર્યું, ત્યારે દલસુખરાય પર શું વિન્યું હો એની  
તમને કલ્પના આવે છે ?

શું આવા નગુણા રોઠ પ્રત્યે એમને અનહૃદ ધૂણા - ધિક્કાર કે  
તિરસ્કાર થયો ? શું એમને આ નાલાયક રોઠની બૂરાઈનો બદલો બૂરાઈથી  
વાળવાનું મન થયું ? પચાસ વર્ષની નોકરીમાંથી રાજનામું આપી ક્યાંક

નીં આવી જવાનું મન થયું ? કે ઘવાએલી લાગણીઓના પ્રવાહમાં  
જાનખૂલી આત્મહત્યા જેવું અંતિમ પગલું બરવા દલસુખરાય પ્રેરાયા ?

જે દિવસે તમે કાઈઓગ્રામ કદાવ્યો તે જ જણે તમારું હદ્ય આ  
નાં જ જવાનું શક કરી હે અને જો એ એવું કરે તો એને રા પણ દોષ  
ન હેલાય, એમાં વાંક ફૂલ તમારો જ છે.

જારણા ?

તમે જ તમારા પોતાના હદ્યને "કોઈકના કહેવાથી" નબણ્ય,  
અને, રીતિએ અને બેઈમાન માની લીધું છે એને કેમ ધબકવું કેવી રીતે  
સંપત્તિ અને તમને કેવી રીતે જીવાડવા એ શીખવવા માટે સ્પેશીઆલીસ્ટે  
નોંધોઈન કરી દીધા છે. તમારું હદ્ય કામચોર છે, તમને જીવાડવાનું કાર્ય  
જ્ઞાન કરતાં ક્યાંક ગોટયા કરે છે, તમારા ધંધાને નુકશાન કરે છે પોતાનાં  
નિયમાં બારે છે એમ માની તમે જાતજાતના જસુસોને લાખો ઇન્ડિયાની  
ની આપીને એમની પાછળ જસૂસી કરવા કાગે લગાડી ધો છો -

ત્યારે પણ હદ્ય - પેલા દલસુખરાય - વધુને વધુ ફુઃખી થાય  
ના, એમાં એનો વાંક નથી ને નથી.

તમારા ધંધાને ચલાવવા ઈમાનદાર દલસુખરાયની મદદમાં કોઈ  
અનુભૂતિ-અમાનાને બાય-પાસ તરીકે નિમશો તો એ તમારું બેંક - બેલેન્સ  
ના બાય-પાસ કરી એના, ખાતામાં જમા કરાવવો. દલસુખરાયને  
નોકરીમાંથી છાડી મુકી એની જગ્યાએ કોઈ હન્દનપાલને દ્રાન્સ્ટ્રલાન્ડ કરશો  
તો હાયુખરાય તો તમારા જેવા નગુણા રોઠની ચૂંગાલમાંથી છુટી સુખી  
મહી નવી પણ પેલો હન્દનપાલ તમને થોડા દિવસ થન-થના-થન નચાવી  
નાપમના મેકાણે કરી દેશે.

ત્યારે પણ વાંક તમારો જ છે. દલસુખરાયનો નહીં. આવું કઈ તમારા અને તમારા હદ્ય વચ્ચે શક થઈ ચૂક્યું હોય, કોઈએ તમારા બે વચ્ચે અવિષ્ટાસના શંકાના બીજા રોપી દીઘાં હોય તો દલસુખરાયને તમારા દિલને, હદ્યને તમારે એના અસલ રૂપમાં ઓળખવું પડે - ઈચ્છા છે ? તો આવો એ વફાદાર અવયવની અસતી ઓળખ આપું.



મુક્કી જેવડી સાઈઝનું, ફક્ત પોણો રતલ વજન ધરાવતું હદ્ય, સમગ્ર શરીરમાં રક્તબ્રમણ કરવામાં, એક હિવસમાં જેટલી શક્તિ વાપરે છે, એટલી જ તાકાત (ENERGY) થી જાઈ કીલો વજનવાળા માનવીના આપા શરીરને સીધે સીધુ જમીનથી એક માઈલ જેટલું અદ્ધર ઉચ્કી શકાય. પચાસ વર્ષની ઉચ્મર સુધીમાં હદ્ય જેટલી શક્તિ વાપરી ચૂક્યું હોય છે તેટલી તાકાતથી આપા શરીરને રોકેટની માફક અદ્ધર ઉડાડી બ્રમણ કષામાં સેટેલાઈની માફક ફરતો કરી દેવાય - તમે કથા હદ્યને કમનેર કહો છો ?

### ૩

કોણ બેવકૂફ કહે છે

કે દલસુખરાય કામચોર છે ?

આપું મેડિકલ શાખા માનવીને જીવવામાં મદદગર છે કે જીવવામાં મદદગર છે, એ તમારો ડૉક્ટર તમારું ડાયગનોસ્ટીસ કરે છે કે કે પ્રોગ્નોસ્ટીસ હો છે એ પર આધારિત છે.

DIAGNOSIS એટે સ્પષ્ટ, સચોટ, સાચું નિદાન અને પ્રોગ્નોસ્ટીસ DIAGNOSIS એટે ઘણું બધું ન કરવા નેચું.

ઉદ્દેશાઃ : લાવોને એક કાડીઓગ્રામ કટાવી લઈએ. ને હોં તે પુષ્પા પડી જીઓ, કર્મલીટ ચેક અપ કરાવી લ્યો. ડાયાબીટીસ પણ હોય. જીજાનો કલાબથો સારો - ડી.બી. પણ હોય.

ખાડ પ્રેશર નીચું ન લાવો તો હાઇટ્રોબલ થાય, સેરેબ્રલ હેમરેન થામ કે કીઢાની પણ કેરીલ થાય.

જાઓ છો ? કેન્સર હોય - વધી જાય, ઔપરેશન કરાવી લ્યો, જાઓ જાઈ લ્યો, દવાઓ આવ નહીં તો વધી જશો... કે જીજાનોંબાંદું જીજાનોંબાંદું હોય નાના હોય નાના

ટૂંકમાં તમારી બિમારીનું સચોટ, સ્પષ્ટને સાચું નિર્દાન થવાને બદલે શરૂઆતથી જ કોઈ મોટી બિમારીના બયનું બીજી તમારા મનમાં રોપી હેવાય. એકવાર તમારા મનમાં શંકાનું બીજી રોપાય એટે મનવ સહજ સ્વભાવથી દર્દી, ડૉક્ટર જે કહે તે કરવા ત્યાર થઈ જય. જાત જાતના રીપોર્ટો કદાવાય, જાત જાતની દવાઓ અવડાવાય, અને શું થઈ રહ્યું છે એ સમબન્ધ તે પહેલાં તો એકાદ બયંકર બિમારી લાગુ પડી ગઈ હોય કે નાનું મોટું આંપરેશન પણ થઈ ગયું હોય.

ડૉક્ટરનો અભ્યાસ અને અનુભવ કોઈપણ રોગનું સ્પષ્ટ નિર્દાન કરવા પુરં છે. કોઈપણ તપાસ �Investigation, ફક્ત એ ડૉક્ટરના નિર્દાનને સાચું છે કે ખોટું છે એ પુરવાર કરવા માટે જ કાદવામાં આવું જોઈએ, જેથી “ડૉક્ટર પણ માણસ છે. ભૂલને પાત્ર છે” એટે રોગ નક્કી થયા પછી જ એની સારંવાર થાય એ હેતુથી જ જુદા જુદા રીપોર્ટો કદાવાય. ફક્ત શોખ ખાતર, ઝુંઠિયારી બતાવવા દળસાંધ રીપોર્ટ કદાવાથી દર્દીના નાણાંનો બ્યય તો થાય છે જ, પણ વધુ ભયાનક નુકશાન એના મનમાં એક બધ ઉભો થાય છે તે છે. વળી કોઈપણ રીપોર્ટ સાચો છે કે ખોટો એ પુરવાર કરવાનું કોઈ સાધન છે જ નહીં કે નથી કોઈ કોસ ચેકિં થઈ શકતું. પેશાન્ટ પોતે પોતાનો જ કાડીઓગ્રામ, એકસ રે, સોનોગાફી જેઠીને કશું જ સમજી શકતો નથી કે લેનોરેટીમાં આપેલ લોહીનો રીપોર્ટ સાચો છે એ ખાતીપૂર્વક કહી શકતો નથી. પરિણામે દર્દી, ડૉક્ટરો અને તપાસ કરી રીપોર્ટો આપનારી દયા પર છુંબવા મળબુર થઈ જય છે.

હૃદયની બિમારીઓના, બાય પાસ આંપરેશનોના અને હાઈ પ્રાન્સ્ફલાન્ટના જે આંકડાઓ હુનિયાબરની હોસ્પિટ્લોમાં આપવામાં આવે છે તે એક વાત ખૂબ જેર શોરથી પૂરવાર કરે છે કે આ લાખો, કરોડો

જીં પોતાનાંના એક છો પણ ખરેખરા પેશાનો છે કે નહીં એ પુરવાર જીં માટે શોરી પાસે કોઈ સાધન છે જ નહીં... અને એટે ?

જો તમણે પોતાને અથવા તમારા પોતાના આપણનોમાંથી કોઈને જીંના રોગી તરીકી લેબલ લગાડવામાં આવે તો તમે ખરેખર પેલો હૃદયના તમને બેવફા છે કે નહીં તે તો જાણી જ લ્યો, સાથે સાથે જી કોઈ વધારાર છે એ પણ સાથ સ્પષ્ટ પણે ઓળખી લ્યો - જેથી જીંના અને તમારા હૃદય વચ્ચે દુશ્મની ઉભી કરવા કોઈ કામિયાબ ન હિન્દે.

### આ છે તમારું હૃદય - તમારું પોતાનું જ હૃદય.

- (૧) એનું વજન તો છે ફક્ત પોણો રતલ (૧૨ આઉન્સ) અને ઘણાં તમારા ૫૦ થી ૮૦ કિલો જેલ્ટા વજન ધરાવતા શરીરને એ શુદ્ધનાર ધબકતું રાખે છે. - જીવાડે છે.
- (૨) હૃદય એક પર્ય છે એમ જે તમને કહેવામાં આવ્યું હોય તો એ જોનારે ‘હૃદય શું છે?’ તે અભર નથી. અગર એ પર્ય જ છે તો એ એક અદ્ભૂત પર્ય છે. એને કુ ઈન વન Two-in-One કોહેવાય તેવો જેઠીયો પર્ય છે. એ જેઠીયા પર્ય ધરાવતો આ એક બેબો અવયવ છે જે એક સાથે એક બાજુ અશુદ્ધ લોહી ફોલામાં ધકેલ છે તો બીજુ બાજુ શુદ્ધ લોહી શરીરની ભમણ ફોલામાં ફેલાવે છે.
- (૩) પગની પાનીથી માથાના વાળ સુધી પથરાએલી જે રહેતપાતીનીઓમાં આ લોહી ફેર છે એના છેડા જેડી લંબાઈ માપવામાં આવે તો એ ૧૦,૦૦૦ સાઈટ હજાર માઈલ (કુટ નહીં) જેડીની લાંબી થાય છે.

- (૪) એક જ દિવસ અને રાત્રિના ચાવીસ કલાકના સમય દરમિયાન અંદાજે ૪૭૩૦ થી ૫૬૮૦ લીટર જેટલું લોહી હૃદયમાં આવે છે. એને ફેફસામાં શુદ્ધ કરવા મોકલાય છે ને શુદ્ધ થયા પછી શરીરમાં રહાના કરવામાં આવે છે. (તમે રોડ પર પાણીના કે પેટ્રોલના એન્કરો નુંઓ છો તે ૪૦૦૦ લીટરનાં હોય છે)
- (૫) કોણ બેવફૂફ કહે છે કે તમારું હૃદય એક નાનુક નભળો અવયવ છે ? તમારી પચાસ વર્ષની ઉમર થતાં સુધીમાં તો અણે રૂ લાખ લન (લીટર નહીં) જેટલું લોહી તમારા શરીરમાં ફેરવી નાંખ્યું હોય છે. દુનિયાનો સૌથી વધુ હોર્સ પાવર ધરાવતો પરમ્પરા આટલું પ્રવાહી પરમ્પરા કરતાં થાકી જથ્ય, એને થોડીવારે ગરમ થઈને ફ્યુઝ ઉડી ન જથ્ય એ માટે બધ કરવો પડે, ડીજલ પેટ્રોલથી ચાલતો હોય તો એમાં અના હિસાબે Fuel રેડલું પડે અને ઇલેક્ટ્રોલથી ચાલતો હોય તો હન્દરો વોટ વિનાળીની એને જરૂર પડે. માત્ર આ પરમ્પરાને, હૃદયને કઈ વિનાળી ચલાવે છે તે કોઈને અખર નથી, એમાં ડીજલ કે પેટ્રોલની જગ્યાએ શું વપરાય છે તેથી કોઈ જણતું નથી. (તમારું હૃદય નબળ્યું છે એમ કહેનારો પણ ) કહેવાય છે કે હૃદય પોતાને જરૂરી વિનાળી (Electricity) પોતે જ ઉત્પન્ન (Generate) કરી લે છે. (SELF GENERATING).
- (૬) એક ક્ષણનો પણ વિસામો લીધા વિના માના ગર્ભમાં હોય ત્યારથી મંડી જંદગીના છેલ્લા જ્વાસ સુધી રાત્રી અને દિવસ ઘબકતા આ હાડકા વિનાના માંસના લોચાને કેટલો શ્રમ પડતો હો એનો તમને કદી અંદાજ પણ આવ્યો છે ખરો ? અરે એ તો છોડો, એ પરમ શેના આધારે લટકે છે ? કયા પેટ્ફોર્મ પર અને બેસાઇન્યુ છે અને એના સતત હલનચલન વેળાએ એના સ્નાયુઓને કેટલો

- સ્નાયુને પહોંચતો હો ? એ ઘસાયેલા સ્નાયુઓ ફરી રીવાઈવ નના રીતે થતા હો ? એની કેવળ કલ્પના ય તમે કરી છે હો ? એક જ પ્રકારે ઘર્ષણ થવાથી કાળ મીંદ પત્થરનાં પગથિયાં ય પસાઈ જથ્ય છે, લોંગડ જેનું લોંગડ ઘર્ષણથી ક્ષીણ થઈ વિલય પામે છે. તમારા હૃદયના સ્નાયુઓ ક્યા પદાર્થમાંથી બન્યાં છે જેને કોઈ ઘસારો લાગતો જ નથી.
- (૭) હૃદયના સ્નાયુઓની બનેલી દિવાલ જડી, અને મજાબૂત અમળાયેલા (Twisted) ગોળાકાર ગુંચળા જેવા દોરાના ગાળીયા જેવા લૂપ્સ Loops થી ગુંથાયેલી હોય છે. આ દિવાલની અંદર આર પોલાણવાળા વિભાગો છે. જમણી બાજુના ઉપરના ખાનામાં એક સ્નાયુનો નાનકડો ગોળી જેવો ભાગ છે જેને સાઈન્સ નોડ (SINUS NOD) કહે છે. આ ટ્યૂકડી ગોળીના સ્નાયુઓ એટલા મજાબૂત છે કે આખા માનવ શરીરમાં એટલા મજાબૂત સ્નાયુઓ બાંને ક્ષયાંય નથી.
- (૮) આ ઉપર આપેલ આંકડા તો હૃદય જ્યારે NORMAL CONDITION માં તમને જીવાડતું હોય છે ત્યારના છે. તમારા જીવનમાં કણો ખાંખો આવતા ફેરફારો, શારીરિક અને માનસિક તનાવની વેળાઓ, કોકાઈ-ઇમરજન્સી વેળાએ કરવો પડતો ઓવરયાઈમ એની કોઈ જીવાતરી કરી જ નથી.
- (૯) મારીરિક શ્રમ, કસરત, રમત ગમત અને અન્ય કોઈ પ્રકારના મારીરિક કે માનસિક તનાવ વેળાએ હૃદય એના નોર્મલ પ્રમાણ જગતાં આઠ ઘણા વધુ પ્રમાણમાં શરીરમાં લોહી ફેંક છે. જેનું પ્રમાણ મીનીટના બાર ગેલન જેટલું હોય છે.

આપણે જમીનમાંથી પાણી ભેંચવા ને હેન્ડ પંપ વાપરીએ છીએ એ પંપને પણ બાર ગેલન પાણી ભેંચવા માટે દસ મિનિટથી પણ વધારે સમય લાગે છે, જ્યારે આ જ કાર્ય હદ્ય ફૂલ એક જ મિનિટમાં ખૂબ જ ચોક્સાઈ પૂર્વક કરે છે. Precisely - એકદમ ચોક્સાઈપૂર્વક. જેવી આ વધારાના પુરવઠાની જરૂત પુરી થઈ નથ્ય કે તુરત કોઈ જતના ચેન-ચાળા (FUSS) વગર જણે કરી બન્યું જ નથી તેમ પેણું તેજ ગતિ ધારણ કરેલું હદ્ય વળી એકવાર ધીમું પડી પોતાની અસલ (Normal Range) ગતિ ધારણા કરી લે છે અને એના વધી ગંગેલા ધબકારા અસલ પ્રમાણ પર આવી નથ્ય છે.

ધારી લઈએ કે કોઈ કારણસર વધારાના રક્તનો પુરવઠો પુરો પાડવાનો સમય ધાર્યા કરતાં વધુ સમય લંબાય, તો પણ હદ્ય એ જરૂત ને પહોંચી વળવા સમર્થ છે જ. આવે વખતે હદ્ય પોતાના જ સનાયુઓને સંકોચીને વધુ મળબૂત બનાવે છે, એનાં લોહીને ગ્રહણ કરવાના સમાવવાના ખાનાંઓ (Chambers) એની અસલી ક્ષમતા કરતાં ભેંચાઈને વધુ પહોળાં થાય છે, જેથી એમાં વધુ લોહી સમાઈ રહે, ધારી વાર તો આ ચેમ્બર્સ એની અસલી સાઈઝ કરતાં ભેંચાઈને બમણી સાઈઝનાં થદ્ય નથ્ય છે, પરિણામે હદ્ય એના એક જ ધબકારે ચાર ઔસ જેટલું લોહી શરીરમાં ફેંકવા સમર્થ બને છે.

ECGની રહીની પછી પર આડા અવળાં લીધાં દોરી ફ્લાક દઈને “હદ્ય કમનોર છે” એમ કહેનારાને સામેથી પુછો “હદ્ય ને આટી ક્ષમતા ધરાવતું હોય તો એને કમનોર છે કહી બદનામ કરવાનો તને શું અધિકાર છે ? ”

હદ્યની તાકાત માટે, એ તમને કહેવામાં આવા છે એટલો નાજુક, નબળો કે કમનોર અવયવ નથી એટલું સમજાવવા માટે આટલું લખાણ પુરતું થઈ જાય જોઈએ.

અને તો પણ, અગર તમને કોઈએ તમારા હદ્ય પ્રત્યે શંકાની નજરે જેવા માટે મજબૂર કર્યા હોય તો એ જ વ્યક્તિ પ્રત્યે તમને સ્વાભાવિક નફરત થવી જોઈએ.

જે હદ્યથી તમે વિમુખ થયા હો તે જ હદ્ય પ્રત્યે ફરી એક વાર ‘ભૂલ્યા ત્યાંથી ફરી ગણીએ’ સમજી પ્રેમના અંકુર ફરી કુટ્ટવા જોઈએ.

આજરે હદ્યનું બીજુ નામ જ “પ્રેમ છે” ખરું ને ?

ચાલીસ વર્ષની વયે ને વ્યક્તિને ચાલીસ દિવસ જેટલા સમયની કિમત સમજાઈ નથી (સમયને જેણે વેડફી નાંઘ્યો છે) તેવી વ્યક્તિ પણ એંસી વર્ષની ઉત્તમે ચાર દિવસ પણ વધુ જીવવા મળે તો ચાલીસ લાખ રૂપિયા ખર્ચવા પણ તૈયાર થઈ નથ્ય છે. ખર્ચ છે, અને ? ચાર દિવસ તો શું, ચાર પણ પણ એના નિર્મિત કરેલા આયુમાં ઉમેરી શકતો નથી. પ્રાણ એ થાય છે કે :

HOW OLD IS TOO OLD ?

HOW MUCH ARE A FEW EXTRA DAYS

IN LIFE ARE REALLY WORTH ?



## ਬੋਲਤਾ ਭੀ ਇਵਾਨਾ

આજથી એકસો વરસ પહેલાં મેડીકલ સાયન્સના ટેકદારો એવાં બાળગાં કુક્તા હતા કે :

“આમને રીસર્ચ (શોધખોળો) કરવા માટે, નાણાંની કોથળીઓના મોટાં ખૂલ્લાં મુકી ધો, અને પ્રયોગો (Experiments) કરવા પૃથ્વીનાં તર પર રેલ્ટાં હોય એટલાં (માનવી સિવાયનાં જીવો) અળસીયાં, દેડાં, ઉદર, બિલાડાં, સસલાં, ડુક્કર, વાંદરાં, સાપ, વીછી, ગરોળી અને મુક્ત આકાશમાં ઉડાં પંખીઓ આપો, એ મુંગા નિર્દોષ પશુ પંખીઓ પર અમાનુષિ અભયતરાઓ કરી, એમને રીખાવી રીખાવીને મારી નાંખી અમે એવી અદ્ભૂત શોધખોળો કરીશું કે માનવી નામના ફાલતુ જીવનું સરેરાશ આયુષ્ય વધીને ૧૫૦ થી ૨૦૦ વર્ષનું થઈ જશે.”

દુનિયાભરની બ્રાહ્મ સરકારોએ, બેઈમાન હકુમતીઓઓએ, લાલચુ  
માનવીઓએ, સ્થાપિત હિતો ધરાવતી મહાકાય દવાઓ બનાવતી  
કંપનીઓની એ વાતો માની લીધી અને પેલા રાખસી વૃત્તિ ધરાવનારા  
કહેવાતા વૈજ્ઞાનિકોને અબજે લુંબોની ફૂર હિંસા કરવાના પરવાના અને  
અદણક નાણાં ઉદાર હિંસા આપ્યાં કર્યાં.

એકસો વરસ થઈ ગયાં છે. આજે પણ માનવી રેલા દાવા મુજબ સરેરાશ ૧૫૦ થી ૨૦૦ વર્ષનું આધુણ્ય મેળવવામાં નિષ્ઠા જ રહ્યો છે. (કદાચ એ એના ભલામાં જ છે)

પરંતુ પોતે કરેલા અમાનુષિ નિર્દોષ જીવોના સંહારને વ્યાજબી ડેરવા માટે અને રહ્યા સથાં હણું બાકી રહેલા નિર્દોષ જીવોને મારવાનું બહાનું બતાવવા માટે અને હવે પછીની પ્રજાને બેવક્ફાસું બનાવી વધુ લૂટ ચલાવવા માટે પેલા વૈજ્ઞાનિકો આંકડાની માયાળણ રચી, મારીને તમારી સમક્ષ રજુ કરે છે.

એમનું કહેવું છે કે : (ધ્યાન દઈને સાંભળણે) “ઓગાઝીસમી સહી કરતાં વીસમી સહીમાં અમે માનવીના સરેરાશ આયુષ્માં વીસેક વર્ણનો વધારો કરી શક્યા છીએ”

આમ તો આપણે આ વાત માની લઈએ. પરંતુ અમેરિકા જેવા જણ્ણત દેશના સર્વેક્ષણના આંકડાઓ કંઈક જુદું જ કહે છે : એમના કહેવા પ્રમાણે “૪૫ વર્ષની ઉચ્મર પછી અમેરિકાના નાગરિકની વધુ જીવવાળી આશામાં સંવત ૧૯૦૦ માં હતો તે કરતાં કોઈ વધુ સુધારો નોંધાયો નથી.

૪૫ વર્ષની ઉભમરનો પુરુષ સો વરસ પહેલાં પોતે ૬૮ વર્ષની ઉભમર સુધી જીવશે એવું માનતો હતો તેને બદલે હવે ૭૨ વર્ષ સુધી જીવશે એવું માનતો થયો છે અને ૪૫ વર્ષની અમેરિકન સ્ત્રી જે સો વર્ષ પૂર્વે ૩૦ વર્ષની વય સુધી જીવવાની આશા રાખતી હતી તે હવે ૭૭ વર્ષ સુધી જીવશે એમ માનતી થઈ છે.”

આ સર્વેકષણ કરનારાઓ એ વાતની ચોખવટ કરવાનું સગવડતા પૂર્વક દળે છે કે પુરુષ વધારાના ત્રણ (૬૮ ને બદ્દલે ૭૨) અને સ્ત્રી

વધારાના સાત (૭૦ ને બદલે ૭૭) જીવવાની આશા રાજે છે તે હકીકતમાં એટલાં વધુ વર્ષો જુયે છે કે નહીં? અને અગર ખરેખર જુયે છે તો ૧૯૦૦ પહેલાં જુયતાં હતાં તેના પ્રમાણમાં કેટલું ભયાનક, બિધામણું, ડરામણું અને રિબાઈ રિબાઇને જુયે છે?

પરંતુ તમારા કે મારા માનવા ન માનવાથી ચેલા અભતરાબાળે ને કોઈ અસર પડવાની નથી કે નથી એ એમના આમાનુષિ પ્રયોગોમાં થાકવાના, હારવાના કે એને ઓછા કરવાના (બંધ કરવાની તો સ્વપ્નેય કલ્પના કરતા નહીં)

માનવીને વધુ લાંબુ આયુષ્ય આપવાનો અને તંદુરસ્ત જીવાડવાનો કોણીએ ગોળ ચોંચડી એ સમગ્ર માનવનાતના ફુલમનો પાસે હેવે પ્રયોગો કરવા માટે નિર્દોષ પશુ પંખીઓ બચ્ચાં જ નથી. એટલે એ હેવાનો પોતાનો કક્કો ખરો પાડવા હેવે, ગર્ભવતી સીઓ (બૃણ) નામાં બાળકો, અને યુવાન સી પુરુષો પર એમના અભતરાઓ અનુમાને છે. ચેલી બ્રાંજ સરકારો, લોભી લુકુમતિયાઓ અને સ્થાપિત હિતો વાળી મહાકાય કંપનીઓ એમની જરૂરિયાતો પૂરી પાડવા પડાપડી કરે છે અને સમગ્ર માનવનાતને "સ્વાસ્થ્યનો, મૃત્યુનો ભય બતાવી ઈમોશનલ બ્લેક મેર્ફલ (Emotional Blackmail) કરે છે.

દલીલ ખાતર એકવાર એમ માની પણ લઈએ કે આ તિકડમબાળે એ સી-પુરુષની વધેલી વયના આપેલા આંકડા સાચા છે, તોથ એ વધેલા આયુષ્યનું શૈય એમને આપવાનું કંઈજ કારણ નથી. સાચું સામાન્ય ખુદિધ કખુલ કરે તે સત્ય કંઈક આવું છે.

૧૯૪૪ થી ૫૦ નાં અરસામાં મેલેરીયા એક મોટો મારક રોગ ગણવામાં આવતો. એક તુરછ મચ્છર નામના જંતુને મેલેરીયાના

જંતુઓ ક્લાય છે અને એને મારવા માટે વિજ્ઞાને યુદ્ધના ઘોરણે "મચ્છર મારવાની શરૂઆત કરી" ડા.ડી.ડી. ગેમેક્સીનથી માંડી એક એકથી ચરીયાતા એરી રસાયણોનો તોપમારો ચલાની મચ્છરની સાથે સાથે વનસ્પતિ અને જેતીને અત્યંત ઉપયોગી એવા લાખો જીવલંતુઓનો રીતસરનો સંહાર કર્યો અને દુનિયાભરમાં "અમે મેલેરીયા નાખું કરવામાં સફળતા મેળવી છે (We have eradicated Malaria) એમ ઢોલ પીરી પીરીને જાહેર કર્યું.

આખી દુનિયા જાણે છે કે એ બેવક્ફો એક તુરછ મચ્છર એવા જંતુને પણ મારી શક્યા નથી કે નથી મેલેરીયાને નાખું કરી શક્યા. આજની તારીકમાં મચ્છર નામનું જંતુ ચેલા ડા.ડી.ડી. ફ્લીટ અને ગેમેક્સીનનો વ્યાજ સાથે બદલો લેતું હોય તેમ પૂર્ણ જન્મનથી માનવનાત પર આકષમણ કરતું તૂટી પણ્યું છે. વળી વધુને વધુ પાવર્કુલ ગુડ-નાઈટે વપરાય છે અને ડેથ-સ્ટીફીડિટમાં (Death Certificate) મૃત્યુના કારણની Cause of Death ની કોલમમાં મેલેરીયાનું નામ અગ્રસ્થાને ખિરાજે છે.

૧૯૬૮ની સાલમાં અમેરિકન કોઓસે કેન્સર' વિરુદ્ધ રીતસરનું યુદ્ધ જ જાહેર કર્યું. કરોડો અબજે ડોલર્સની જાહેરાતોમાં એમણે એવાં બણગાં કુંઝાં કે :

"અગે ૧૯૭૯ સુધીમાં કેન્સર નામના રાક્સસ પર અચૂક વિજય મેળવીશું - શરત એ કે અમને એક વરસના એક બીલીયિન ડોલર્સ લેખે દસ વરસ સુધી દસ બીલીયન ડોલર્સ આપો. પછી જુઓ અમારા વેજાનિકોની તાકાતનો પરચો ! કેન્સર નામનો શબ્દ જ બિગારીઓની ડીક્શનરીમાંથી નાખું થઈ જય છે કે નહીં !"

૧૯૭૬ને ગયે બીજાં વીસ વરસ વહી ગયાં છે દસ બીલીયન ડોલર્સની રકમમાં બીજા વીસ બીલીયન ડોલર્સ વપરાઈ ગયા છે. કેન્સરને

મિયરવાની વાત તો કયાંય હવામાં ઉડી ગઈ છે. હા.. કેન્સરને નામે  
નવી નવી મોંધી મોંધી દવાઓ ખવડાવી અને લાઇટોના મારા ચલાવી  
કેન્સર નામના રોગને વધુને વધુ ફેલાવવામાં, એ રોગથી વધુને વધુ  
માનવીઓને રીબાવી રીબાવીને મારી નાખવામાં તેઓ નિષ્ઠિત જ  
કાળિયાબ નિવક્ષયા છે.

કરોડો અભજે ડ્રિપિયાના ખરે રેન નવી ચણાતી કેન્સરની હોસ્પિટલો  
એ વાતને સમર્થન આપે છે.

આપણાને જડબા પર કોઈ એક મુક્કો મારે તો બજીસી હાલી જાય  
છે, ને બીજો એક મારે તો બેહોશ થઈ જવાય છે. પરંતુ બોકસીંગમાં  
ઉપરા ઉપરી મુક્કા ખાનારને ખાસ આવું કંઈ થતું નથી કારણ ?

કારણ વર્ષોથી મુક્કાઓ ખાઈ ખાઈ એ એવો ઘડાઈ ગયો હોય  
છે કે એનું જડબુ મુક્કાઓ ઝીલી શકે છે. વેઈટ લીફીંગ, રનીંગ, સ્વીમીંગ  
બધી કસરતોમાં આ નિયમ લાગુ પડે છે. રારીરને એવું ટેવાડો એવું ટેવાઈ  
જાય છે. પછી એની પાસેથી ધાર્યું કામ લઈ શકાય છે.

વીસમી સદીના માનવીની લુંદગી પણ પ્રદૂષિત હવા, રાસાયનિક  
ખાતર, બેળસેળીયો ઓરાક, બંધિયાર પાણી, જંતુનાશક દવાઓ અને  
આટલુંય ઓછું હોય તેમ અત્યંત વિચારી દવાઓના ડોઝ ખાઈ ખાઈને  
પેલી વિષ કન્યાની જેમ એવું ઘડાઈ ગયું છે કે એના પર સાધારણ  
બિમારીની કોઈ અસર જ થતી નથી. ને કદાચ એટલે જ એ સો વરસ  
પૂર્વેના એના પૂર્વજ કરતાં બે પાંચ વરસ સરેરાશ (અગર જે એમના  
કહેવા પ્રમાણે) જીવતો હોય તો જીવે છે. નહીં કે પેલા તિકડમબાનોએ  
કરેલી શોધીના પરીણામે.



## ૫

### આ છે, લાલનો એકડો !

તમારી મુઢી એક જ મિનિટમાં બોસેર વાર ખોલો અને બંધ કરો.  
મિનિટની સેકન્ડ સાઈં એટલે એક સેકન્ડથી પણ ઓછા સમયમાં એ મુઢી  
મુઢીને પાછી બંધ થવી જોઈએ. આવું ફક્ત એક જ મિનિટ કરો એટલે  
નોંધો વાર મુઢી ઉધાડ બંધ કરો તો આંગળાં એવાં કંક થઈ જાય  
નોંધો પડી ગયાં હોય તેવું લાગે - કરી જોણ એટલે અખર પડશે.

બળી આમ મુઢી ઉધાડ બંધ કરતી વેળાએ તમે મુઢીમાં કશું જ  
ફક્તાના નથી. ભરતા પણ નથી કે ખાતી પણ કરતા નથી જ્યારે હદ્ય  
ની માણે ઘબકારે બે ઓસ્સ લેછું લોહી ગ્રહણ કરે છે અને એલું જ  
ફક્તાના રહત પ્રવાહમાં ફેરી પણ છે.

હથને તમે નખળું કે કમનેર માનતા હો તો તમારી એ માન્યતા  
ફક્તાના નિકળી જાય એ મારે આવો થોડી અંકડાની રમત રમી લઈએ.

એક મિનિટા બોસેર ઘબકારને સગવડ ખાતર આપણે મિનિટા  
ફક્તાના ફિસાએ ગણીએ. ગુણાકાર કાગળ પેન્સીલથી કરતાં ન ફાવે તો  
ફાયરિલ પર કરવાની છૂટ છે.

૧ મિનિટના	૫૦	ધબકારા
x	૫૦	મિનિટ
એક કલાકના	૪૨૦૦	ધબકારા
x	૨૪	કલાક (એક દિવસ રાત્રિના)
એક દિવસના	૧૦૦૮૦૦	ધબકારા
x	૩૦	દિવસ (૧ મહિનો)
૧ મહિનાના	૩૦૨૪૦૦૦	ધબકારા
x	૧૨	મહિના (૧ વરસ)
૧ વરસના	૩૬૨૮૦૦૦૦	ધબકારા
x	૫૦	વરસ (સરેરાશ ઉમર)
૫૦ વરસના	૧૮૧૪૪૦૦૦૦૦	ધબકારા
એક ધબકારે હદ્ય બે ઓસ ૫૦ એમ.એલ. જેટનું અશુદ્ધ લોહી શુદ્ધ કરી શરીરમાં ફેડે છે એટલે		
		૧૮૧૪૪૦૦૦૦૦
	x	૫૦
૫૦ વરસમાં	૮૦૭૨૦૦૦૦.૦૦૦	એમ.એલ.
		લીટર લોહી ફરવનું.

તમારી પચાસ વર્ષની લુંઘની સુધીમાં તમારા જ હદ્યે એક અખલ એક્યાસી કરોડ ચુગમાલીસ લાખ ધબકારા માર્યા છે અને નવ કરોડ સાત લાખ વીસ હજાર લીટર અશુદ્ધ લોહી શુદ્ધ કરી શરીરના અશુષે અશુમાં ફેલાવી તમને લુવાઝા છે. નથી થાક્યું, નથી આરામ કર્યો કે નથી કરી કોઈ ફ્રીયાદ.

કોઈક બેબ્ફૂની સલાહી તમે ઇટન એક અપ કરાયું. કાઈઓગ્રામની ફાલતું પણીએ તમારું હદ્ય કમનેર છે એમ જાણાયું,


અને તમે એ મૂરખની માફક માની લીધું અને એજ કણેથી પેલો હિંસા વાળી એક માત્ર તમારો ભગવાન બની ગયો. તમે માની લીધું કે તુ હિંસી બેમ તમે કરશો તોજ તમારું હદ્ય રીતસર ધબકરો નહીં તો નહીં પડી જશો.

બાસ પેલી કાણ આવી ગઈ. તમને તમારા હદ્ય પરથી બરોસો ઉઠી ગયો, એ બરોસો તમારા હદ્ય પરથી ઉઠી પેલા સલાહ આપનાર એ લેખાને બોંધી ગયો. અને પછી એણે એનો બને એટલો ગેરફાયદો ફાળવી રહ્યો.

આ પુસ્તકનું હવે પછીનું લખાણ ફૂત એવા વાચકો માટે છે જે આપણે મુખીની વાત સ્પષ્ટ પણે સમજ લે છે અને કબુલ કરે છે કે આ વાત સાચી છે. આવું નહીનું થવું નોઈનું - પોતાના જ હદ્ય પરનો ફિલમાં ગુમાવી તમે ફૂત એક ઈમાનદાર અવયવનું અપમાન જ નહીં લેતો સાચાર અન્યાય કર્યો છે.

અને હજુ એમ લાગતું હોય કે “ગોડું નથી થયું” - જે મારો હિંસામાં આવ્યા હતા તે માર્ગ બરબાદીનો જ છે, તો હજુ પાછા વળી હાજી છે અને જે પાછા વળી તમારા જ રિસાયેલા હદ્યને મનાવવાની જીવન કરાવી કરીશા કરશો તો મારી ખાત્રી છે કે એ જરૂર “માની જરી” હશ્યાનું બાનું નામ પેમ છે.

અને પ્રેમમાં રિસામણાં મનામણાંનું એક આગવું જ આકર્ષણ છે.



**S**ie haben viele Freunde und Freunde für sich gefunden. Sie sind sehr glücklich.

संप्रेद्धनानुं सिंहासन

હદ્યને અગર જે કોઈ રોગ લાગુ પડતો જ હોય તો એ ફક્ત પ્રેમ-રોગ છે અને જેને પ્રેમ-રોગ થાય છે એ આ દુનિયાનો સૌથી વધુમાં વધુ ભાગ્યશાળી - પુષ્પશાળી જીવ છે. હદ્યને શરીરના અન્ય અવયવોની જેમ બીજે કોઈ જ રોગ લાગુ પડતો જ નથી.

મગજને મેનેજરીટીસ, લિવરને જેન્ડીસ, ફેફ્સાને ડી.બી. પદ્ધુરસી, જઠર આંતરરાને અલ્સર, કીડની ને સ્થોન કે નેકાઈટીસ ઈત્યાહિ...

હદ્યરોગને અગર અંગેલમાં HEART DISEASE કહેવાતો હોય, તો હા... હદ્યને ડિસ-ઇઝ (DIS-EASE) બજર થાય છે અને DISEASE નો બીજો અર્થ “તકલીફ” પણ થાય છે.

પરંતુ એવી તકલીફો નો બધા જ અવયવોને એક યા બીજા  
કારણસર થતી જ હોય છે અને એ બધા જ અવયવોને એ તકલીફો  
ભોગવા કુદરતે ક્ષમતા આપી જ છે. મગજ કંદળી જય છે, આપણી  
ખેંચાઈને હું:એ છે, નાક બંધાઈ જય છે, ગળું બેસી જય છે, ફેફસાંગ  
કદ્દ ભરાઈ જય છે, આચ્છોસ્વાસની કીયા તેજ થઈ જય છે, આચર-કુચ  
આવાથી જફરને આંતરડામાં ગરબદ થઈ જય છે, વધુ શારીરિક શ્રમ  
સાધુઓ ખેંચાય છે, હું:એ છે શરીર તૂટે છે વિગેર વિગેર વિગેર.

આએ બધું શરીર જીવે છે એટેલે થાય છે, થવું ખૂબ જ જરૂરી છે.

જીવા સુધી, હદ્ય નામના અવયવને લાગેવળગે છે ત્યાં સુધી દેશે  
અહિતાં એ વાત સ્પષ્ટ પણો સમજુ લેવી જરૂરી છે, કે :

સરીરના બધા જ અવયવો જ નહીં, શરીરના ઇવે ઇવે અને આધુએ  
આધુએ ને કઈ ફેરફારો થાય છે, એ બધાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રતિભાવો  
કુદુર્ઘ પણ પડે છે. હુકીકતમાં હદ્દ્ય એ સમગ્ર શરીર જ નહીં જેને આપણે  
જાતિકી ઓળખીએ છીએ (?) એનાં પણ પ્રતિબિંબ જીતે છે.

આ જીલેલાં પ્રતિબિંબો પછી એના પ્રતિભાવો માનવીના અનુભૂતિઓ પર અંકાવી હોય - અને જેને આપણે માનવીની આત્માની આગામી કહીએ છીએ Individual Identity તરીકે ઓળખાએ જો એ હથે જીલેલાં પ્રતિબિંબો અને એના અડેલા પ્રતિભાવો સિવાય નથી.

માનવીના અસ્તિત્વ પર અંકાચેલા હદ્યના પ્રતિભાવોની પછી  
બુધી રોમાણો હોરાય છે, અંકડાઓ અંકાય છે, એના પડ્ઘાયા પડે છે,  
બુધી પડે છે અને પડ્ઘાય પડે છે.

આંદો એ અદ્ભુત હદ્યને થોડું વધુ નજીકથી ઓળખીએ....

મગજ Brain અને Heart હૃદય આ બે અવયવોને માનવીના જીવન અતિસ્તખને ટકાવી રાખતાં બુદ્ધિ અને લાગણીઓનાં કાર્યક્ષેત્ર વાતાવરી આપીએ તો એમ કહી શકાય કે બુદ્ધિ એ મગજનો વિષય છે કાર્યક્ષેત્ર લાગણીઓ એ હૃદયનો વિષય છે.

માની લઈએ કે માનવીની રેન્ડેરેનની છંગીમાં અગત્યના નિર્ણયો લેવામાં બુધ્ય મોટે ફણો નોંધાવે છે. પરંતુ ઉત્તમ જીવન જીવવા માટે લાગણીઓનું મહત્વ જરાય ઓછું નથી. ઉલટ લાગણીઓ જેટલી વધુ શક્તિશાળી હોય એટલી એ માનવીનું સમગ્ર જીવન વધુ પ્રભાવશાળી બનાવી શકે છે.

૫૨

લાગણી અને હદ્યના અંગત સંબંધોની ચર્ચા કરવા પહેલાં લાગણીઓ વિચે હુનિધાના દે઱ક ધર્મમાં જે ગેરસમજ પ્રવર્તે છે અને જેને જેરદાર રીતે પ્રચાર કરી સામાન્ય માનવીના મગજ પર ઢેકી બેસાડવામાં આવે છે એ વિચે થોડી વાતો લાગણીપૂર્વક કરી લઈએ - જેથી બદનામ થયેતી એ લાગણીઓ હકીકતમાં જીવનમાં ડગલેને પગલે કેટલી ઉપયોગી છે અને માનવીનું સાડું અથવા બુનું વ્યક્તિત્વ ઘડવામાં કેટલી અગત્યની છે ? એ સમલઈ જાય.

“લાગણીઓ અથવા વૃત્તિઓ વિનાશક છે, પાયમાલ કરનારી છે એ એક તોફાની ઘોડા જેવી તેજ રફતાર વાળી છે એને સંયમમાં ન રાખો તો તમને પાયમાલ કરી નાખશે.... માટે એ તોફાની લાગણીઓને વશમાં રાખો, ઉગતી જ દબાવી ધો, મારી નાખો, કચડી નાંખો, ચુક્કી નાખો, બાળને ભર્સુ કરી નાંખો” - એમ દોષ પીઠી પીઠીને કહેવામાં આવે છે.

વિજ્ઞાનના નિયમ પ્રમાણે Action & Reaction are equal and opposite હોય છે, આજ નિયમ વૃત્તિઓ અને લાગણીઓના વિષયમાં જરા જુદી રીતે લાગુ પાડી શકાય.

Action & Reaction are not equal but thousand times more severe and million times more opposite and negative.

માની લાગણીને, વૃત્તિને જેટલી દબાવશો એટલી એ વધુ જેરથી ઉછળશે જો જેના પરિણામો વધુ ખતરનાક આવશે.

અગ્ર જો લાગણી નકારાત્મક હોય, તો એને દબાવ્યા પગર જે જો સર્જનાત્મક વળાંક આપવો, વહેણ આપો જેથી એ રચનાત્મક વિસ્તીર્ણમાં લઈ શકાય. (ઉદાહરણ હિંસક વૃત્તિ વાળી વ્યક્તિને કોઈ વિસ્તીર્ણ ભરતી કરી દેવો)

The capacity of emotions are exceptionally tremendous and extra-ordinarily powerful લાગણીઓમાં અગાધ શક્તિઓ અને વિસ્તીર્ણ તાકાત ડાંસી ડાંસીને બરેલા હોય છે અને હકારાત્મક પ્રકારના (Positive and Negative) બને પ્રકારની લાગણીઓ સર્જનાત્મક કે વિસ્તીર્ણક (Creative or destructive) બની શકે છે.

એ વ્યક્તિ આ બને વૃત્તિઓને સમયે સમયે એની જરૂરીયાત જરૂરી, જરૂરિયાતના પ્રમાણમાં, સમજપૂર્વક કોઈપણ જતની જાતિભાવના વિના કે પૂર્વગ્રહનો પડછાયો પડવા દીધા સિવાય એનો જાતના ઉપયોગ કરે છે એ વ્યક્તિ મળુછ્ય જે રીતે જીવવા માટે ઈચ્છાએ જાતી હો રીતે જુયે છે અને લાગણીઓ અને વૃત્તિઓને જે વ્યક્તિ જાતનાર કે પ્રમાણભાવન વિના પોતાના સ્વાર્થને કેન્દ્રમાં રાખી પૂર્વગ્રહ (Prejudice) ના પ્રભાવથી દોરવાઈને વાપરે છે એ માનવી એટલા જાતના અમાનુષિ જીવન જુયે છે.

આલી વાત લાગણી વિચે સમજ લઈએ એટલે આપણા “હદ્ય જો લાગણીઓનો સંબંધ”ની વાતો સમજવી વધુ સરળ થઈ પડ્યો.

### Emotions & Feelings

લાગણીઓ અને સંવેદનાઓ, આમતો આ બને શર્જદાના થાથી  
લગભગ એક જ થાય - પરંતુ આપણે એ બે વર્ચેનો પણ જે સૂક્ષ્મ  
તફાવત છે તે જોઈ લઈએ.

#### Emotions : સંવેદના

#### Feelings : લાગણીઓ

ગરમ પ્રાઈમસને હાથ લાગે ને દાડી જવાય અને ને શારારીર  
બળતરા અનુભવાય એ લાગણી. જેને અનુભવા માટે, મગજની Brain  
ની પંચેન્દ્રીયોની મદદની જરૂરત પડે છે.

જ્યારે કોઈને દાડેલો જોઈને અંતરમાં જે અરેરાટી થાય છે,  
જલન થાય છે, દુઃખ અનુભવાય છે, એનું નામ સંવેદના છે.

એવી જ રીતે આંલામ્પીક રૂપતમાં કોઈ ગોલ મેડલ જીતે છે અને  
એ જોઈને આપણા મનમાં આનંદની એક લહરી ઉંડે છે એ સંવેદના છે.

અને આ સંવેદનાઓનું મધ્યથેણું કેન્દ્રસ્થાન, ઉદ્ભવસ્થાન, જે  
ગણો તે હૃદય છે.

★ ★ ★ મિનાકારી ★ માર્ગ માર્ગ

સંવેદનાના તાર જેના સતત ત્યુનિંગ કરેલા રહે છે તે સામાન્ય  
માનવીમાંથી મહાત્મા બને છે અને જેની સંવેદનાના તાર  
વિશ્વારી, નરીલી હવાઓ ખાઈ ખાઈને જડ જુદ્ધા અને બુદ્ધા થઈ  
ગયા હોય છે તે માનવી મરી કુરાતમા - કુઝાતમા બની જય છે.



### બાંબુ આયુષ્ય ?

આના પછીના મોંઢી સારવારના પ્રકરણમાં આપણે જોઈશું કે જન્મ  
થાય રોગનું મુખ્ય કારણ દ્વારો અને આંધળા ઉપયારો છે અને  
જી વર્ષની વધુ પછી થનારા હદ્યરોગ અને એના જેવી બીજી અનેક  
નિયાયીબીજી મૂળ પણ આંધળા અખતરાચો જ છે અને છતાં દાતીલ  
થાય જેમ માની લઈએ કે કોઈ દ્વારાથી માનવીનું હદ્ય બગડતું નથી.  
તી પણ આ કહેવાતા નિષ્ણાતો એક વાત ખૂબ જ સગવડતા પૂર્વક  
ખૂબી લાય છે કે સામાન્ય માનવીનું સરેરશા આયુષ્ય જ્ય થી પણ વરનું

મારા જે જ્ય વર્ષે માનવીનું હદ્ય થોડું ઓછું કામ કરતું હોય,  
તી જી જરૂર હોય, થોડું કમજોર પણું હોય તો એ સાવ સ્વાભાવિક જ  
ની જી જીમરે શરીરમાં જે કંઈ ફેરફારો થાય છે તે બધાન આપણે સહજ  
તી અપનાવીએ છીએ, કખૂલ કરીએ છીએ પછી હદ્યની પાછળ શું કામ  
જાની પડી જવું પડે છે ?

મારા સફેદ થાય, ચામડી પર રૂષતા આવે, કરચલી પડે, દાંત  
થાય, બાંખનું તેજ ઓછું થાય, સાંભળવામાં ઓછું આવે, સાંઘા  
થાય, પાચન શક્તિ મંદ પડે, ફેફસાં થોડાં થાકે, ચ્વાસ ચઢે, બધું

જ આપણે ઉગ્મરના વધવા સાથે જરા પણ ફીયાદ વિના કબુલ કરીએ.  
છીએ.

યાદશક્તિ ક્ષીણ થાય છે તો મગજને દોષ હેતા નથી આંતરથી,  
જઠર, કે ફેફસાંને કોચતા નથી પડેલા દાંતને તારથી બાંધી લટકાવવાની  
બેવફૂઝી કરતા નથી તો જે હદયે જન્મ પામવાની પહેલાંથી એક સરળ  
તમને જીવાડવા માટે ઘખકવાનું કાર્ય કર્યું હોય, લાખો લન લોહી તમારા  
શરીરમાં સતત ફેરબું હોય અને અણુંએ અણુંને જીવંત રાખવા માટે રાત્રી  
દિવસ, દાદ તહ્કો કે વરસાદ કર્યું જ જેયા વિના બસ એકસરાંપું ઘખળવા  
જ કર્યું હોય અને હજુ તમારા આયુષ્માની છેલ્લી ક્ષણ સુધી ઘખકવાની  
તૈયારી રાખતું હોય - એને વિનાકારણ સત્તાવવાનો, એના કાર્યમાં ડાખા  
કરવાનો, એના પર શંકા કરવાનો તમને શું અધિકાર છે ? એ થહેલા,  
હારેલા હદયને તો તમારે વધારે જતનથી જળવવું જોઈએ, એને આયુષ્માન  
ના મરાય, એને બેટી ચાર્જ કરી વધારે જેરથી દોડાવવાની બેવફૂઝી ન  
કરાય, એને એને કેમ ચાલતું એ શિખવાડવા આલીયા - માલીયાની  
સલાહો લેવાની ગુસ્તાખી પણ ન જ કરાય વળી -

આખરે હદયને તમે સમજ શું બેઠા છો. કહો જેઉ ?



૧૯૪૫માં વૃદ્ધાની સંખ્યા કુલ વસ્તીના ૭.૫ ટકા હતી તે ૧૯૭૦માં  
વધીને ૧૦ ટકા થઈ કુલ વસ્તીના ફક્ત ૧૦ ટકા વૃદ્ધો હોવા  
ઇતાં, કુલ વપરાતી દવાઓના ૨૫ ટકા દવાઓ ફક્ત બુઝાઓ  
વાપરે છે અને વધુને વધું લાંબુ જીવવાની લાખમાં કીડાની,  
લીવર કે હાઈ પ્રોન્સ્ટ્રાન્સ જેવાં ઓપરેશનો કરવાનો અગ્રહ રાખી  
ડૉક્ટરોને બેઈમાન કરવા મળ્યું કરે છે.

## મોંધી સારવાર મોંધા મોત....

મૌખબારીના આ જમાનામાં 'જીવવું' જ જે મોંધું દાટ બેની ગયું  
તીમ તો મોત શા માટે સાવ સસ્તામાં આવવું જોઈએ ?

હું પહેલાંની જેમ બુદાપાથી કોઈ મરતું નથી. સાધારણ દમ,  
દમાની, ન્યૂમોનીયા જેવી ફાલતું બિમારીઓનાં નામ પણ હવે તો ભૂલાઈ  
જાએ છે, આયુનિક મૃત્યુ માટે (MODERN DEATH) હવે હાઈ ટ્ર્યુલ,  
સીની મૈલલોર, લ્યુકેમીયા, કેન્સર, ગોંલ બ્લેડર, પેન્કીયાઝ, થાઇરોઇઝ,  
સિન્સાન્ડ સોફ્ટ્સ્ટાઇલ બિમારીઓની આવશ્યકતા છે. વળી સામાન્ય  
જરૂરી પોતાનું કે લોહી તપાસવાના દિવસો પુરા થયા, હવે તો આધારીશી  
જરૂરી સોનોગ્રાફી, સોનોગ્રાફી, કોમ્પ્યુટરાઈઝ ટેસ્ટ્સ, ફરજીયાત છે. કરી જ  
બિમારી ન હોય તો એ પાંચ હજારમાં રૂટિન ચેક-અપ કરાવી એકાદી  
આયુનિક બિમારી તમે ચેસા આપીને ખરીદી શકો છો.

તમારા શરીરનો એકે એક અવયવ નબળો છે, રોગિઝ છે માંયકાંગલો  
ન હીય તો એને રોગિઝ કરી આપનારાઓની કરી નથી. હુકીકતમાં  
બાળમાં બાળક હોય ત્યારથી જ એના પર જત જતની વિષારી  
બિલાસી ને અભતરાઓ કરી એના બધાજ હજુ તો વિકસી રહેલાં અવયવોને  
જી વિષારી રોગિઝ બનાવી હો છે. પછી ઉછ્રતા બાળકને યોન્સીલ્સ

કે એપેન્ટિકસ લેવા અવયવો કાપી વધુ કમજોર બનાવી હે છે. હજુ તો ભર ચુવાનીમાં હોય તેવા સ્થી કે પુરુષને એકાદ બે તો આધુનિક બિમારી ઓલેરેડી લાગુ પડી જ ગઈ હોય છે અને એની દવા કરાવતાં કરાવતાં ૪૦-૪૫ વર્ષો તો એ એક લેટેસ્ટ મોડર્ન-સૉફ્ટસ્ટિક્ટેડ બિમારીનો સ્પેશીઅલ મરીજ બની ગયો હોય છે.

આપણે હદ્યરોગની વાતો કરીએ છીએ એટેલે બીજી બિમારીઓને હમણાં બાજુ પર મુકીએ. જેને જન્મભાત - Congenital હદ્યની બિમારી હોય તેવા બાળકોની સંખ્યા સરેરાશ એક લંજરમાં જ ની હોય છે. આ સાતે સાત બાળકોનું હદ્ય જન્મતાં જ શા માટે રોગિએ હોવું જોઈએ ? કારણ બધા જ જાણે છે પણ કબુલ કરવા કોઈ જ માંગતું નથી. આ સાત બાળકોનાં હદ્ય એટલા માટે કમજોર, રોગિએ કે ખોડ ભાંપણ વાળા હતાં કારણ કે એમની માતાઓએ એમની છંદગીમાં બેમુદ્દાર દવાઓ ખાદી હતી. ખોટાં - સાચાં ઓપરેશનો કરાવ્યાં હતાં, એકસરે - રેનીબેશન લીધાં હતાં. કોઈજોન, એન્ટીબાયોટિક્સ, ઉધની ગોળીઓ, ટ્રાન્કવીલાઈજર્સ કે ગર્ભ-નિરોધક ગોળીઓ ખાદી હતી. વિના કારણ ઉતેજીત કરતા હોર્મોન્સ કે નરીલી દવાઓનાં ઉપરોગ કર્યા હતા કે ડૉક્ટરો દ્વારા કરવામાં આવ્યા હતાં.

આવા જન્મભાત હદ્યરોગનાં ફક્ત અમેરિકામાં ૧૯૮૩ માં ૬૧૦૦ બાળકો મૃત્યુ પાંચા હતા જેમાંના ૩૫૦૦ એક વર્ષની વય પહેલાં જ મર્યા.

જેને રયુમેટિક હાર્ટ ડીસ્ટીજ Rheumatic Heart Disease તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સાંધાના સ્નાયુઓની જેમ હદ્યના સ્નાયુઓને તુકશાન થયું હોય છે, તેવા રોગોની મૃત્યુ સંખ્યા અમેરિકામાં ૧૯૮૩માં ૬૧૦૦ ની હતી. અંદાજે એક કરોડ સાઠ લાખ રયુમેટિક હાર્ટના પેશાનો

ની બિમારી લઈને જીવે છે. હદ્યના સ્નાયુઓને કમજોર કરવામાં કે તીવ્ય તુકશાન પહોંચાડવામાં વિધારી દવાનો ફાળો ખૂબ મોટો છે.

ડોનની હાર્ટ ડીસ્ટીજ અને સેરેબ્રો વાસ્ક્યુલર ડીસીઝના કરાણે જીવિતમાં હર વર્ષે બાર કરોડ પચાસ લાખ હાર્ટ એક આવે છે. જેમાંના હાથ લાખ પહેલીવારના એક હોય છે. ૧૯૮૩માં પાંચ લાખ ચોનીસ હાથ મૃત્યુ આવા હદ્યરોગના હુમાલાના નોંધાયા છે.

૪૫ થી ૪૮ વર્ષની ઉપરની વિકિતાઓમાંની ૧૦ કા પુરુષ અને ૧૫ કા સ્ત્રીઓને કોઈને કોઈ હદ્યરોગ હોય છે અને પાંસઠની ઉપરની વિકિતાઓમાં આ કાવારી વધીને ૧૩.૪ કા પુરુષ અને ૬.૪ કા સ્ત્રીઓની હોય છે. સેરેબ્રો વાસ્ક્યુલર ડીસ્ટીજ - ૪૫ થી ૪૮ વર્ષની વિકિતાઓમાં આ બિમારી ૧.૭ કા પુરુષોમાં અને ૧.૪ કા સ્ત્રીઓમાં હોય છે, તો ૪૫ વર્ષની ઉપરની વયમાં એ વધીને પુરુષોમાં ૧૧.૫ અને સ્ત્રીઓમાં ૫.૮ કા નોંધાઈ છે. ૧૯૮૩માં આ બિમારીથી મૃત્યુની સંખ્યા એક લાખ બાવન લંજર હતી. ૧૯૯૮ થી ૧૯૯૯ મૃત્યુની કણામાં આવેલા ૨૭ દેશોના સર્વેક્ષણ મુજબ પણ્યિમના દેશોમાં જીવારીઓનું પ્રમાણ વધ્યું હતું. (કારણ હાર્ટ સ્પેશીઅલીસ્ટેની હાથ વધી હતી (?)

ચોનીસ Text Book of Medicine ના પાના ૧૭૯ પર આપેલ હાથ માંકડા પણ્યિમના દેશોના છે. આ બધા દેશોમાં આ સમય હાથ રોગના સ્પેશીઅલીસ્ટે અને પેટા-નિષ્ણાતોની સંખ્યા હતી હતી ? પહેલાં હતી એના કરતા કેટલા ટકા વધી હતી ? એ જીવારીની લાખ પણ નોંધ કેવામાં આવી નથી. જાહીર હૈ કી આથલા જીવારીની પણ વધવાનો, એનું નિર્દાન કરવા, એના ઈલાજે કરવા, એમને જીવારી માટે બારેખું ઓપરેશનો કરવા નિષ્ણાતોની અને પેટા

નિષણાતોની ફોળેની ભોગે બહાર પડી હોવી જ લેઈએ અને જે માનવી માત્રનું હદ્ય આથું નમાતું અને કમનેર હોય તો એને મજબૂત ઠેવા અને એ માનવીને મારી ન નાખે એ માટે એને ઘબકંતુ રહેવાનું શીખવા માટે હનુ આઠલા નિષણાતો પણ ઓછા પડતા હોવા લેઈએ.

નો - ગ્રોબલેમ... ભવિષ્યમાં દર એક વ્યક્તિએ એક તાં સ્પેશીઅલીસ્ટ સેવામાં હાજર હશે - અને હા.... એમાંના એકનું પણ પોતાનું હદ્ય કમનેર કે રોગિજ નહીં હોય... જે જે ને ?



"નાની મોદી કોઈ પણ તકલીફ માટે દવા તેવી જ લેઈએ, એવી આગ્રહ રાખવાની કુટેલ દદીઓ અને એમનાં કુંભીજનોએ હવે છોડી દેવી લેઈએ. કારણ એ સારવારની કિમત રૂપિયા આના હે માં તો મસ મોદી રકમમાં ચૂકવવી જ પડે છે પણ એ સારવારથી બગઢેલી દર્દીની શારીરિક અને માનસિક અવસ્થાની કિમત તો કોઈપણ રીતે કોઈનાથી યે ચૂકવી શકતી નથી."

અમેરિકાના જાણીતા સર્જન ડૉ. પર્સીફનીવાલ બ્રીટિશ મેડિકલ જર્નલના ૧૯૩૮ ના એક અંકમાં સાઈટ વર્ષ પૂર્વે કરેલું આ સુવાર્ણ વિધાન આજે પણ એટલું જ સચોટ રીતે સાચું છે.

## બત્રીસ પૂતળીઓ અને ઓસાઠ જોગણીઓની વાર્તા

જે લીધો સાદો બોળો ભરવાડનો માસુમ છોકરો  
દીસો સાથે ઘેટાં બકરાં ચરાવવા સીમાં જાય.  
દીમાં એક ટેકરો, એ ટેકરા પર એક પત્થર

પેલો ભરવાડનો છોકરો જેવો આ પત્થર પર બેસે કે તુરત એના  
ખાંસાં, બુલિયાં અને મનમાં એક લિજણીનું કરેટ પસાર થઈ જાય.

અને એ નાનો, અભણ, અખુદ ભરવાડનો બાળક મટી એક  
ખાંસ પીઠ, હેલ, તત્સ્થ બુલિય ધરાવતો ન્યાયાધિશ બની જાય. એ  
ની તેથી જાયિલ પ્રજાના સરળતાથી, પૂર્વિગ્રહ લિનાના સચોટ ઉકેલ  
કરી શકતી.

જાલ બોળને આ વાતની અખર પડી. એણો પેલો ટેકરો ખોદાવ્યો  
ની લીમાંથી દાખેલું સિંહાસન મળ્યું.

જાલને એ ગમ્યું એની પર બેસવા એ ઉતાવળો થયો.

'મધ્ય' એક અવાજ આવ્યો.

પેલા સિંહાસનના બત્રીસ સ્તંભોમાં કાણી કંડારેલી બજીએ પુતળીઓ જડેલી હતી, એમાંની નંદા નામની પુતળીમાં એકાગેક છન્હ આવ્યો અને એ બોલવા લાગી.

આ સિંહાસન પર બેસનાર વીર વિક્રમ કેવો પરદુઃખબંધન, પરોપકારી અને સાહસિક હતો, એના ગુણ ગાવા લાગી.

એનાં ગુણોનું વર્ણન પુરું થયું કે પુતળી નંદાએ રાજ ભોજને હતું

“હે રાજ ભોજ, આ સિંહાસન એવા વીર વિક્રમનું છે જેણો પોતાના જીવન દરમિયાન માનવીની વૃત્તિઓને ગુમરાહ કરનાર પૈતાળે વશ કર્યો હતો અને દરેક માનવીમાં રહેલી ચોસઠ આસુરી વૃત્તિઓની પ્રયંક શક્તિઓને કોઈપણ જીતના સ્વાર્થમાં ઉપયોગમાં ન લેતાં હોઈ પણ જીતના પૂર્વગ્રહનો પડધાયો પડવા દીધા સિવાય પરોપકારીએ ઉપયોગમાં લીધી હતી અને દરેક માનવીમાં વસેતાં બત્રીસ હેઠી લક્ષણોનો પણ જીવનની ક્ષણે ક્ષણે સદ્દઉપયોગ કર્યો હતો”

“માટે હે રાજ ભોજ ! અગર તું તારા મનમાં વસેલી વૃત્તિઓને ચિત્તબ્રદ્ધ કરનાર વૈતાળને વશમાં કરી એની તાકાત ઉપયોગમાં લઈ બોલા વિનાશક વૃત્તિઓની શક્તિઓને રચનાત્મક ઉપયોગમાં લેવાને શક્તિમાન હોય તો જ તું આગળ વધને.

આથવું બોલી પેલી નંદા નામની કાણી પુતળી ફર્રર હોણી આકાશમાં ઉડી જય છે.

તે પછી અનુકૂળે વનિતા, ધનદા, માનવતી, હંસા, ઘિત્રાગના, શ્યામકા, લક્ષ્મણા, કામાલિક, સુલદ્રા, બાળા, સિહંડા, માદલી, બજી, વૃંદા, પવિત્રા, પંકજ-નથની, મોહિની, પ્રદુમા, ઉમિયા, કર્પુર-મિયા,

બુલગા, શંકા-હરણા, ચંદ્રવદ્ધા, સુગંધા, અધનાસ્તા, તરુણી, પદ્માસના, મિલનતી, સરસ્વતિ, રેણુકા અને ઈન્દ્રજાહી, એમ બત્રીસે બત્રીસ પુતળીઓને વીર વિક્રમનાં પરાક્રમોનાં ગુણગાન ગાઈ, રાજ ભોજને સિંહાસન પર બેસતાં રોક્યો.

પછી સંભાકરે સિંહાસનમાં જડેલી બત્રીસે બત્રીસ પુતળીઓના હી જવાણી એ સિંહાસનનું ઉપરનું છત તૂટી પઢ્યું ? રાજ ભોજ એના હી પેણી રાક્ષસો ? વિગેર વિગેર વાતો વાચકની કલ્પના પર છોડી દેવામાં હોય છે.

આખો આપણે આપણી રીતે એ કલ્પનાને શબ્દોનો આકાર આપવાનો પ્રયત્ન કરીએ.

અગાર પેલા સિંહાસનને માનવીના છુદ્યાનું પ્રતિક સમજુએ, તેના સ્તોંબ-આધાર ઇપ જડવામાં આવેલી બત્રીસ પુતળીઓને માનવીની ખૂલજ સબળ સર્જનાત્મક શક્તિઓનું સ્વરૂપ આપીએ અને માનવી જોગણીઓને માનવીની અન્ય વિનાશક - Negative વૃત્તિઓ હી સરખાવી, વેતાળ નામની સ્વાર્થની ભાવનાના દૈત્યને વશમાં સભાનાની ચેષ્ટા સમજુએ તો લગભગ આ બત્રીસ પુતળીઓ જડેલા સિંહાસનની વાત ખરા અર્થમાં સમજાઈ જાય છે.

આખો કલ્પનાને થોડો વધુ શબ્દોનો આકાર આપીએ.

### બત્રીસ સર્જનાત્મક સૌભ્ય લક્ષણો

૧. દ્યાવાન
૨. વિનાશ
૩. સાહસિક
૪. પરાક્રમી
૫. બહુરૂપી
૬. માનવીલ
૭. સદાચારી
૮. સન્મિત્ર
૯. ખેલદીલ
૧૦. સૌભ્ય
૧૧. વાણુર (હિત્તમતવાન)
૧૨. નિર્બય
૧૩. ચાલાક
૧૪. ચપળ

૧૫. ચંચળ ૧૬. કામકૃપ ૧૭. વિશ્વાસુ ૧૮. લદ્ર ૧૯. પવિત્ર ૨૦. પ્રસાદ  
૨૧. લાગણીશીલ ૨૨. શીલવાન ૨૩. સમર્પણની ભાવનાવાળી  
૨૪. પરોપકારી ૨૫. સ્વરૂપવાન ૨૬. તેજસ્વી ૨૭. નિર્સાધી  
૨૮. પ્રેમાણ-વાત્સલ્ય ૨૯. વફાદાર ૩૦. બુધ્ધિશાળી ૩૧. પ્રભાવશાળી  
૩૨. વિવેકી (સ્થિત: પ્રક્ષા)

### ચોસઠ વિનાશાત્મક જોગણીઓ (લાગણીઓ)

૧. કામ ૨. કોષ ૩. લોખ ૪. મોહ ૫. ઈર્ઝ્યા ૬. હિંસા ૭. નિજીપતા  
૮. નિર્દ્ય ૯. નિર્લંજા ૧૦. ઋક્ષ ૧૧. અધિરાઈ ૧૨. અભિમાન ૧૩. નાના  
૧૪. ધૂશા ૧૫. દંબ ૧૬. દુરાચાર ૧૭. વેર ૧૮. વિકાર ૧૯. ભય (ડરોફ)  
૨૦. જડાટા. ૨૧. રોદ્ર ૨૨. દુખિત ૨૩. શાંકિત ૨૪. અવિશ્વાસુ ૨૫. અનુ  
૨૬. ઉદાસિન ૨૭. જુઠો ૨૮. પ્રાચ ૨૯. અવિવેકી ૩૦. સ્વાર્થ ૩૧. અશ્વા  
૩૨. લોલુપતા ૩૩. કામુકતા ૩૪. વાસના ૩૫. લાલચ ૩૬. મદ ૩૭. ગર્ભ  
૩૮. બિલત્સ ૩૯. લાચારી ૪૦. અલિચાર ૪૧. વ્યલિચાર ૪૨. વિલાસ  
૪૩. વિકૃતિ ૪૪. વિશ્વાસધાત ૪૫. અન્ધિર ૪૬. દેખ ૪૭. દુરમાણ  
૪૮. મદાંદ ૪૯. સ્વરંધ ૫૦. આત્મદ્રોહી ૫૧. વ્યા ૫૨. ઉંગ ૫૩. ગ્રાસ  
૫૪. વિહવળ ૫૫. નિર્બળ ૫૬. પરાનિત ૫૭. શુન્યમનસ્ક ૫૮. ચીડીમાપણ  
૫૯. નિજુર ૬૦. સંકુચિત ૬૧. આક્રમક ૬૨. સ્વકેન્દ્રી ૬૩. પ્રમાહી ૬૪.  
અતિરેક.

હદ્ય સિંહાસન, બત્તીસ સર્જનાત્મક Positive લક્ષણો અને ચોપાણા  
વિનાશાત્મક (Negative) વૃત્તિઓ - જોગણીઓ - લાગણીઓની વાત  
કરી.

વિકભ અને વેતાળને પણ આપણે બધા જ ઓળખીએ છીએ તે  
વેતાળ વિકમના અભા પર ચડી બેસતો હતો. પ્રભાવ પાડવાની હોણિમ

હતો હતો, શાકાસી પકડથી વિકમને ચોંદી પડતો હતો અને પછી એને  
તે વાતો છેતો હતો અને દરેક વાતાને અંતે એક પ્રેન પુછતો હતો.

“નીચા આમાં સાચું શું ? અને ખોટું શું ? તું જે સાચો જવાબ  
તો આપો તો તારા મસ્તકના બે ટુકડા થઈ જશે.”

બત્તીસ બધી જ વાતોમાં સામાન્ય માનવી દ્વિધામાં પડી જય  
શકી નથેં આવતા. જે ખોટું હોય તે સાચું લાગતું કે સાચું હોય તે  
નથેં હશે, પણ વાર બન્ને વાતો સાચી લાગે તો બેધ પ્રેનો ખોય  
શકી નથેં અને જ્યારે પેલો બત્તીસ લક્ષણો વિકભ ફર્દ દઈને કહે કે આ  
સાચું ને આ ખોટું ત્યારે આપણને લાગે કે “બરોબર - આણો સાચો જ  
નિર્ધાર નાથો”.

આપણા બધાંના જ જીવનમાં પણ ક્ષણો ક્ષણો આવી દ્વિધાઓ  
નિર્ધાર કરતી સમસ્યાઓ આવે જ છે જેમાં સાચા ખોટાનો નિર્ણય  
નિર્ધાર આપું બને છે.

વિકભ બત્તીસ લક્ષણો હતો એટે એની સર્જનાત્મક બધી જ  
કુટુંબી વેતાળા કદમ્બના સિંહાસન પર પેલી પૂતળીઓની જેમ નિર્ણયના  
નિર્ણય નિર્ણય કરતી. વેતાળ - એટે સ્વાર્થ અને પૂર્વગ્રહના  
નિર્ણય માનવીના નિર્ણય પર પડતો પ્રભાવ. જેને લીધે એને ખોટું જ  
નિર્ણય નાને અને સાચું જલ્દી સમન્ય નહીં અને પેલી ચોસઠ  
નિર્ણય પુસ્તિઓ પછી હંમેશાં માનવીને ખોટાને નિર્ણયે લેવા મજબૂર કરે.

વિકભ વેતાળને વશ કર્યો હતો એટે કે એના હદ્યના સિંહાસન  
નિર્ણય ‘સ્વાર્થ અને પૂર્વગ્રહ’ના વેતાળનો પ્રભાવ પડવા દીધો ન હતો  
તે હીને વાતો જ્યારે મુશ્કુલતા પ્રેનો એની સામે આવતા ત્યારે

ત્યારે વિનાસંકેતે સ્થિતઃપ્રકાશાથી સ્થિર બુધ્યથી એ ત્વરિત નિષ્ઠા  
લઈ શકતો અને એ નિર્ણય સત્ય અને સચ્ચોટ રહેતો.

આ નિર્ણયોમાં જે પેતી નકારાત્મક વૃત્તિઓ જોગણીઓ હું એનો પણ એ જરૂર પડે રચનાત્મક ઉપયોગ ભરપૂર પ્રમાણમાં હાં લિંગસા લોખ, ઘોલ ઈત્યાદિ જ્યારે પણ કરતો ત્યારે પોતાના સ્વાર્થ ખાં કે વેર લેવાની ભાવનાથી પ્રેરાઇન ન કરતો અને એથી સમગ્ર દરમિયાન એણે પેતી નકારાત્મક વિનાશક જોગણીઓનો એણે રચનાત્મક સૌંદર્ય ઉપયોગ કરી એમને જોગણીઓમાંથી પોતાની બનાવી હું

ईतिश्री विक्कम पुराणे....

આપણા રોજેરોજના જીવનમાં આપણો બધાંનો અનુભવ હોડોઈ પણ મુશ્કેલ કાર્ય સિદ્ધ કરવા માટે કોઈ બત્તીસ લક્ષણા પુરુષ પસંદ કરવામાં આવે છે. તો કોઈ રાક્ષસી - પિશાચી અમાનુષિ લક્ષણ સિદ્ધ માટે કોઈ બત્તીસ લક્ષણા પુરુખનો બલિ ચાદાવવામાં આવે.

જીવનમાં કાણે કાણે આવાં કાર્યો કરવા માટે જે નિર્ણયો લેવાનું હોય તે નિર્ણયો લેવાનું કાર્ય બુધ્યિનું હોય. પ્રકાશનું હોય અને એ પ્રકાશને રહેવાનું બળ - પ્રેરણા અને હિંસત પુરુષ પાડવાનું કાર્ય બચીસ લાગુણું હોયનું હોય.

અને જેટલી વેળા આવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે, ક્રિધારોનું મંથન અનુભવાય છે અને નિર્ણયો લેવાય છે એટલી બધી જ આ સર્વ પ્રક્રિયાના પ્રતિભાવો, પ્રતિબિંબો અને પદધારો માનવીનું હૃદય પર પડે છે. આ તમારું હૃદય છે. એ કોઈ જડ બુકો નથી. એ હૃદયના ઘબકારાને સાંભળવા સ્ટેથોસ્કોપ કામમાં નથી કે એને માપવા, એના સ્પષ્ટનો ઝીલવા એની સંવેદનાની

*and which were for safety revo-*

સર્વિધાન કલા એ કોઈ ગ્રાફ દોરેલા કાગળની પઢી પર વાંકાચુંકા  
નીં રીતા હાલતં કાડીઓચાફના મશીનના બસની લિમારી નથી.

જીમને સમજવા માટે આણ્ટાં વાતો ઓઈ પડતી હોય તો આવો  
કરી રાખ પણ કરી જ લઈએ.

આમે હવ્યાની વાતો ગમે તેને કહેવાતી નથી અને કહેવી હોય  
તીર્થ આંબળવા વાળું સુપાત્ર ગોત્વા જઈએ તો ય મળતું નથી.

હદ્ય ઉભારાઈ જાય છે, હદ્ય છલકાઈ જાય છે. હદ્ય ખાલી પડી  
જાય છે તો બેને ખાલી પણ ચડી જાય છે, હદ્ય પિત્તી ઉઠ છે ને મૂરજાઈ  
જાય છે. હદ્ય વિઘળાઈ જાય છે ને સુકાઈ પણ જાય છે હદ્ય રિસાય  
જાય તો માની પણ જાય છે. એ વજ જેવું કઠોર તો કુસુમાદિઅપિ  
પણ ખાઈ જાય છે. હદ્ય લન્ઝમણીના થોડની માફક લન્ઝાય છે,  
એ પ્રેમમાં પડે છે - (એ તો તમને ખબર છે નહીં ?)  
જીત પડતું નથી. એ કુદ્કા મારે છે (DIVING) ઉછાળા મારે છે.  
જીત લાગે છે, હદ્ય સળગે છે, એ બિંજાઈ પણ જાય છે,  
જીત જાય છે, એ પીગળી પણ જાય છે તે દ્રવી પણ શકે છે. હદ્ય  
જીતથી ઉઠ છે ને આનંદથી ઝરી પણ ઉઠ છે.

જીએ જેમણ કદી કદી ખાંડું થઈ જય, કદી તુંનું થાય તો કદી કડવાશ  
જાય, જેનામાં ખાર પણ ચેડે, એ મરયાં જેવું તિખું તમ તમે,  
જેવું પણ પણ બની જાય.

મનુષી ભોગે, કાનમાં ગુસ્પાસ વાતો કરે, ગુનગુનાય ધાંય પડે,  
અને પિંજાકાર કરી ઉઠે, આકોશ કરે અને વખત આવે બળવો પણ

એ કલ્પનાઓ કરે, સ્વભાવાંઓ રહે, ચિન્તા દોશેને કબિતાઓ પણ લખે, એ પળવારમાં પરીઓના પ્રેરણમાં આંદો મારી આવે, પતંગિયાની જેમ હવામાં દૂર દૂર ઉદ્ધ, એને પાંખો આવે ને એની પાંખો કપાઈ પણ જાય, તો ફરી ઉંગય ખરી, એ પળમાં જેજન માપે, દેશ-વિદેશમાં અની બેઠાં બેઠાં ફરી આવે, કોઈને મળી આવે. કોઈને સ્વભાવમાં કંઈક કહીને આવે તો કોઈને બખિયની ચેતવણી પણ આપી આવે (બ્લેપ્ટી  
Telepathy)

એ પ્રેમમાં તો પડે, ને એથું પડે કે ડેસ કાગે, પછાણ્યે ખાય, છટપે, તરફકે, ઘવાય, ઝૂરે, તડપે, એના હજાર ટુકડે ટુકડા થઇને વેણી જાય, (કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા)

એ હદ્દ્ય કોઈને બંધનમાં બાંધી હે, તો કોઈનાં જન્મ જન્મનાં બંધન એક જાટકામાં તોડી પણ નાંખે.

અરે, એ તમારી છાતીમાં ધબકતું હોય પણ હકીકતમાં એ તમારી પાસે હોય જ નહીં. એ કોઈને અર્પણ થઈ ગયું હોય, કોઈના પર કુણાના કરી દીધું હોય, કોઈની પર ન્યોષાવર થઈ ગયું હોય.....

આ છે હદ્દ્ય... તમારું પોતાનું આગવું અસ્તિત્વ !

એની ધડકનના તાત સાથે તાત મિલાવી જીવશો તો એ તમો ઉત્કૃષ્ટ જીવન જીવામાં મદદરૂપ થરો. છેલ્લી ધડકન સુધી અત્યારે વફાદાર રહેશે. એના ધબકારાનું સંગીત ફૂત તમારા સાંભળવા મુશ્કે સન્મેશું હોય એનાં સ્પષ્ટનો અને સંવેદનાઓ એ તમારી અંગત, આગવી પણનાં બાબત છે. નો જો અનાણાતાં પણ કોઈ એને અભડાવી ન જાય.



## ક્લાન્ડ મહામૂલાં મંતવ્યો

### ARRHYTHMIAS

ARRHYTHMIA = A = NOT

RHYTHMOS = RHYTHM Any deviation from the Normal Rhythm e.g. of the heart.

Courtesy Book's Name : HARRISON'S PRINCIPLES  
OF INTERNAL MEDICINE Vol. I 12th Edition. Chapter  
No. 174, Page 841.... Chapter Title : Approach to the  
patient with heart disease by EUGENE BRAUNWALD.

Although the ECG is an invaluable aspect of every cardiovascular examination, with the exception of the identification of ARRHYTHMIAS, it rarely permits establishment of a specific diagnosis.

In the absence of other abnormal findings, electrocardiographic changes MUST NOT BE OVERINTERPRETED.

The RANGE of normal electrocardiographic findings is wide and the tracing can be affected significantly

by many NON-CARDIAC FACTORS, such as age, body habitus and serum electrolyte concentrations.

2) PITFALLS IN CARDIOVASCULAR MEDICINE  
Increasing sub-specialisation in Internal Medicine and the perfection of advanced diagnostic techniques in cardiology MAY SOMETIMES (?) (NAY ! Many a times or even most of the times) be accompanied by several UNDESIRABLE CONSEQUENCES, which can be summarised as follows.

1. Failure by the Non-Cardiologist to recognize cardiac manifestations of systemic illnesses (about 10 diseases are listed whose symptoms are similar to heart diseases).

2. Failure by THE CARDIAC SPECIALIST to recognize and underlying systemic illness such as those listed above.

3. OVER - RELIANCE ON AND OVER UTILIZATION of laboratory tests, particularly specialized INVASIVE TECHNIQUES for the examination of cardio vascular system.

#### Electrocardiography (ECG)

Chapter 176. Page 850  
by Robert J. Myerburg.

Early in the development of ECG, EINTHOVEN popularized the concepts that the human body represents

a large volume of conductor having the source of cardiac electrical activity at its centre, While the theory is NOT STRICTLY ACCURATE, it provides the clinician with a practical point from which to start.....

#### ગુજરાતીમાં બાવાનુવાદ

(i) ઇલેક્ટોગ્રામ (ECG) હદ્યની બધી જ બિમારીઓના નિદાન માટે જુદી અગત્યાનું સાધન છે. પરંતુ હદ્યના તાત્ત્વદ્વારા ઘબકારામાં જુદી જુદી ફેરફાર સિવાય બીજું કંઈ પણ એ ચોકસાઈપૂર્વક રીતી રાખું નથી.

બાબી અગર જો દદ્દિન અન્ય કોઈ ચોકકસ હદ્યરોગની રીતીની જોવામાં ન આવતી હોય તો કાર્ડીઓગ્રામના લિટાંને વધુ સરળ આપવાની જરાય આપશ્યકતા નથી.

(ii) બિમારીના નિદાનોમાં ભયસ્થાનો

નવા ને વધુ ગુંચવાડાં ભર્યો નિદાનનાં ઉપકરણોનો રીત (?) હદ્યરોગની જુદી જુદી બિમારીઓમાં રોજ નવા પેદા થતા રીતીની (Sub specialists) કેટલીક વાર (નહીં મોય ભાગે) ન રહેતું પરીક્ષામો લાવી શકે છે.

ઉદ્દેશ્ય : ઓગાણીસ એવી બીજી બિમારીઓ છે જેની નિશાનીઓ રીતીની હદ્ય રોગની બિમારીઓને મળતી આવે છે. મોય ભાગની રીતીની નિશાનીઓને પહેલી જ તપાસમાં હદ્યની બિમારીનું રીતીની જાય છે. જે હદ્યરોગનો નિષ્ણાત ન હોય તેવો ડૉક્ટર પણ

પોતાના પેશાનને હૃદયનો રોગી (Heart Patient) બનાવવા ઉતાવળો ને ઉત્સુક હોય છે.

અને આવા સામાન્ય ડૉક્ટર દ્વારા સ્પેશીયાલીસ્ટ પાસે મોકલાવાની આવેલા પેશાનને પેલો સ્પેશીયાલીસ્ટ (પેલા ડૉક્ટરને ખૂશ કરવા - આજી ડેસ્ટ્રિક હૃદયરોગના મરીઝનો ન ભૂસાય તેવો રખર સેટ્ય નાથી હોય છે).

હૃદય રોગની બિમારી માટે કરવામાં આવતા સેંકડો જાતના ગુણજૂદા લેબોરેટરી ટેસ્ટ "લાવો એક ટેસ્ટ કરાવી લઈએ ને હોય તે બનાવી પડી જશો" એવી નિયતથી કરાવેલા ટેસ્ટ કેટલાય તંદુરસ્ત રીતીની રાતોરાત બિમાર બનાવી હોય છે. આવા ટેસ્ટનું કોઈ રીચેક્ટિંગ, કરાવણું નાથી અને એ બધા જ ટેસ્ટ સાચા જ છે એમ માનવને પણ કોઈ નિર્ણય વજુદ નથી.



"ગ્રાણીઓ પર અમાનુષી અખતરા કરી કરીને અમુક હવાઓ માનવીઓના રોગોમાં ફયદા કરે છે, એવા વાહયાત કરીને જે દવાઓ બના હિસાબે લાખો કરોડો માનવીઓને અવડાવવામાં આવે છે. એનાથી સમગ્ર માનવજલિનાં રાતીનું અદ્ભૂત ર્યાનાતંત્ર ખોરવાઈ ગયું છે અને બિમારીઓનાં પ્રયાણ ઘટવાને બદલે વધ્યાં છે. દવાઓનાં પુકસાનો પ્રત્યે પ્રકારો ચેતવવાનો સમય આવી ગયો છે"

A MANIFESTO JOINTLY SIGNED BY WELLKNOWN SCIENTISTS (PUBLISHED IN 1971)

- 1) PETER BEACONSFIELD
- 2) REBECA RAINSBURY
- 3) JACQUES MONOD.
- 4) RAYMOND PAUL (FRANCE)
- 5) HUGO THEORELL (SWEDEN)

૧૧

## ઓંજાઈનલ પેઇન ANGINA PECTORIS

ANGINA - LATIN ANGERE = To strangle.

Sense of Suffocation or constriction Angina Pectoris, severe but temporary attack of cardiac pain which may radiate to arms - Results from Myocardial Ischemia - often the attack is induced BY EXERCISE.

હૃદય રોગના દર્દને બેનું નામ મોઢે છે અને જેના નામે લાખો લાખી અખાને દ્વારાઓને, કરોડો અખાને ઇપિયાની દવાઓ અવડાવવામાં લાગે છે. જે દવાઓ દર્દી આખો હિવસ ભીસામાં લઈને ફેરે છે ને રાતના રાતીની નીચે મુકીને સુઈ જાય છે. એક બાટલી બાથર્ડમ કે સંડાસમાં રાતીની ધાર એમ રાખી મુકે છે અને છાતીમાં જરાક કુંખાવો મહેસુસ કરી નું હોય જ એક ગોળી લલ ઉપર, લભની નીચે, પેંડા કે ગાલની પાણી પાણી હોય છે અને એમ માને છે કે "હાશ હવે મને હાઈ એક નહીં હાઈ" ને બેન્જાઈના વિચે ન જણીએ તો હૃદયની વાતો બધી જ અધુરી નાથી નથી. નાથી નાથીની નાથી નાથી નાથી (નાથીનીનાથી)

એન્જરીના એ લેટીન એન્જાર (Angere) શબ્દ પરથી આવેલો શબ્દ છે, જેનો અર્થ (ગરું) દ્વારાવું એવો થાય. મેડિકલ ડીક્ષણરીમાં જણાવ્યા પ્રમાણે ગરું દ્વારાવાથી ખાસ રૂધાય એવું લાગે, ગભરામણ જેવું લાગે અને પછી એ દ્વારા છાતીમાંથી હાથની ભૂલાંઓ સુધી ફેલાય. આ એન્જરીનલ પેઈન હૃદય રોગના હુમલાને કારણે આવે ને દુઃખે પ્રમાણમાં વધુ (Severe) પણ એની સમય મર્યાદા ખૂબ ટુંકા ગાળાની તાત્પુરતી (Temporary) હોય. હૃદયના સ્નાયુઓને જ્યારે રક્તનો પુરવ્યો ઓછા પ્રમાણમાં મળે ત્યારે આવો દુઃખાવો થાય - OFTEN મોટા ભાગે આવો દુઃખાવો (અક્કલ વગરની - વિનાકારણ કરવામાં આવતી) કસરતો અને આસનો કરવાથી પણ થતો હોય છે.

આવા એન્જરીનલ પેઈન માટે પેલી મોદામાં મુકવાની ગોળીઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. મોદાના અંદરની ત્વચામાં, ગોળીમાં રહેલાં રસાયણો ખૂબ જ જલ્દીથી ચુસાઈન લોહીમાં ભળી જય છે અને એની તાત્કાલિક અસર થાય છે.

આવી ગોળીઓ ખાવાની સલાહ આપતી વેળાએ આ જાતની દવાઓ ક્યા સંલેગોમાં ન ખવાય (CONTRA INDICATION) એ ભાગે જ દર્દને વિગતવાર સમજવીને જણાવવામાં આવતું હોય છે અને એવી દવાઓની આડ - અસરો (Reactions) કેવી હોય છે એ તો કોઈને કહેવું જ નથી.

જ્યારે જ્યારે ન આપવી જોઈએ, Contra Indicated હોય તેવા દર્દાઓને આ દવાઓ આપવામાં આવે છે, અને જ્યાં આપી શકાય તેવી હોય (Indicated) પરંતુ પુરતી સાવચેતી ન રાખી હોય, દર્દાની શારીરિક સ્થિતિ, એની પહેલાંની બિમારીઓ, ઈત્યાદિ અને દવાની કોઈ આડ-અસર (Reaction) આવે ત્યારે કોઈ પણ ડૉક્ટર એ સીએક્ષન અને આપવામાં

આવેલી દવાથી થયું છે એમ કબુલ કરવા માંગતો જ નથી. જેવા પ્રકારનું રીએક્ષન આવ્યું હોય તે રીએક્ષનને એક નવી જ બિમારી ગણી વળી એની નવેસરથી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે. ઘણીવાર પેલી રીએક્ષન લાવવા વાળી દવાઓ બંધ કરવાનું કહેવાનું પણ ભૂતી જવાય છે. પરિણામ જે આવ્યું જોઈએ તેજ આવે છે. દર્દી જે બિમારી માટે દવા ખાતો હતો તે બિમારી અસલમાં હતી તે કરતાં વધી જાય છે અને એની સાથે બીજી બે ચાર બિમારીઓ નવેસરથી એના શરીરમાં પેટા થઈ જાય છે.

જેણે CRUEL JOKE એક કૂર અશકીરીની કક્ષામાં મુકી શકાય એવી હકીકત તો એ છે કે “જે બિમારી માટે આ દવા ખવડાવવામાં આવે છે એજ દવાથી પેલી બિમારી સારી થવાને બદલે વધી જાય છે, અરે કોઈ કોઈ વાર તો દર્દી એજ બિમારી વધી જવાને કારણે મરી પણ જાય છે.

આ કોઈ બેન્જવાબદારી બધું વિધાન નથી. ને સત્ય છે તે જ રજુ કર્યું છે. આયો, ને દવાઓ એન્જરીનલ પેઈન માટે ખવડાવવામાં આવે છે એનાં ત્રણ ખૂબ જ અગત્યનાં પાસાને નજીકથી જોઈ લઈએ એઠે આ વાત કેટલી સત્ય છે તે સમજાઈ જશે.

આ ત્રણ પાસાનાં નામ છે.

1. Contra Indication : ક્યા સંલેગોમાં દર્દને આ દવા ન અપાય.
2. Special Precautions : ખાસ સાવચેતી - તકેદારી રાખવી.
3. ADVERSE DRUG Reaction : દવાનાં વિષમ પરીક્ષામો.

ને વ્યક્તિને નીચે જણાવેલ કોઈપણ તકલીફ હોય એને એન્જરીનલ પેઈન માટે આપવામાં આવતી દવા ન અપાય.

**CONTRA INDICATION**

- |                                     |                         |
|-------------------------------------|-------------------------|
| 1) Bradycardia                      | 11) Pregnancy           |
| 2) Heart Block                      | 12) Lactation           |
| 3) Cardiac failure                  | 13) Glaucoma.           |
| 4) Cardiogenic Shock                | 14) Hypotension         |
| 5) Hypertropic Cardio myopathy      | 15) Broncho spasms.     |
| 6) Cerebral Haemorrhage             | 16) Metabolic Acidosis. |
| 7) Heart failure                    | 17) Prolonged fasting   |
| 8) 2nd or 3rd degree Heart block    | 18) Verapamil Therapy   |
| 9) Myocardial Infarction            | 19) Bronchial Asthma    |
| 10) Impaired Peripheral Circulation | 20) Hypersens.          |

આ અને બીજા પાનાઓ પર આપેલા અંગેણ શબ્દોના ગુજરાતી અર્થ આ પુસ્તકના છેવાળના પાનાં પર આપેલ છે.

**Special Precautions : ખાસ ચેતવણી**

હદ્ય રોગના દર્દીને સામાન્ય રીતે ને દવાઓ આપવામાં આવે છે તેમાંની

- |                  |                     |
|------------------|---------------------|
| 1) DIURETICS     | 2) CORTICOSTEROIDS, |
| 3) CARBANOXOLONE | 4) AMPHOTERICIN.    |

આવી દવાઓ શરીરમાં પોયસીઅમનું પ્રમાણ ઘટાડી નાખે છે અને આવી દવાઓની સાથે ને એન્જઈનલ પેઇનની દવાઓ આપવામાં આવે તો પોયસીઅમનું પ્રમાણ એટલું બધું ઘટી જય કે નેથી હદ્ય પર ખરાબ અસર પડે.

આવી જ રીતે ને દવાઓ શરીરમાં કેલ્સીઅમનું પ્રમાણ વધારતી હોય અને મેનેસીઅમનું પ્રમાણ ઘટાડી હોય તેવી દવાઓ સાથે પણ એન્જઈનલ પેઇનની દવાઓ ન અપાય.

કાર્ડીયાક ગ્લાઈકોસાઇડ્સ Cardiac Glycosides ની શ્રેષ્ઠીમાં આવતી એન્જઈનલ પેઇનની દવાઓ જેમની તેમ પેસાબ વટે બહાર નીકળી જય છે એથે જેને કીડની અને પેસાબની તકલીફ હોય એવા દર્દીમાં આ દવાઓ ખૂબ જ સંબાળપૂર્વક આપવી, નેથી કીડનીને નુકશાન ન થાય.

**હદ્યરોગમાં ધૂટથી વપરાતી દવાઓનાં****Reactions - આડ - અસરો**

- |                                      |                        |
|--------------------------------------|------------------------|
| 1. Anorexia                          | 2. nausea              |
| 3. Vomiting                          | 4. Diarrhoea           |
| 5. Abdominal Pain                    | 6. Headache            |
| 7. Facial Pain                       | 8. Disorientation      |
| 9. Confusion                         | 10. Blurred Vision     |
| 11. Green & Yellow Vision            | 12. Extra systoles     |
| 13. Atrial & Ventricular Arrhythmias | 14. Conduction Defects |

The usual cause of death following Cardiac Glycosides poisoning (Digitalis) is Ventricular Fibrillation - Conduction disturbances.

### Glyceryl Trinitrates Side effects

મોઢામાં મુકવાની ગોળીઓની ત્રેણીની આડ અસરો

1. CONSTIPATION
2. INDIGESTION
3. HEADACHE
4. INCREASE IN INTERA OCULAR PRESSURE
5. FLUSHING
6. COLD SWEATS
7. COLD EXTREMITIES
8. HYPOTENSION
9. CYANOSIS
10. METHAEMOGLOBINEMIA
11. DIZZINESS
12. WHEEZING
13. OEDEMA
14. SYNCOPE
15. RESPIRATORY IMPAIRMENT
16. SKIN & EYE REACTIONS
17. HYPERSENS
18. JAUNDICE
19. SLEEP DISTURBANCES
20. DREAMS
21. FATIGUE
22. WHEEZING
23. GINGIVAL HYPERPLASIA
24. BRADYCARDIA
25. TRACHYCARDIA
26. ISCHEMIC PAIN
27. ANGINA

૧૨

### રાધા ક્યું ગોરી ? મૈં ક્યું કાલા ?

“યશોમતિ મેયા સે પુછે નંદલાલા રાધા ક્યું ગોરી ? મૈં ક્યું કાલા ?

સારું થયું કે એ જમાનામાં કાઈઓલોલ્લસ્ટ નામનું કોઈ પ્રાણી પેદા નહોંનું થયું નહીં તો પરહોદા મા કૃષણે કહેત :

“બેદા મને તો અભર નથી પણ ઉલ્લો રહે હું હાઈ સ્પેશીઆલીસ્ટની એપોઇન્ટમેન્ટ લઈ લઉં પછી આપણે એને પુછીશું એઠે અભર પડી જશે.”

પછી એપોઇન્ટમેન્ટ લેવાય. નંદલાલ યાદવ અને મીસીસ જશોદા યાદવ એમના ઈક્લોટા બેદા કૃષણે લઈને કન્સલ્ટેશન કરવા જાય.

પછી પચીસ જાતના ટેસ્ટ કરાવાય, પચાસ જાતના ધક્કા અવડાવાય અને બધા રીપોર્ટે પાછળ બસો - પાંચસો ગાયો વેચાઈ જાય એથેલો ખરચ થાય પછી પેલો સ્પેશીઆલીસ્ટ એકદમ સીરયસ થઈ કહે :

“મીસ્ટર યાદવ તમારા છોકરા કૃષણે હદ્ધયનાં પડદામાં વરચે એક કાણું છે જેને લીધે એના હદ્ધયમાં શુદ્ધ અને અશુદ્ધ લોહી એકબીજામાં ભણી જાય છે અને એ બેણસેળીયું લોહી પછી આપા શરીરમાં ફરે છે

એટલે તમારા છોકરાના શરીરનો રંગ ભૂરો બ્લ્યુર્ઝ છે. ચુ.સી. અમારી ડૉક્ટરોની બાચામાં એને બ્લુ બેબી Blue Baby કહેવામાં આવે છે."

કનૈથાને ગભરાઈને બાથમાં લઈ હાંફળી ફંફળી જશોદા પેલા ડૉક્ટરને પુછે છે. "એનો ઈલાજ શું ડૉક્ટર. મારો કનૈથો મરી તો નહીં જય ને ?"

એનો બાપ મરી ગયો હોથ એટલો ગંભીર થઈને પેલો ડૉક્ટર એનું ભોડું હલાવિને કહે છે : "ધીસ ઈજ વેરી સીરીયસ મીસીસ યાદવ. આ એક બયંકર બિમારી છે. એનો ઈલાજ ફક્ત ઈમરજન્સી ઓપરેશન છે. મેજર ઓપન હાઈ સર્જરી ચુ.સી ? અમે એ કાણું સીલી દર્દથું એટલે ઘોર સન વીલ બી ફરીન - નથીંગ કુ વરી. ઓન્ટી....."

"ઓનલી શું ડૉક્ટર ?" મીસ્ટર યાદવ પુછે છે

"ઓનલી એનો ખર્ચ...." ડૉક્ટર...

"ખર્ચ કેટલો આવશે ડૉક્ટર ?" મીસ્ટર યાદવ

"ખાસ વધારે નહીં... ફક્ત બે હજાર ગાયો બાઈટમાં અને..."

"અને ?"

"ફક્ત એડવાન્સમાં એક હજાર કાળી ગાયો આઈમીન બ્લેકમાં"

ચુંસી ?

હવે તમને મને અને નાના બચ્ચાનેથી ખબર છે કે શ્યામ - ઘનશ્યામ કૃષ્ણનો જન્મ એક અંધારી રાતે મામા કંસની સાવ Unhygienic ગંઢી ગોખરી નેલમાં થયો હતો. તુરતના જન્મેલા એ બાળકને ગોપલીમાં મુકી ધોઘમાર વરસતા વરસાદમાં એનો બાપ વસુદેવ એને જમુના નહીં પાર કરી મથુરામાંથી ચોરી છુપીથી ગોકુળમાં મુકી આવ્યો હતો.

Congenital Heart Defect જન્મ જાત હૃદયની ખોડ લઈને જન્મેલા કૃષ્ણને આવા વરસાદમાં પલળવાથી કોઈ ન્યુકોનિયા નહોતો થયો કે શરીરી પણ નહોતી થઈ.

એનું બાળપણ તો આપણને બધાને સાવ મોઢે છે (By heart) ચુ સી ? એ દહીની મટકીઓ ફોડતો, માયણ ચોરીને આતો. એને કોઈ કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ થયું નહોતું કે નહોતું કીર્તિ હાર્ડ્ઝ્રૂલ.

એ સાવ સાચી વાત છે કે એના હૃદયના પડદામાં કાણું હતું પણ આ તકલીફ એને ન તો નાનપણમાં નહીં હતી કે ન ચુવાનીમાં. સમગ્ર કૃષ્ણાવતારમાં કૃષ્ણ કદી માંગળીના બિધાને બિમાર થઈને પણો હોથ, અશક્ત થયો હોથ કે એને હાઈ એક આવ્યો હોથ એવું ક્યાંથ પણ નોંધવામાં આવ્યું નથી.

એ કૃષ્ણે સમગ્ર જીવનમાં સામાન્ય માનવી કરતાં ઘણું બધું વધુ કરીને બતાવ્યું. એનું મૃત્યુ પણ કોઈ હાઈ ટ્ર્યુલ કે હાઈ એકથી નથી આવ્યું. એક અક્સમાત પારધીના તીરથી ઘવાઈ એ મૃત્યુ પામ્યા.

એ જ શ્રી કૃષ્ણે એના હૃદયને કોઈની સારવારથી અભડાવા દીધું નહીં. એના હૃદયમાં રહેલા જીવ + આત્માને ભરપેટ જીવનની કાણે કાણે ઉપરોગમાં લીધો અને કદાચ એટલે જ

હૃદયની જન્મજાત ખાંગી લઈને જન્યો હોવા છીંતાં સમગ્ર માનવ જતિના જીવ અને આત્માનો ઉદ્ઘાર કરતી ગીતાના અદાર અધ્યાય કુદ્દેત્રના મેદાનમાં ઊભો રહી એકી જ્વાસે બોલી ગયો.



## કોલેસ્ટ્રોલ કૌભાંડ

આત્માર સુધીમાં પંદર સાયનીસ્ટેને (વૈજ્ઞાનિકોને) કોલેસ્ટ્રોલ પર સંશોધન કરવા માટે નોભેલ પ્રાઇજ મળી ચુક્યાં છે. (એમાંના એકનો નમૂનો આપણે નો બી.પી. નાં પુસ્તકમાં આપ્યો છે) એમણે માનવ જાતનું કેટલું બધું હોલ્સેલમાં બલુ કરી નાંયું છે? આવો એના પર એક નજર કરીએ.

આ બધા આંકડા ફક્ત અમેરિકા દેશના છે.

એના પરથી આખી દુનિયાના આંકડાનો અંદાજ બાંધી લેવો.

૧૯૮૪માં કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે દવાઓ ખાનારાઓની સંખ્યા ૨૫ લાખની હતી.

૧૯૯૦માં એ વધીને આઠ ગણી એટલે ૨ કરોડની થઈ.

પોતાનું કોલેસ્ટ્રોલ બરાબર રહે છે કે નહીં એ માટે ડૉક્ટરોની સલાહ લેવા માટે આ બે કરોડ પેશાન્યે મહિનામાં એકવાર પણ કન્સલેશન કરે તો એની સંખ્યા ઓછામાં ઓછી વરસમાં ચોવીસ કરોડની થાય.

એક વારની કન્સલ્ટીંગ ફીના સેરેરાશ પચાસ ડોલર્સ આપવામાં આવે તો એ રકમ ૨૪ કરોડ  $\times$  ૫૦ ડોલર્સ = ૧૨૦૦ કરોડ ડોલર્સની થાય.

દેરેક વખતે પોતાનું કોલેસ્ટ્રોલ કેટલું છે તે તપાસવા માટે દેરેક દ્વારા લેબોરેટરીમાં ટેસ્ટ કરવાનો પડે એટ્લે પેલા બે કરોડ માણસો મહિનામાં એક વાર એમ વરસમાં બાર વાર ટેસ્ટ કરાયે એટ્લે કુલ્લે ૨૪ કરોડ કોલેસ્ટ્રોલ ટેસ્ટ થયા. એક ટેસ્ટના ફક્ત દસ ડોલર્સની ફી ગણીએ તો ૨૪ કરોડ  $\times$  ૧૦ ડોલર્સ = ૨૪૦ કરોડ ડોલર્સ થયા. (આમાંથી પેલા ડૉક્ટરોને જે કમીશન મળે તેનો હિસાબ નથી)

હવે આવો આપણે કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ખવડાવવામાં આવતી દવાઓનાં વેચાણ પર એક નજર કરીએ. આ આંકડા પણ ફક્ત અમેરિકામાં વેચાતી દવાઓ પુરતા ૭ મર્યાદિત છે. દુનિયાભરના વેપલાનો અંદાજ બાંધી લેવો.

કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ખવડાવવામાં આવતી દવાઓનું ૧૯૮૮માં વાર્ષિક વેચાણ ૨૧,૭૩,૦૦૦૦૦ બે અબજ, સતત કરોડ, ત્રીસ લાખ, ડોલર્સ. આ દવાઓના વેચાણમાંથી પણ ડૉક્ટરોને જુદી જુદી સ્થાઈલથી આપવામાં આવતું કમીશન આપણે અંદાજે માપી લેવું.

આ તો થઈ ફક્ત ડૉક્ટરો, લેબોરેટરીઓ અને દવાઓની વાત. પણ “તથા ગરમ હે ધર ચલો હમ બી અપની રોટી પકા લે” વાળાઓ પણ જેઈ લઈ લઈએ.

તમારું કોલેસ્ટ્રોલ ન વધે એટલા માટે અમે ખાવાની સ્પેશિયલ આઈટમો બનાવીએ છીએ અને એમાં સવારે નાસ્તામાં ખાવામાં આવતા મકાઈના ચીવડાથી Corn flakes થી માંડી બધી જ જતના ઓરાક અને આઈસક્રીમ, પીણાં, સીગરેટ અને દાડ પણ આવી જાય. આમાંથી પોતાની

દાલાતી તો જેઈએ જ એટલે પછી અમેરિકન હાર્ટ એસોસીએશન જેવી સંસ્થાઓ બીલાડીના ઘેપની જેમ કુઠી નીકળે અને બજરમાં વેચાતા આવા માલના રેકેટે પર HEART CHECK એમ લાલ સ્ફેર અફરે શેરો મારી મંજુરીનો સિક્કો મારે (Seal of Approval) એ મારવાના પૈસા વસુલ કરે તે જુદા.

જે કોલેસ્ટ્રોલ માટે આધું મોટું જરૂરજરસ્ત કોલાંડ ચાલતું હોય તો હકીકતમાં તે ખરેખર જ ખૂબ ખરાબ હોવું જેઈએ. એનાથી હાર્ટ ડ્રાલ, બ્લડ પ્રેશર, બધું જ થતું હોવું જેઈએ અને એને કોઈપણ સંલેગોમાં ન જ વધવા હોવું જેઈએ. એમ આપણે માનીએ છીએ ખૂં ?

આવો - દુનિયાભરના નિષ્ણાતો એ ફારસ વિચે શું કહે છે એ એમના જ શાખામાં સાંબળીએ.

MICHAEL DEBAKEY

Famous Huston Heart Surgeon

SO FAR WE HAVE NOT FOUND THE CAUSE OF  
ATHEROSCLEROSIS

"હજુ સુધી ધમનીઓના કડક થઈ જવાનું સાચું કારણ અગે નાણી શક્યા નથી."

2. Twenty seven percent of the people I operate on, for a coronary by pass, have normal cholesterol levels. Their blood is as pure as driven snow, but the arteries are clogged.

બાયપાસ સર્જરીના જેટલા ઔપરેશનો હું કરું છું. એમાંના સત્તાવીસ કા દર્દીઓના લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ નોર્મલ હોય છે. એમનું લોહી

આકાશમાંથી ઝરભર વરસતા બરફના પતાકા હોવું શુદ્ધ હોય છે અને છતાં એમની ધમનીઓ કડક થઈને સંકોચાયેલી હોય છે.

ELIOT CORDAY

Professor of Clinical Medicine

University of California at Los Angeles.

1. You can't prove that lower cholesterol level mean anything. They certainly don't improve mortality rates. How can you say that changing the diet of the whole country will mean anything ?

1. લોહીમાં કોલેસ્ટ્રોલના લેવલનું નીચે હોવું જરૂરી છે જ. એ તમે કદી પુરવાર કરી શકવાના જ નથી. એમ કરવાથી (હાર્ટ એટક નહીં આવે અને) મૃત્યુનું પ્રમાણ ઘટશે એ વાત સાવ ખોટી છે. પુરા દેશવાસીઓનો રોજેરોનો ખોરાક ધરમૂળથી બદલાવી તમે ચમત્કાર કરશો એવું શા હિસાબે કહો છો ?

1. DANIEL STEINBERG University of California at San Diego. Some people with lots of cholesterol live to a healthy 90. While with far lower level die prematurely of heart attack.

1. કાયમ કોલેસ્ટ્રોલનું પ્રમાણ લોહીમાં વધુ રહેતું હોય અને નેવું વરસ સુધી સામાન્ય તંદુરસ્ત જીવન જીવા હોય તેવા ઘણા દાખલા છે જ્યારે ઘણા ઓછા લેવલના કોલેસ્ટ્રોલવાળાના ખૂબ જ નાની વિશે હાર્ટ એટકથી મૃત્યુ પામે છે એવા પણ ઘણા દાખલા છે જ. (મતલબ કોલેસ્ટ્રોલ અને હાર્ટએટકને સ્નાન સ્વીતકનોય સંબંધ નથી).

Dr. RICHARD GREGG - Research Administrator at BRISTOL - MYERS SQUIBB. Says In all the furore, don't forget that cholesterol is GOOD FOR YOU. It is a vital constituent of cell membranes, sex-hormones and the nervous system. Without it you will be a puddle on the floor.

The body makes most of the cholesterol it needs chiefly from the liver, though almost every other cell can manufacture it. The rest comes from diet.

કોલેસ્ટ્રોલ વિષે કરવામાં આવતા આ હોબાળામાં એ વાત જરાય ન ભૂલશો કે કોલેસ્ટ્રોલ તમારે માટે તમારા શરીર માટે સાંડ છે, જરૂરી છે. તમારા કોચોની રચના, સેક્સ હોર્મોન્સ અને સમગ્ર નર્વસ સીસ્ટમનું કોલેસ્ટ્રોલ એક અગત્યનું ઘણ્ઠ છે. કોલેસ્ટ્રોલ વગર તમે જરીન પર દોળાએલા પાણીના ખાનોથિયા જેવા છો.

શરીર પોતાને જરૂરી કોલેસ્ટ્રોલ લીવરમાંથી મોટા ભાગે બનાવી લે છે. જે કે શરીરના બધા જ કોચો પોતાને જરૂરી કોલેસ્ટ્રોલ બનાવી લેવાની ક્ષમતા ધરાવે છે, બનાવી લે છે. અને બાકીનું આપણા રોજેરોજના આહારમાંથી, ખોરાકમાંથી મળે છે.

THOMAS J. MOORE એના પુસ્તક HEART FAILURE માં શું કહે છે તે જોઈએ.

રીસર્ચ કરનારાઓ કદાપિ એ પુરવાર કરી શક્યા જ નથી કે ખોરાકમાં ધરખમ ફેરફારો કરવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોય એના કરતાં દર્દ કા પણ ઓછું'કરી શકાય છે. જેનું કોલેસ્ટ્રોલ ૨૩૦ (બોર્ડર લાઇન

પર) હોય એના આવામાં ગમે તેટલા કદક ફેરફારો (DIETTING) કરો તો પણ એ લેવલ ૨૦૦ સુધી આવી જરો એ માનવું બેવફૂરી છે.

થોમસ મૂરે તો આવી રીતે ડાયરીંગ કે દવાઓ આઈને કોલેસ્ટ્રોલ નીચું લાવવાથી હદ્દ રોગની બિમારીઓ થતી અટકાવી શકાય છે એ દાવને પણ પદ્ધત્યો છે. એના કહેવા પ્રમાણે

There is a medical version of military Industrial Complex, that includes both, an overzealous Pharmaceutical Industry and Doctors organizations like American Medical Association.

આ વાત કેટલી સાચી છે (નન સત્ય છે) એ આપણે આગળ આપેલ અભને ડિપિયાના આંકડાઓમાં નોઈ ટીંધું.

ELIOT CORDAY

Professor of Medicine at the University of California - Los Angeles

It is crazy to make people so neurotic about cholesterol. They focus on cholesterol but there are many other risk factors. They don't have the evidence and for CHRIST'S SAKE, you don't go to work on a billion dollar programme without facts.

The prudent diet thing is not going to give them A SINGLE DAY MORE OF LIFE

કોલેસ્ટ્રોલના નામથી જનતાને વિનાકારણ બડકાવી મારવી એ સરાસર ગુન્હો છે. કોલેસ્ટ્રોલને આથલું ખદુ મહત્વ આપતી વખતે (હાઈ એટેકના) બીજાં ધારણાં અગત્યનાં કારણો સાવ ભૂલાઈ જવાય છે અને કોલેસ્ટ્રોલ આથલું ખરાબ છે એ વાત સિદ્ધ કરવા મટે એમની પાસે કંઈ કહેતાં કંઈ કારણ કે પુરાવા છે જ નહીં.

કરોડો અબજે ડોલરનું કોલાંડ ભગવાનને ખાતર હવે બંધ કરો.

અક્કલ પૂર્વકનું (હકીકતમાં અક્કલ વગરનું) ડાયરીંગ કરવાથી એમના આયુષ્યમાં એક દિવસનો પણ વધારો તમે કરી શકવાના નથી જ નથી.

કોલેસ્ટ્રોલના કોલાંડનું અચ્યુતમૂળ કેશવમૂળ કરીએ એ પહેલાં બહુવારીને, જબરનસ્તીથી, મજબૂર કરીને ખવડાવવામાં આવતી આ દવાઓ માનવીના શરીરમાં એક ટકાનો પણ ફાયદો તો કરતી નથી નથીને નથી પરંતુ એ બધી જ દવાઓ કેટલાં નુકશાન કરે છે એ પણ આપણે જણી લઈએ. જેથી જલ્દી જલ્દી બનાવવા વાળો બેઠી જાય તો એને શું જવાબ આપવો તે આપણને આપતાં આવતે -

### કોલેસ્ટ્રોલ ઘટાડવા મટે ખવડાવવામાં

આપતી દવાઓની આડ અસરો

Headache = માથાનો દુઃખાવો થાય.

Gas = વાયુનું પ્રમાણ વધી જાય.

Diarrhea = પાતલા જુલાબ થઈ જાય.

Abdominal Pain = પેટમાં દુઃખાવો થાય.

Rash = ચામડી પર ઢક્ષતા આવે, ખંજવાળ આવે.

Nausea = ઉબડા આવે

Constipation = કબળુયાત થાય.

Diminished liver functions = લીવરની કાર્યશક્તિ બગડે, ખોરવાઈ જાય અને જાતનાતની બિમારીઓ થાય.

Gall Bladder = કમળો - કમળી થાય.

Gallstone = કમળીની પથરી થાય.

Dizziness = ચક્કર આવે.

Anorexia = ભૂખ મરી જાય. ખાવાની ઈરંધ્રા ન થાય.

આવે સુધી તો સાવ હલકી આડ અસરોની વાત થઈ. જે એથેરોસ્ક્લેરોસિસ થઈને હાઈ એટલા આવે એટલા મટે કોલેસ્ટ્રોલ ઘટાડવા મટે દવાઓ ખવડાવવામાં આવે છે એ દવાઓથી જ એથેરોસ્ક્લેરોસિસ થાય છે. અને આ દવાઓથી કેન્સર પણ થઈ શકે છે. ANY COMMENTS ? બોલો હવે કંઈ કહેણું છે ?




શરીરના અણુએ અણુને સતત જેની જરૂરત છે એવી સ્થિરઘટા જાળવી રાખવા મટે અત્યંત ઉપયોગી કોલેસ્ટ્રોલ ના ઘટાડવાથી જ શરીર હણરો બિમારીઓનો બોગ બને છે. એ વાત બધાં જ વેદકીય શાસ્ત્રોમાં જેર શોરથી ગોલી પીઠીને કરવામાં આવેલી જ છે.

## હદ્ય ટિપુઓ


હવે જે હદ્ય પર સો બસો જેણી વિવિધ લાગણીઓ ના પ્રભાવ પડતા હોય, અને એ પ્રભાવ પ્રમાણે એના પ્રતિભાવો (Reflections - Reactions) પણ અંકાતા હોય, તો સ્વાભાવિક છે કે પેલા મિનીટના બોતેર ધબકારામાં ઓણા વતા જરૂર પ્રમાણે થાય જ વળી.

અને પેલા, પોતાના નામની પાછળ ચાર કુટ લાંબું ડિગ્રીઓનું પુછું લટકાવીને હૃપા-હૃપ કરનાર હદ્યના નિષ્ણાતોનું જ કહેવું છે કે માનવીના હદ્યના ધબકારા મિનિટના ૧૦ થી માંડી વધીને મિનિટના ૨૭૦ સુધી પણ થઈ રહે છે અને જરૂરત પ્રમાણે, આવી રીતે આપ-મેળે વધી જતા ધબકારા, વળી પાછા પોતાની મેળે એના અસલ અંકડા પર આવી જ જાય છે.


અને હા.... જે બોતેર ધબકારા મિનિટના નોર્મલ કહેવામાં આવે છે એ નોર્મલનું માણીનું પણ ૧૦ થી ૧૫ સુધીનું હોય છે. એટલે એ પણ સાખિત થાય છે કે બ્યક્ટીટે બ્યક્ટીટે હદ્યના ધબકારા એક સરખા હોવા જ જોઈએ એ જરૂરી નથી. એટલું જ નહીં પરંતુ કંઈ લાગણીથી કંઈ બ્યક્ટીટના હદ્યના ધબકારા કેટલા પ્રમાણમાં વધી જવા જોઈએ કેટલા પ્રમાણમાં દીજા પડી જવા જોઈએ એનું પ્રમાણ પણ કોઈ નક્કી




SUPRA VENTRICULAR EXTRASYSTOLE




FIRST DEGREE A. V. BLOCK



SINUS TACHYCARDIA



RIGHT BUNDLE BRANCH BLOCK



ACUTE PERI CARDITIS

E.C.G. મૂઢ મારી ને શીબાવી શીબાવી મારી નાંખવાનું એક હાથવળું સાયન.

એ હાજુ નથી. ઉદાહરણ કાર્ડિઓગ્રામ કદાવતી જ પખતે કાર્ડિઓગ્રામ હાજી જ કોઈ રૂપાળી નસને જોઈને જ કોઈ દર્દીના હૃદયના ઘબકારા હાજી જીવ કે હૃદય એકાઉ ઘબકારો ચુકી જાય અને એની નોંધ પેલા હૃદયતિસ ઉપર નીચે ને વાંકા ચૂકા થતા લીટા પર પડે તો અને હૃદયના ક્રોણાય કે નહીં ?

૧૯૦૩ માં જર્મનીના Wilhelm Einthoven સ્ટ્રીંગ જેલ્વેનોમિટરથી હૃદયના ઘબકારાનું ગ્રાફીક નોંધ કરતું સાધન બનાવ્યું અને ૧૯૩૦માં એમાં હાજી ઘબકારો થઈ ૧૯૫૦માં આજનું ECG મશીન અસ્તિત્વમાં આવ્યું હતું માત્રનીના હૃદય પર અમાનુષિ આફ્ટોનાં વાદળાં ઘેરાવા લાગ્યાં.

હૃદા અગેરિકામાં દર વર્ષે સાત કરોડ પચાસ લાખ કાર્ડિઓગ્રામ હૃદયના આયે છે અને એમાંના અડધો અડધો ઇકત બ્હીકથી હૃદય હૃદયના મહીક બની જાય છે ને બાકીના અડધાને મારી મચડીને હૃદયના હોળી તરીક હોકી બેસાડવામાં આવે છે.

"ECG ના મશીનની શોધે સમગ્ર માનવ જીતિનું જેટલું નુકશાન હોય, જેટલું નુકશાન તો કદાચ એટમ બોંબની શોધે પણ નથી હોય" આ રાખ્દો મારા નથી. મુંબઈ શહેરના એક ખૂબ જ જાણીતા હૃદયના કાર્ડિઓલોજીસ્ટના હોય.

અને પછી પેલા અત્યંત સંવેદનાથી ભરેલા હૃદયને પેલા કહેવાતા હૃદયના નિખણાતોએ કેનું અને કેટલું રિબાવ્યું છે, વગોવ્યું છે અને પદ્ધતિસર હોય છે એનોય થોડો ઈતિહાસ નેઈ લઈએ.

માર્ગાનોયાં નિયમ છ નિર્ધારણ માર્ગાનોયાં હાડકાંડે પીંડા જાણ  
કાંદાંડ માંડાંડ માંડાંડ પીંડા જાણ નિયમ હોઈ છે કાંદાંડ  
માંડાંડ બેટ્રી ડાઉન થઈ જાય અને ગાડી ઘક્કા મારીને ચલાવવી ચું  
એમ હવ્યને ધખકારા મારવા ઘક્કો માસનારી બેટ્રીનું તૃપાણું નામ હોય  
મેકર છે.

૧૯૬૦માં સૌ પ્રથમ આવું પેસમેકર માનવીના શરીરમાં બેસાડાનાં  
આવ્યું અને તે પછીનાં પચીસ વર્ષોમાં એવરેટીની બેટ્રી બાળની  
શરમાવે એવો આ ઉધોગ કુતીને ફાળકે ગયો.

દર વર્ષે એક લાખ આવાં પેસ મેકરો ફક્ત અમેરિકામાં લગાડવાની  
આવે છે. અંદાજે પાંચ લાખ પેસ મેકર લગાડીને ફરતા માનવીઓ આજની  
તતીકમાં અમેરિકાના રસ્તાઓ પર રખડતા હોવાનો અંદાજ છે.

અમેરિકન કોલેજ ઔફ કાર્ડિઓલોજી અને અમેરિકન ની  
એસોસીએશન આવાં પેસ મેકર જેને બેસાડી શકાય એવી બિનાની  
જણ વર્ગમાં વહેંચી દે છે.

૧. Definately Indicated - અરેખર બેસાડું જરી છે તેવા

૨. Possibly Indicated - કદાચ બેસાડી નેવાય તેવા

૩. Not Indicated - કોઈ જરૂરત ન હોય તેવા

કૂંઠામાં અથવા સાનમાં કહીએ તો સામાન્ય જનતાના કોઈએ  
માનવીને પેસ મેકર બેસાડી શકાય. પછી એને એની અરેખર જરૂર  
હોય, કદાચ હોય કે સમૂળગી ન પણ હોય તો પણ... આવા જરૂર  
મેં ?

## બાય પાસ CORONARY ARTERY BYPASS GRAFTS (CABG)


હિત અમેરિકામાં દર વર્ષ એક લાખ પંચોતેર હજર આપેરેશનો હિત છે, અને લિંગુસ્ટોનમાં પણ બાય પાસ સર્જરીના આપેરેશનોના મુલાકાત હવે નોંધી શકાય એટલી મર્યાદામાં રહ્યા નથી. આપણા દેશમાં હિત પાસને જરૂરિયાત કરતાં સ્ટેલ્સ સીગ્બોલ વધુ માનવામાં આવે છે કે "મેં બે વાર બાય પાસ કરાવ્યું છે" કે "મેં પોર્ટર કે હમાલ પાસે પણ બાય પાસ કરાવ્યું છે" એમ કહી કોલર વાઈટ કરી વાત કરનારા માનીએ ગલીએ મળી આવે છે. અરે હવે તો અહીંથા જ બાયપાસનાં માર્ગબદ્ધ કલલખાનાં એટલાં બધાં ઉગી નીકળ્યાં છે કે પેલા પોર્ટરો દોડતા હિતાં અહીં આવે છે અને એમના એજન્ટ્સ એમને ઘેટાં બકરાં મેળવી માયપાસમાં મદદ કરે છે.

બાયપાસના તમાશાનું વર્ણન કરવા એક હજર પાનાનો ગ્રંથ નાનો

Cecil Text Book of Medicine ના ગ્રંથમાં DIRECT CORONARY ARTERY નામના પાના નં. ૩૨૮ પર આવેખેલા મુજબની આ ચાર લીટી ઘણું બધું સાનમાં સંમબન્ધી જાય છે. અથે મુજબ બેના જ શબ્દોમાં વાંચી લઈએ એટે ગલત રજુઆત કરવાની મજા ન આવે.

### Quote

..... Graft occlusion during the first year in most reported series, varies from 10 to 12 percent. Only a small additional percentage of grafts occlude during the 2nd and 3rd year.



હદ્ય રોગોને નામે જે ઉપયોગી કરવામાં આવે છે એના પરીકૃતામે હદ્ય રોગીનું નાનો

However CORONARY ARTERY SURGERY IS A PALLIATIVE PROCEDURE AND MOST PATIENTS REDEVELOP ANGINA MONTHS TO YEAR AFTER THE PROCEDURE

OCCLUSION = The closure of an opening especially of ducts or blood vessels. રક્તવાહિની લેને ખોલવામાં આવી હોય તે ફરી પાછી બીડાઈ જાય, સંકોચાઈ જાય.

PALLIATIVE = Anything which serves to Alleviate but cannot cure a disease.

અનુવાદ.

ગ્રાફટ (બાયપાસ)ના પહેલા વર્ષ દરમિયાન નોંધાયેલા કેસોમાં ખોલવામાં આવેલી રક્તવાહિની ફરી વાર સંકોચાઈને બંધ થઈ ગઈ હોય તેવા દસ્થી બાર ટકા કેસ જેવામાં આવ્યા. પછીના બીજા અને ત્રીજી વર્ષમાં આ ટકાવારીમાં થોડો વધારો નોંધાયો.

(બાયપાસ) કોરોનરી આર્ટરી સર્જરી એ કદાચ (તાત્પુરતું) દર્દ હળવું રક્તવામાં મદદકૃપ થતું હો. એ બિમારીને સારી (CURE) કરી શક્યું નથી જ. ઔપરેશનના થોડા મહિના કે વર્ષમાં જ દર્દીને ફરી એન્ઝાઇનાની તકલીફ શરૂ થઈ જાય છે.

### એન્જુઅપ્લાસ્ટી

PERCUTANEOUS TRANSLUMINAL ANGIOPLASTY

(PCTA)

Quote / CECILS TEXT BOOK OF MEDICINE Page 329.

GRUENTZIG introduced direct coronary artery dilatation with a balloon catheter (PCTA) in 1977.

About 70,000 PCTA are done annually. Approximately 30 percent of patients develop RESTENOSIS of the dilated coronary artery in the initial six months.

અનુવાદ:

ગ્રુન્ટ્ઝિગે ૧૯૭૭ માં બલુન કેથીટરથી કોરોનરી આર્ટરી પહોળી કરવાની શરૂઆત કરી.

દર વર્ષે PCTA નાં આવો ૫૦,૦૦૦ (સીટેર હજાર) ઔપરેશનો કરવામાં આવે છે.

અંદાજે (?) આવાં ઔપરેશનોમાંના તીસ ટકા દર્દીઓની ખોલીને પહોળી કરેલી ઘમનીઓ ફરી પાછી સંકોચાઈ જાય છે.

હુદયના લંગારનું બજાર એટલું તેજ છે કે રોજ નવા જવા અખતરાઓ થાય છે, હજારો - લાખો નહીં, કરોડો હુદયોની સાથે કુર રમતો રમાય છે અને વ્યવસ્થિત રીતે માનવીને જીવાડતાં બિયારાં માસુમ હુદયો કસાઈઓ અને ખાટકીઓના છારાઓથી છેદાતાં જાય છે.

આ બલિદાનની વેદી પરથી કેટલા બકરા બચે છે એ પણ આવો નેઈ લઈએ.

નીચેની મિન્ડ માન્ગિંગ કુલારી કોંક્રેટ કોન્ફિડાન્સના રીતે નાચ કરી શકતાં જીવાડતાં જાય છે.

SURVIVAL DATA (Page 339. Cecil) VETERANS ADMINISTRATION CO-OPERATIVE STUDY OF PATIENTS  
ના આપેલ આંકડા પ્રમાણે ઓપરેશન કર્યા પછીના ૩ વર્ષને ૧ મહિના  
પછી ઓપરેશન કરાવેલા સો દર્દીઓમાંના ૮૮ જીવતા હતા, એવી  
દવાઓની સારવાર કરાવનાર હૃદયના દર્દીઓમાંના સો માના ફોના ૭૫  
જીવતા હતા.

(સાડા ત્રણ વર્ષ પછી આમાનાં કેટલા જીવતા હતા એની નિયમનથી અને આ સાડા ત્રણ વર્ષ પણ ઓપરેશનવાળા ૮૮ કાને ૭૫  
આનારા ૬૫ ટકા કેવું લુચન જીવતા હતા એનો પણ કયાંચ ઉલ્લેખ નથી)  
ઓપરેશન કરાવેલ સો માના ૧૨ અને દવાઓ કરાવનારા સો માના ૨૨  
મરી ગયા એ આપણે સમજ જવાનું.

#### SUDDEN CARDIAC DEATH

##### અચાનક હૃદય બંધ પડવાથી થતાં મૃત્યુ

- ૧) અમેરિકામાં અચાનક હૃદય બંધ પડી જવાથી થતાં મૃત્યુનું પ્રમાણ રોજની એક હજર બસો (૧૨૦૦) વ્યક્તિઓનું હોય છે.
- ૨) ૨૦ થી ૬૦ વર્ષની વર્ષની વ્યક્તિઓમાં થતાં મૃત્યુના પણિમાં કારણોમાં સૌથી વધુ અચાનક હૃદય બંધ પડવાથી થતાં મૃત્યુનું જીવતાનામાં આવે છે.
- ૩) આમ રોજ થતાં ૧૨૦૦ મૃત્યુમાંના પચીસ ટકા, એટલે કે જેણી માનવીઓ તો એવા હોય છે કે જેમને કોઈપણ પ્રકારની જીવતી બિમારીઓ હતી જ નહીં. અને જો હતી તો પણ એમનાં શરીરની તપાસણીમાં કચાંચ જીવામાં કે જાણવામાં આવી ન હતી.

(ન્યૂની વાત ને બીજી રીતે જોઈએ તો એમ કહેવાય કે પેલા ૩૦૦ માના ૩૫ ટકા એટલે ૬૦૦ વ્યક્તિઓને મેડીકલ તપાસમાં હૃદયની વિસ્તીર્ણીઓ જીવતાનું જીવતામાં આવ્યું પણ હોય, એના ઈલાજ કે ઓપરેશન જીવતામાં આવ્યાં હોય અને છતાં એમના મૃત્યુ હૃદય અચાનક બંધ જીવતાનું હોય એ જીવતા દરમિયાન કે તુરત તત્ત્વજ્ઞાત થયાં હોય)

- ૨) અચાનક હૃદય બંધ પડીને થતાં મૃત્યુઓમાં સીઓનું પ્રમાણ ચોણા જાનનું (૨૫ ટકા) છે.



અમાલના બાયો - એન્જનીયરો ૧૯૬૦ થી શરીરની અંદર નિયમિત રીતે શક્તિ એનું કૃત્રિમ હૃદય બનાવવા ફંક્શન મારી રહ્યા છે.

UNIVERSITY OF UTAH MEDICAL CENTRE ના આવાજાનીઓનોની એક ટીમે ડૉ. બાની કલાર્ક નામના એક પ્રાણી શરીરમાં ૧૯૮૨ના ડિસેમ્બરમાં આવું એક કૃત્રિમ હૃદય નિયમ (ખોલ્યા દાંતનું ચોક્કું બેસાડાય તો હૃદય કેમ નહીં?)

બાની રીતે કૃત્રિમ હૃદય ફિટ કરાવેલ આ અનીસ્ટ પછી એના પ્રાણી બીજા બધા અગત્યના અવયવો એક પછી એક ફેરલ જીવાથી અને મગજને શોક (SHOCK) લાગવાથી ગણેલા એક્સોને જાણ હિવસમાં મરી ગયો.

જીવા મૃત્યુના સમયે પણ એનું કૃત્રિમ હૃદય ટોરાબંધ રીતે ફંક્શન રજુ હતું (તાતીયાં)... દર્દી મરી ગયા તો કયા હુચા ? ફંક્શન ની છાંદા હે ના ? ફુસરા લગવાને વાલા મીલ લી જાયેગા.....

## BRAIN DAMAGE AFTER BYPASS.

By KUNIO SUWA M. D.

COURTESY : BIOMED SEP. / OCT. 1995 ISSUE

### WHICH BLOOD GAS CAUSED BRAIN DAMAGE ?

The model was applied successfully to a set of blood gas data on a patient who had brain damage after CARDIAC SURGERY.

Contrary to original impression, we conclude that a very low PCO<sub>2</sub> (a) of CPB (Cardio Pulmonary Bypass) was the most likely cause of this brain damage.

ગુજરાતીમાં ભાવાનુવાદ

### બાયપાસ ઓપરેશન પણ્ચાતુ થતું ડેઝેજ

બાયપાસ સર્જરી કરાવ્યા પણ્ચાતુ લીના મગજને નુકસાન કર્યા કારણોસર થાય છે એ શોધવા માટે એક ખાલાવેલ ચંત્ર દ્વારા દર્દીના રક્તમાંના જુદા જુદા વાયુઓનું પ્રમાણ કેટલું જેની ચકાસણી કરવામાં આવી.

અત્યાર સુધી જે વાત જાણવામાં નહોલી આવી તે આ ચકાસણી દ્વારા જાણવામાં આવી.

કાર્ડિયો પલ્મોનરી બાયપાસ (CPB)ના અંતિમ તબક્કામાં દર્દીના લોહીમાં કાર્બન ડાયોક્સાઈડ વાપું  $\text{PCO}_2$  (a) નું પ્રમાણ ઘૂબ જ ઓછું (13mm Hg) થઈ જવાના કાર્બોન દર્દીને મગજનું કાયમનું નુકસાન થયું હોવું જેઠાં એમ અમારું મળ્યું છે.

\* \* \* \*

૧૬

## હોશિયાર - ખબરદાર !!

હુવે નકલી હદ્દ્ય આવી રહ્યું છે.


“હું તારી ઘોર તપદ્યયથી અત્યંત પ્રસન્ન થયો હું વત્તસ, માગ,  
માંગ, માગે તે આપું”.

“મને કદી પણ મોત આવે જ નહીં, હું અમર થઈ લઉ, ફક્ત  
એટંતું જ માંગું ગ્રલુ !”

“તથાસ્તુ !”

અને પછી કંસો, રાબણો અને હિરણ્યકશ્યપ જેવા નર - ભયાનક,  
પિશાચિય રાક્ષસો બની આ ધરતી પર અત્યાચાર આચારી આ ધરતી પર  
એક જબરદસ્ત બોજ બની ગયા, એમનાં પાપાચાર અને આતંકવાદ ને  
પરીક્ષામે આ સ્વર્ગ સમી પૃથ્વી અત્યાચાર અને બ્રહ્માચારથી ઘદબદ્ધ  
એક નક્કે જાની ગઈ.

એક સાવ નિર્દોષ, કુમળી વયના ગાયના વાછરડાનું આ વિત્ર  
ખૂબ જ દ્યાનથી જુઓ.



તબીબી વ્યવસાય નું ભયાનક રાક્ષસી અસલી રૂપ

નેતાં જ જેના પ્રત્યે બ્લાલથી હદ્ય છલકાઈ જય, એવા રૂપાળા વાછરડાના ચહેરા પર નર્યો બય, યાતના અને ત્રાસ અંકાઈ ગયો છે. કારણ ?

કારણ એના અસતી હદ્યની જગ્યાએ પેલા માનવ જતનું ભાટું કરવાનો દાવો કરનાર વૈજ્ઞાનિકોએ સાવ કૃતિમ, યાંત્રિક હદ્ય ફિટ કર્યું છે.

અને એમનો દાવો છે કે આ Synthetic Heart, કૃતિમ હદ્ય બેસાડ્યા પછી આ ભાગ્યશાળી ( ? ) વાછરડું એકત્રીસ કલાક લુયું હતું.

પુરી થવા આવતી આ .વીસમી સર્દી દરમિયાન વિજાને એક ભયાનક રાક્ષસી સ્વરૂપ ઘારણ કર્યું છે. એનાં વિષમ પરીણામો ને આપણે વર્તમાનમાં ભોગવી રહ્યા છીએ એ નેતાં ભવિષ્યની બીજી પદ્ધતીસ પેદીઓની શી હાલત થશે એની તો કલ્પનાય થઈ શકતી નથી. પણ કલ્પના કર્યા વગર રહી શકતું નથી (હદ્યમં ઉપજતી સંવેદના ના કદાચ પડધા પડતા હશે ?)

એક માનવીને “વધુ જીવનાની કે અમર થઈ જવાની” લાખમાં પશુ, પક્ષી, ઝાડ, પાન, ધરતીને છાવરતું વિશાળ આકાશ અને ઊદાણના પાતાળ.... બધું જ આ રાક્ષસોના અમાનુષિ અખતરાઓએ સાવ પાયમાલ કરી નાંખ્યાં છે.

અને ઉજ્જવલ થાંલી આ ધરતી પર જડ બની ગઢેલી પ્રણ પર હંકુમત ચલાવનારા માનવીઓ માટે આવાં કૃતિમ હદ્યો, લીલારો, કીડનીઓ, ફેફસાંચો, મગજ - ભેનંચો બધે બધું જ બજારમાં વેચાતું મળશે. એ અવયવોનાં જેણે લીલામ થશે અને વધુમાં વધુ કિમત ચુકવનારને એ આપવામાં આવશે. એમાંથી કાળા બજાર, ભાગ્યાચાર અને સગાંવાદ ચાલશે.

પાછ્યે બારણેથી એને મેળવી આપનાર દલાલોની પલ્ટનો ઉભી થઈ જશે અને એ અવયવો ફીટ કરી 'અમર' કરી હેનારા આધુનિક "તથાસ્તુ" કહેનારા દેવતાઓને રેદા કરતી નવી નવી કોલેજે કૂઠી નીકળશે. જુના પુરાણા અવયવો કાઢી લંગારમાં નાંખી નવે નવાં ફૂન્ડિંગ અવયવો ફીટ કરી આપનારી, મેઈનેઈન કરનારી અને સવીસીંગ કરનારી અધ્યતનેન-સ્ટ્યર હોસ્પિટલો ઉગી નીકળશે.... અને હાલ જે રાખણો, કંસો અને હિરણ્યકશ્યપો આપણા વચ્ચે છે તે તો છે ત્યાંના ત્યાં જ રહેશે, એમાં રોજ નવા નવા ચહેરા મહોરા પહેરેલા પિશાચો ઉમેરતા જશે.

સાંજ છે કે આ કલ્પના ને હકીકિતમાં પલયાએલી જેવા માટે આપણે અહીં હાજરનહી હોઈએ.

★ ★ ★ ★ ★

*DR. MICHAEL DE BAKEY stopped performing HEART TRANSPLANT OPERATIONS in 1970 because "The results just did not justify the cost" and difficulty of the procedure. At that time 80% of the patients died within the 1st year and more than 50% of those who survived fell victim within 2 years to either fatal REJECTION or runaway infection.*

હદ્ય મંથન જેવાં બીજાં એક લાખ પુસ્તકોનો સાર આ ઉપરની ચાર લીટીઓમાં સમાઈ જય છે.

**Reduce Size of HIPS!**

# PUBLIC BEWARE!

**WARNING AGAINST RELAXACIZORS**

All persons who use a Relaxacizor device for muscle exercise and other purposes are hereby advised and warned that the device has been found to be dangerous to health by a United States District Court. Relaxacizor devices have been distributed since 1949, and approximately 400,000 units have been sold.

The Court found that the Relaxacizor may:

1. Aggravate many medical conditions in susceptible persons;
2. Have a serious potential for damage to the heart and other vital body organs; and
3. Be capable of causing a miscarriage, and otherwise may jeopardize the health and even the life of the user.

How does it work? Many women look good in their clothes because they don't get enough exercise. Relax-A-Cizer gives them concentrated exercise to each hip. It's a simple, safe, non-invasive abdominal shape-up. Because the Relaxacizor can reduce the size measurably in the instant these muscles kick loose because of insufficient exercise, the greater the degree of size reduction.

FREE! Find out what Relax-A-Cizer can do for YOU! Send for your free copy of "How To Figure" by Burton Shiles. No cost. No obligation.

**RelaxAcizor®**

PRINCIPAL OFFICES: NEW YORK, N.Y., 100 Madison Ave., RFD 8-4000; CHICAGO, ILL., 20 E. Ontario St., RFD 2-1200; LOS ANGELES, CALIF., 1000 Wilshire Blvd., RFD 2-1200.

બેવર્ક્ષોની વસ્તીમાં શ્રી ચારસોવીસ ભૂખે મરતા નથી. નપૂસક સરકારો ધોડો નાસી ગયા પછી જ તબેલાને તાળાં મારે છે.

## મહિલાએ - મહિબહેન

૧૭

You forfeit 3/4th of yourself  
when you try to be like others.

મહિલાલ કે મહિબહેન જ્યારે પોતાના વજનમાં પાંચ કિલો ઘટાડો કરવાના ઘમપણાડો કરે છે, એજ હિવસથી એ પોતાનું આગવું અસ્તિત્વ (પોણા ભાગનું) ગુમાવી રહે છે. મતલબ પછી મહિલાલનો મનોભક્તુમાર કે મહિબહેનની મિનાકી તો થતી નથી જ પણ એ બન્નેનું ફક્ત નામ જ એમના શરીર પર લટેલું રહે છે. એમનું પોતાપણું ક્યાંય ગોતવા છાંય જરૂરું જ નથી.

આને હા.

વજનના કુદરતી રીતે વધવાથી હૃકિતમાં કોઈ રોગ થતા જ નથી. જે કઈ ઐમારીઓ આવે છે એ વજનને કુન્ઝિમ રીતે ઘટાડવાના બેવર્ક્ષી બધાં અખતરા કરવાથી જ આવે છે. ડાયટીગના મેનીયાથી કે ભૂખ ન લાગવા માટે લેવામાં આવતી અત્યંત જલદ દવાઓને પરીણામે આવે છે.

દસેક વર્ષ પૂર્વે મુંબઈના અધિતન નરીમાન પોઇન્ટ પર એક અંક્ઝિસ ચુલ્લી. મુંબઈનાં બધાં જ દૈનિકોમાં આજાં પાનાની જલેર અભરોમાં છ

મહિનામાં પચીસ કિલો ગેરન્ટીડ વજન ઘયડી આપવાના દાવા કરવામાં આવ્યા. ફક્ત સલાહ લેવાની ફી રૂ. ૫૦૦૦/- આપી, હન્દોની સંખ્યામાં શાળાએ જતાં બાળકો, યુવક યુવતીઓ અને વધ્યસ્કોરે એ ઈલાજ કરાવ્યા. એ ઈલાજ કરાવનારામાંનો કોઈ એકાઉ જણ તમને મળી જય તો જરા એની આપવીતી પૂર્ણી જેને. પેલી અફલાતૂન કંપની તો પાઠીયાં ફર્વી રાતોરાત ગુલ થઈ ગઈ ને લાખો માનવીઓનાં લુધન બરબાદ કરતી ગઈ.

UNCLE MOTU AND AUNTY FATSY ARE THE  
HAPPIEST PEOPLE UNTIL THEY ARE TOLD  
OVERWEIGHT CAN CAUSE HEART TROUBLE

મારી તમારી આસ પાસ, અડોસ પડોસમાં તખિયતમાં જડાં પાડાં હોય તેવાંને નલુકથી ઓળખવા પ્રયત્ન કરશો તો કદાચ એમના જેવાં માનસિક અને શારીરિક રીતે તંહુરસ્ત સુખી અને આનંદી માનવીઓ ભાગ્યે જ જેવાં મળશે. પાતળાં - કીડક્યાં - સાનેકઢાં માનવીઓ મોટાબાળે ચીડીયાં, કીચકીચીયાં, અસંતોષી અને રોગિઓ હોય છે.

વજનના વિષય મટે હું એક અલગ જ પુસ્તક લખવા માંગુ છું. હાઈ ટ્રબલને અને વજનને સીધો સંબંધ છે, એવું કહેનારાઓ કદી પણ એ વાત સાચી છે એ પુરવાર કરી શક્યા જ નથી અને એમનું માની તમારા શરીરને અને મનને દુબળું પાડવાની કોઈ જ આવશ્યકતા પણ નથી.

આ સાથે આપેલ જાહેર અભરોના નમુના અને એ વાંચી ચાર લાખ મૂર્ખાઓએ એની અજમાયશ કર્યા પછી અત્યંત ઉહાપોહ થવાને કારણે U.S. Dept. of Health, Education and Welfare- Public

Heath Services FDA દ્વારા અમેરિકાની દેરક પોસ્ટ ઓફિસમાં ચેતવણી સ્વરૂપ ચોડાડવામાં આવેલ પોસ્ટરો સાનમાં જ નહીં, ચીસો પાડી પાડીને ઘણું બધું કહે છે. તમારે સાંભળવું છે ?



### પોપોટો પાંડિત્યમું - યાને - પોથીમાંનાં રીગણાં

"વજન દસ કિલો ઘયડી ધો, ચા, કોઝી, બીડી, સીગરેટ, તંબાકુ બીલકુલ બંધ, દાડને તો અડવાનું પણ નહીં, મીંક, સાકર સેફાં કેર છે, તેલ - ધી, માખણ રસોડામાં નો એન્ટ્રી - બાંકેલાં શાકભાજ ખાઓ, ફણગાવેલું કાચું કદીળ ખાઓ. ચાવલ, બધાય - ટ્ય નહીં કરવાનાં. રોજ બે માઈલ ચાલો, જોગીંગ કરો, ધોગા, ગેડીટિશન ને આસનો કરો.

હોકમ હોક આવી સસ્તી સલાહે આપનારનું પોતાનું વજન કેટલું છે એ માપી લો. એ પોતે કેટલો દાડ સીગરેટો પાએ છે, કેવું ચાલકેદાર મસ્ત બોજન જમે છે ? બલડ પ્રેશર, ડાયાબીટીસ તે હાઈ ટ્રબલની કેટલી ગોળીઓ ગણે છે ? એ જરા એની નજરમાં નજર મિલાવી બિનધારાસ્ત પૂર્ણી બ્યો.

એ જવાબ તો નહીં આપે - પણ તમને ઘણું બધું વગર બોલ્યે સમજાઈ જશે.

આટનું કર્યા પણ જે દરી લીવર ટ્રાન્સપ્લાન્ટ સાથે જીવી જ્યા છે તો એને જુંગી સુધી ખૂબ જ મોંઘી દવાઓ પર નભવું પડે છે અને સતત કોઈ કોઈ ઔપરેશન કરાવવું પડે, એની કાળજ રાખવી પડે છે.

બીજનો અવયવ શરીર નકારી (Reject) કરે નહીં એ ખાતર એ દરીને ખૂબજ મોંઘા ભાવની, પ્રતિકાર શક્તિને દબાવી દેતી Immuno Supressant (ઇમ્યુનો સપ્રેસન્ટ) દવાઓ આપવી પડે છે. વળી આ પ્રતિકાર શક્તિ દબાવી દેતી દવાઓ આપવાના પરિણામે જે સામાન્ય પ્રકારના ઈન્ફેક્શન્સ (Infections) ચેપી રોગો થાય છે એને મારવા માટે ખૂબ જ મોંઘા ભાવની એની બાયોટિક્સ દવાઓ પર દરીને આપી જુંગી આધાર રાખવી પડે છે.

એટલે આવાં ટ્રાન્સપ્લાન્ટ પહેલાંનો અને પછીનો ખર્ચ સ્વાભાવિક રીતે જ ખૂબ મોટો આવે છે. જે અંદાઝે પચાસ હજારથી એક લાખ ડોલર્સ સુધી થઈ શકે છે. ઔપરેશનોની ટેક્નીકસમાં થતા આધુનિક ફેરફારો, ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડૉક્ટરો અને એની સાથે મદદકૃપ થતા સહાયક ડૉક્ટરો અને નસોની ટીમ, એને ઇમ્યુનો સપ્રેસન્ટ દવાઓના ભાવોમાં કંઈક ઘટાડો થાય તો આ ખર્ચ પ્રમાણમાં થોડો ઓછો થઈ શકે. અત્યારે તો આગામા વર્ષે જે ૪૫,૬૪૩ ડોલર્સનો ખર્ચ આવ્યો હતો તેના બદલે આ વર્ષે ૬૨,૮૬૬ ડોલર્સનો ખર્ચ આવેલ છે (એક વર્સમાં બમણો થયો ગણાય)

### રીએક્શન

લીવર શરીરનું એક ખૂબ જ અગત્યનું અને ઉપયોગી અવયવ છે. જ્યારે એક વ્યક્તિનું લીવર બીજુ વ્યક્તિમાં બેસાડવામાં આવે છે ત્યારે એને શરીર બહારની (Foreign Body) વસ્તુ સમજી શરીરની સ્વપ્રતિકાર શક્તિ એનો નાશ કરવાની કોરિએ કરે છે. આવા પ્રકારે જે પ્રતિકાર થાય છે તે જ્યાં સુધી દરી જ્યે છે ત્યાં સુધી સતત થતો રહે છે અને એને

૧૮

## થોકુંક લીવર ટ્રાન્સપ્લાન્ટ વિષે પણ


સૌનાન્ય : Diseases of Liver & Billiary System by Sheila  
Sherlock & James Dooley

લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવું એ એક ખૂબ જ જવાબદારી બર્યું કાર્ય છે. બગડેલું લીવર કાઢીને બદલામાં બીજા કોઈનું લીવર ફીટ કરી દેવાથી આ જવાબદારી પુરી થતી નથી. આ ઔપરેશનો ખૂબ જ ચોક્કસ સગવડો ધરાવતી હોસ્પિટ્લોમાં જ થઈ શકે છે.

લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું એ એક ખૂબ જ જવાબદારી બર્યું કાર્ય છે. બગડેલું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી એજ દરીનું બદલાવેલું લીવર પણ કદાચ બદલવું પડે કે એના શરીરના કીડની કે હાઈ જેવા સાંજ સારા અવયવો પણ અચાનક પોતાનું કાર્ય કરતા આટકી જ્યા અને એમને પણ તાત્કાલિક બદલવાની ઈમરજન્સી જરૂરત ઉભી થાય એ લક્ષ્યમાં રાખી આવા અવયવો જરૂરત પડે તુરત હાંસલ થઈ શકે એની પૂર્વ તેથારી રાખવી પડે છે.

ઇંડિયનોસપ્રેસન્ટ દવાઓ આપી સતત દ્વારા રહેણું પડે છે. સવાલ એ થાય છે કે આ બધું જાણતા હોવા છતાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની રાખ માટે સલાહો અપાય છે ?

એ સવાલનો જવાબ એક જ છે. અને એ છે “ડૉક્ટરોને ઐસા બનાવવા ખાતર, દવાની કંપનીઓને દવાઓ વેચી નઢો બનાવવા ખાતર અને દર્દીને રીબાવી રીબાવીને મારી નાખવા ખાતર” પણ આ જવાબ કોઈ કહેવા માટે તૈયાર નથી.



#### KILLER SCIENCE - સંહારક વિજ્ઞાન


આ પાન, ફળ, કૂલ કે ખેતી અને માનવીનું શરીર, જીવાષ્પાઓ જ્યાં નજરે પડે કે ન પડે એને બસ મારી નાખો, સંહાર કરી નાંખો, કચડી નાંખો, ધુંધી નાંખો, કાપ કૂપ કરીને ફેંકી ધો કે લાઈએ આપીને બાળી નાંખો.

શરીરનું તાપમાન વધે તો એને હંકુ પાડી ધો બી.પી. વધે તો એચીને નીચે લાવો, હદ્ધના ધબકારા વધે તો બ્રેક મારી ધીમા પાડી ધો. શરીરના પોતાના કોષોની સંખ્યા વધે તો મારી મારીને ઓછી કરી ધો.


અગર આનું નામ વિજ્ઞાન છે, તો એનો વિ એ વિનાશનો વિ છે.

આ મારક વિજ્ઞાનના પરીક્ષામે જ માનવીની સમગ્ર પતિકાર શક્તિ જડમૂળથી ઉખડી ગઈ છે અને હવે પણીની પેટીઓને વારસામાં એઈડજ જેવી ભયાનક પિમારીઓ મળી ચૂકી છે.


ઇંડિયનો-સપ્રેસન્ટ ડ્રગ્સ એ આ કોલાંડનું એક મોચમાં મોટું રૂત છે.




RIGHT ATRIAL ENLARGEMENT (P-PULMONALE)




VENTRICULAR EXTRASYSTOLES (BIGEMINY)




HYPOTHERMIA



VENTRICULAR FLUTTER



ACUTE MYOCARDIAL INFARCTION



SICK SINUS SYNDROME

E.C.G. એનું શરાગુ સ્વીકારો તો જેલ ને બદલે I.C.U. ની સુંવાળી થયાં આગોટવા મળે.

૧૮

### સમજદાર કો ઈશારા કાફી....

The quest for answers about heart disease continues at a frustrating "ONE STEP FORWARD TWO STEPS BACKWARD" space.

A five year HARVARD MEDICAL SCHOOL STUDY that ended in 1987 found that an ASPIRIN EVERY OTHER DAY REDUCED THE RISK OF FIRST HEART ATTACK BY 44%.

Now a more recent report WARNS that A DAILY DOSE ALMOST DOUBLES THE INCIDENCE OF ONE KIND OF HEART DISEASE IN OLDER MEN AND WOMEN AND HAS SERIOUS SIDE EFFECTS AS WELL.

અનુષ્ઠાન :

હજ્ય રોગની બિમારીઓની સમસ્યાઓ સુલજાવા માટેને ધમપણડા હજામાં આવે છે એમાં "એક કદમ આગે ઓર દો કદમ પીછે" એ વાતાવરણ સર્જરી છે.

હવેડ મેડિકલ સ્કૂલના ૧૯૭૫માં પુરા થયેલા પાંચ વર્ષ પાત્રીના એક સર્વેક્ષણમાં એમ શોધવામાં આવ્યું હતું કે એસ્પીરીનની જો જોખાની એક એક ગોળી કાયમ લેવામાં આવે તો પ્રથમવાર આવતા હથપીનની હુમલામાં ૪૪ ટકા ઘયાઠે થાય છે.

હવે એક છેલ્લામાં છેલ્લો રીપોર્ટ (આ વાત ૧૯૯૦ની લે જોતે એ છેલ્લા રીપોર્ટને પણ છ વરસ વીતી ગયાં છે) પ્રમાણે એમ હથપીનની છે કે :

“એસ્પીરીનની રોજની એક ગોળી જો લેવામાં આવે તો વસ્તું પુરુષો અને સ્ત્રીઓમાં એક ખાસ પ્રકારનો હૃદય રોગનો હુમલો આવશ્યક સંભેગો બેવડા થઈ જાય છે એટલું જ નહીં એસ્પીરીનની બીજી ઘણી ગંભીર આડ અસરો પણ એનાથી નિપછે છે.”

આજની તારીકમાં રોજની એક કે અદધી ગોળી એસ્પીરીન ખાનારો એક ઢૂંટશો તો બે મળી આવશે. એ બધાને એસ્પીરીનની આડ અસરો ટગલા બંધ થશે. એમને કોઈ હૃદયરોગના હુમલાની પણ પણ શક્યતા નહીં હોય છતાં ફક્ત રોજ એસ્પીરીન ખાવાથી હૃદયરોગના હુમલાઓ હાઈએટક આવશે. એમને આઈ.સી.યુમાં રખારો, રીપોર્ટ કથવાશે, દવાઓ ખવડાવાશે, ઓપરેશનો કરવા મજબૂર હરાણાની અને મારી નાંખવામાં આવશે.

આમાંનો એક પણ પેલા નિખણાતને એમ નહીં પુછો કે “મની એસ્પીરીન શું કામ ખવડાવી હતી ?” જુવતો હોય તો પુછો ને !

૨૦

## એસ્પીરીન પુરાણ

### હીપોક્લેટસ

હિસ્તી સન ના પાંચ વર્ષ પહેલા એટલે આજથી બે હજર વર્ષ પૂર્વી, આજની આધુનિક ઔષ્ણિકોનો પિતામહ હીપોક્લેટસ, જેના નામે આજે પણ નવા ડૉક્ટરો પ્રેક્ટીસની શરૂઆત કરવા પહેલાંના શપથ (HIPPOCRATS OATH) લે છે, તે, ત્રીક ફીઝીસીઅન હીપોક્લેટસ, દર્દનું તિથાણા કરવા WILLOW BARK વિલો બાઈ નામના જાડની છાલનો ઉપયોગ કરતો હતો. આજની આધુનિક એસ્પીરીન નાં મૂળજૂત તત્ત્વો હિસ્તી રીતે વીલો બાઈમાં ઉપલબ્ધ હતાં.

૧૭૬૩ માં Rev. E. Stone રેવ. ઈ. સ્ટેને લખીને છ્યાવેલા એક અસ્થીયાત્માં જણાવ્યું છે કે વીલો બાઈને સુકવીને એમાંથી બનાવેલ ચૂર્ણ કાપી એમને પચાસેક દર્દીઓનો તાવ ઉતારવામાં સફળતા મળી હતી.

૧૮૫૩ માં Charles Gerhardt ચાર્લ્સ લુરાઈ નામના ફ્રેન્ચ કેમીસે સેલીસિન (Salicin) નામના રસાયણમાં થી સેલીસીલિક એસીટ (Salicylic Acid) નામનો પદાર્થ બનાવ્યો એમાં થોડા સુધારા વધારા થયા અને એ સેલીસિન સેલીસીલિક એસીટ (Acetyl Salicylic Acid) બન્યો એને

આપણે બધા એસ્પીરીન નામના ચમત્કારિક ઔષધ તરીકે ઓળખીયે છીએ.

ઓગણીસમી સહી પૂરી થવા આવી ત્યાં સુધી એસ્પીરીન આમ જનતામાં ઉપયોગમાં લેવાતું ન હતું

એસ્પીરીન ને ઘર ઘરમાં ધૂસાડવાનું પરાક્રમ કરનાર ઉસ્તાદનું નામ છે ફેલિસ હોફ્મેન (FELIX HOFFMAN).

૧૮૮૭ માં FEIEDRICH BAYER નામની જર્મન કંપનીમાં કામ કરતા ફેલિસ હોફ્મેન એના બાપાના સંધિવાતના દુઃખાવ મટે એસ્પીરીન નો ઉપયોગ કર્યો, એ બાગ્યશ્વરી પિતાશ્રી ને દુઃખાવામાં ખૂબ આપા મળ્યો.

જે કપીનું બેગોન-બુગોન (વાંદા કસારા મારવાની દવાઓ) આપણે ઘર ઘરમાં વાપરીએ છીએ તે જર્મનીની જાણીતી બાયર એન્ડ કૂ. એ ૧૮૮૮ માં એસ્પીરીન નું મોય પાયે ઉત્પાદન કરી દુનિયાભરમાં માં ઘર જાણીનું કરી દીધું

એ પછીનાં વર્ષોમાં ઉત્તોત્તર એસ્પીરીન નો ઈસ્ટેમાલ વધતો ન ચાલ્યો. ૧૯૬૩ ના એક જ વર્ષના ગાળામાં ૩૫૦૦૦ (આડ્રીસ લના) અં એસ્પીરીન આપી દુનિયાની માનવ વસ્તીના પેટમાં પદરાવવાનું હોલાવી અંદાજ છે.

૧૯૫૦ માં Lawrence Craven લોરેન્સ કેવન નાના કેલીકોનીયાના ફીડીસીઅને ચ્યુચિંગ ગમમાં (Chewing Gum) એસ્પીરીન રેણી ASPEGUM નામની દવા બનાવી નાનાં બાળકોને પણ એસ્પીરીન ખાતાં કરી ધૂમ કમાણી કરી લીધી.

૧૯૫૬ સુધીમાં તો એના પોતાના જ આઠ હજાર ચેશાન્ટો રોજની ને ખાર ગોળીઓ ઝીસ્સામાં લઈ ફરતા અને ચણા મમરાની નેમ ખાતા થઈ ગયા હતા.

એસ્પીરીન ની ગોળીઓથી સાનું સારાં આંતરદાં માં જાખમ થતા હતું અને એમાંથી રક્તસ્વાવ થતો હતો. એસ્પીરીન ની આ આડ-અસર ની લીધે હીકીકતમાં એ વેળાએ જ એ દવા બનાવવાનું બંધ કરી દેવું લેન્ટનું હતું-પણ એવું કંઈ થયું નહીં.

બીલટ ૧૯૭૧ માં જોહન વેન (John Vane) નામના બ્રીટીશ વિજાળિકો એસ્પીરીન લોહીને ગંઠાવા દેતું નથી એમ દોલ વગાડિને જોઈ છું: મતલબ એસ્પીરીન ના અવગુણને ચુણામાં હોકી નેસાડવામાં જાણ્યું-લાખો કરોડો નિર્દોષ મુંગા પ્રાણીઓ પર અમાનુષ અખતરાઓ હી એમને રીબાવી રીબાવીને મારી નાંખવામાં આવ્યાં, કરોડો અબજો કુપિયાના ખર્ચ રીસર્ચના નામે ધૂમાડા ઉડાડવામાં આવ્યા અને

“એસ્પીરીન ની ગોળી ખાવાથી લોહી ગંઠાઈ જતું નથી અને હું એટેટ આપતો નથી” એવી મહાન શોધ કરી ૧૯૮૨ માં આ મહાસાગે જોબેલ પ્રાઇઝ જીતી લીધું.

દુનિયાભર ના એજન્ટો, ચમચાઓ અને દલાલોએ દુનિયાભરના ફિલોને ભરમાવી લલચાવી, ફોસલાવી કરોડો અબજો માણસોને હાઈ લેન્ટ નો બય બતાવી રોજની એક એસ્પીરીન ખાવા મજબૂર કરી દીધા.

રોજની એક એસ્પીરીન ખાવાથી હાઈ એટેક આવવાના સંનેગોમાં જી લાનો ઘયડો થથો નોંધાયો છે” એમ ઘડ-માથા વગરની બકવાસ જોગાનીનાં દોલ પીયાં.

હાઈ એટેક આવવાના સંલેગોમાં ૪૪ કાનો દરખમ ઘટાડો" બેઠે શું ? એમ કોઈએ પુછ્યું નહીં. મેડિકલ ભાષા સામાન્ય માનવીને સમજવા માટે હોતી જ નથી.

પરંતુ આમ નોબલ પ્રાઇઝ જીતીને રાતો રાત તિસ્મારખાં બાળી જનારાઓનાં માથાં ફેડનારા અમનાજ બીજા જાતભાઈએ પેઢા થઈ જાય છે એટલે

"એસ્પીરીન થી હાઈ એટેક આવવાના સંલેગોમાં ૪૪ કાનો પાખમાં ઘટાડો થાય છે" એ વાત મહાભયંકર બકવાસ છે- સાચી વાત તો જે છે કે આવી રીતે રોજ એસ્પીરીન આવાથી હાઈ એટેક આવવાના સંલેગો બમણા થઈ જાય છે" એમ ૧૯૮૮ પછીનાં બીજાં પાંચ વર્ષમાં બીજા વૈજ્ઞાનિકો એ વળી પાછાં લાખો કરોડો મુંગા નિર્દોષ પ્રાણીયો પર ફોરી ડ્રિપિયાના ખર્ચે રીસર્વ કરી પુરવાર કરી દીંધું.

### એટલું નહીં

એસ્પીરીન લેટ્ટી જણાવવામાં આવે છે એટલી નિર્દોષ દવા નહીં એ ખાનાર નું જકર, આંતરડાં, લીવર, ફેસાં કીડની અને હદ્દ્ય મુખ્ય બગાડી શકે છે. શરીરના કોઈ પણ આંતરિક ભાગમાં રક્તત્વાવ નિપળાની શકે છે, શરીરના બાહ્ય ભાગમાં ચામડીની રક્ષતા, એલર્જ જેવી જગ્યા આડ અસરો નિપળાની શકે છે. એટલું જ નહીં...

ફક્ત એક ગોળી એસ્પીરીન ની લેવાથી મૃત્યુ પણ નોંધાયું છે.

ઇતિશ્રી એસ્પીરીન પુરાણે.....



એ બાબુ માર્ક્યુની કાંજ માર્ક્યુન કાંજ લાદી માર્ક્યુન કુલ્લાનું  
નાની, બાબુ માર્ક્યુન માર્ક્યુન માર્ક્યુન માર્ક્યુન માર્ક્યુન માર્ક્યુન માર્ક્યુન  
નાની, બાબુ માર્ક્યુન માર્ક્યુન માર્ક્યુન માર્ક્યુન માર્ક્યુન માર્ક્યુન



### અક્કલ ખાતે ઉદાર

પાખમના દેશોનું આંધણું અનુકરણ કરવામાં આપણે આર્થિક રીતે  
તી પાપમાલ થઈ જ ગયા છીએ પણ સાથે સાથે આપણી અક્કલ પણ  
તીથી મુકી દઈએ છીએ.

D-HQ = 1000-HYDROXY-QUINOLINE (D.H.Q.)  
ધૂળાખ બંધ કરવાની તપકીરીઓ રંગની ગોળીઓ.  
ANALOGIN = શરીરના અને માથાના દુઃખાવાની ગોળીઓ.  
E. P. DRUGS = ગર્ભનિરોધક ગોળીઓ (ખીઓ માટેની)

ઉપર જણાવેલ ત્રણોય પ્રકારની દવાઓની ગંભીર આડ અસરોની  
તીથી તેવાયા પછી પાખમના દેશોમાં આ ત્રણોય દવાઓના ઉત્પાદન  
(Manufacturing) પર છેલ્લાં પરંતુ વર્ષથી પ્રતિબંધ છે અને આ દવાઓ  
તીથી તે ગુણો OFFENCE ગણાય છે. DHQ ની ગોળીથી અંખમાંનો  
ભીત્તા મુકાય છે અને અંધાપો પણ આવે છે. એનાલ્ઝનની ગોળીઓથી  
તીથી પોલાણમાંનો ગર્ભ Bone Marrow Damage થાય છે અને  
તીથીના પછી નો નાશ થાય છે. E. P. Drugs થી શરીરના જુદા જુદા

અવયવોનું કેન્સર અને બીજુ પચાસ લેટ્ટી અન્ય બિમારીઓ થઈ રહે છે. આપણા દેશમાં આ ત્રણેય દવાઓ છૂટ થી બનાવાય છે, વેપાસ હેઠળ અને ચેટમાં પદ્ધરાવાય છે.

અને એવીજ રીતે હજુ પણ કોલેસ્ટ્રોલની થીઅરી અને એસ્પોર્ટની દવાઓ બક્કવાસ છે એમ પુરવાર થયા છતાં અહીના ઉસ્તાદો એનું પુષ્પ છોડવા માંગતા જ નથી.



“હદ્દ્ય એ શરીરનો સાવ નાજુક - કમનોર અને માંપકાળી અવયવ છે. એને ધબકતો રાખવા માટે દવાઓ ખાઓ, ઈજેઝાની લ્યો, કાપ કુપ કરાવો બેટ્ટી બેસાડો, કુગા કુલાવો, અને બધુ કરીને થાકો ત્યારે ઉધાર ઉધીનું કે ચોર બજારમાંથી ખરીદું ફીટ કરાવો - યાર, તમે તો હવે એકવીસમી સદીમાં ફસ્ટ કુન્સટન કયોર અને એવરીથીંગ રેડીમેડ કોમ્પ્યુટર્સ એઈજમાં લુણી રહ્યા છો - અહીંથાં હવે કોમ્પ્યુટરો જ માનવીને લુંબડો, બિમાર પાડે છે ને મારી નાંખે છે. અહીં કોમ્પ્યુટરો જનમ કુંડળીઓ કાઢે છે અને ટેસ્ટ લ્યુબનાં કારખાનામાં બનાવે જાણે છે.”

હા.... સાંભળી લીધું તમે આ મહાપુરુષોનું ભાવણ ?

હવે તમારા જ હદ્દને, તમારા જ કાનમાં, ખાનગીમાં નિઃ અંગત વાત કરવી છે. સાંભળું છે તમારે ? તો ખાઓ, પોણી તકીયા પર એક કાન દખાવી એની વાત એકાંતમાં સાંભળી લ્યો.

૪૨

## દાગતર, તેરી એપ્રોન મેલી

આપેટ્રોલનેસીસ એક એવી બિમારી છે, જેનું નામ લેતાં ડૉક્ટર મારો મરે છે.

આપેટ્રોલનેસીસ

એક એવી બિમારી છે, જેના વિચે તમે પુછ્શો તોથ ડૉક્ટર કંઈ લેતા માગરો જ નહીં

આપેટ્રોલનેસીસ

એક એવી બિમારી છે, જેના વિચે ડૉક્ટર સિવાયના દરેક માનવીએ જાણું બને તેણું વધુ, જેણું બને તેણું જલ્દી જલ્દી જાણી લેવું અત્યંત વિનાયક છે - જરૂરી છે.

આપેટ્રોલનેસીસ

એક એવી બિમારી છે, જેનું નામ એક છે પરતું એનાં રૂપ જુદા હોય છે. એના પરીણામોમાં સામાન્ય માથાના દુઃખાવાથી એક કણામાં પુષ્પાંનો સમાવેશ થઈ જય છે.

### આયોજનેસીસ

માના ગર્ભથાં ઉછરતા બાળકથી માંડી વૃદ્ધધાવસ્થાએ પહોંચેલી વ્યક્તિ સુધી દરેકને થાય છે, ડગ્લે ને પગલે, હલતાં ને ચાલતાં જાળતાં ને અનણતાં થાય છે-માત્ર ક્યારેય એનું નામ પાઠવામાં આવતું નથી - એ બિમારીનું નામ છે

### આયોજનેસીસ

Dr. Knight Steel ડૉ. નાઈટ સ્ટીલ ના ન્યુ ઈંગ્લેંડ જર્નલ અને ચેડિસીન માં લખેલ એક રીપોર્ટમાં જણાવ્યું છે કે : “અમેરિકાની પુનિવસ્તીની ની એક હોસ્પિટલમાં પાંચ મહિનાના ગાળામાં ૧૧૫ દર્દીઓનો અધ્યાત્મ કરવામાં આવ્યો, જેમાંના ૨૬૦ દર્દીઓને આયોજનેનીક બિમારીની હોસ્પિટલ માં રહેવાના સમય દરમિયાન ઓછામાં ઓછી એક વાર માટે હતી. બીજા ઘણા દર્દીઓને આયોજનેનીક બિમારીઓ બેથી સાત માટે થઈ હતી (હોસ્પિટલમાં હતા તે દરમિયાન) ૧૧ દર્દીઓને તો આયોજનેની બિમારીઓ એટા ગંભીર પ્રમાણમાં થઈ હતી કે એમના લખ નેખાના મુકાઈ ગયા હતા. કેટલાક દર્દીઓને આયોજનેનીક બિમારીઓએ જાળતાં અધ્યાત્મ (Permanent Disabled) કરી મુક્યા, અર્થાત કેટલાક આંખાના બ્લેરા, લૂલા કે લંગડા થઈ ગયા. અને પેલા ૧૧૫ દર્દીઓમાંના પણ દર્દીઓ તો એ પાંચ મહિનાના ગાળામાં હોસ્પિટલમાં લેવાતી જાળતાં દરમિયાન જ આયોજનેનીક બિમારીઓના પરીણામે મરી ગયા.

ડૉક્ટરોની સારવાર દરમિયાન કે હોસ્પિટલોમાં થતાં ઓપરેશની વખતે, ઓપરેશનો પદ્ધતાત થતી સારવારો દરમિયાન જ જેટલા મુજબ થાય છે એમાંના પચાસ ટકાથી વધારે પ્રમાણમાં થતી મુજબ આયોજનેનીક બિમારીઓને લીધે થાય છે. પરતુ મૃત્યુના પ્રમાણપત્રોમાં

મૃત્યુનું કારણ Cause of Death ની કોલમ હોય છે તેમાં ભૂલમાં પણ આયોજનેસીસ (Iatrogenesis) એમ લખવામાં આવતું નથી

કારણ ???

જીવ મંધન નું કારણ આયોજનેનીક બિમારીઓના જંમદાતા ખુદ ડૉક્ટરો અને ડૉક્ટરીટો જ છે.

આવો આ આયોજનેસીસ શું છે તે એઈએ. મેડિકલ ડિક્રાનરી ની બાલ્ફાનેટ આઈ (I) માં પહેલો જ શબ્દ Iatrogenic છે. (બીજી ડિક્રાનરીઓમાં એનો ઉત્તેખ કરવામાં આવતો નથી એ શરમની વાત છે)  
IATROS = ડૉક્ટર-ફીક્ઝિશિયન (ગ્રીક શબ્દ)  
GENIC = જન્ય  
IATRO GENIC = ડૉક્ટર જન્ય

A relation to medicine or doctor, signifying a secondary condition arising from TREATMENT of a primary condition.

અર્થાત : કોઈ એક બિમારીની ટ્રીટમેન્ટ ડૉક્ટરે કોઈ દવા આપીને હી હોય અને એ દવાની આડ-અસર Reaction ને કારણે દર્દીને કોઈ બીજી જ બિમારી નિપળું હોય કે મોત પણ થયું હોય.  
જ્યુ ભરણ ભાષામાં કહીએ તો.

“ડૉક્ટરે સારવાર ના નામે જ દર્દીને વધુ બિમાર કર્યો હોય કે નામી પણ નાંખ્યો હોય”

હવે બઈ ડૉક્ટર છે, એ દવા આપે એટે આડ-અસર તો થાય નામ આપણે માની લઈએ અને સો દર્દીઓમાંથી માનવસહન ભૂલથી, ઊત્તાળથી, બેકાળથી, શરતચૂકથી એકાદા દર્દીને આવી આડ-અસર

થાય તો આપણે ઉદાર દિકે ડૉક્ટરને એની જવાબદારીમાંથી મુક્ત ની દઈએ. પરંતુ હવે આ છાવારી સો એ એક ટકાના બદલે સો એ નાન્ય છા થઈ ગઈ છે અને કોઈ ભાગથાળી દર્દને જ અસલમાં જેને સાચી ડૉક્ટર કહી શકાય તેવાની સારવાર મેળવવાનું સફળાય પ્રાપ્ત થાય છે. એટલે ઉપચારના પ્રથમ નિયમ "FIRST DO NO HARM" ભૂલમાં પણ દર્દને નુકસાન થાય એવી દવા આપીશ નહીં એ જિદ્દાંત પ્રમાણે પ્રેક્ટિશ કરનારા ડૉક્ટરોની છાવારી પણ સો એ એક ટો જ રહી છે. આવી ડૉક્ટરજન્ય બિમારીઓ થવાનાં સામાન્ય કારણો પર એક નજર કરી લઈએ.

- ૧) ડૉક્ટર ફક્ત દર્દને વિનાકારણે કાડીઓગ્રામ, એક્સ-રે કે બ્લડ ટૈસ્ટ કરાવાનું કહે - કે કારણ વિના બ્લડ પ્રેશર માપે એટલે હીના મનમાં પોતે બિમાર છે એવો એક બય સ્થાપિત થઈ જાય, અને એ કાલ્પનિક બિમારી સાચી બિમારીમાં ફેરવાઈ જાય. (હજુ તો દવાઓ આપવાનું શરૂ પણ ન કર્યું હોય તે પહેલાં)
- ૨) ડૉક્ટર દર્દનું ઉતાવળીથું નિદાન કરી દે.
- ૩) ગલત નિદાન કરે.
- ૪) રોગની અસલિયતના પ્રમાણની હળવાશ કે ગંભીરતા સમજવામાં ભૂલ. દા.ત. જ્યાં સાદી ગાંઠ હોય ત્યા કેન્સરનું નિદાન થાય અને જ્યાં કેન્સર હોય ત્યાં સાદી ગાંઠનું નિદાન થાય.
- ૫) જરૂરત કરતાં ઓછા યા વધુ પ્રમાણમાં આપવામાં આવતી દવાઓ.
- ૬) એક બિમારી માટે આપવામાં આવતી દવા શરીરના અન્ય નાન્ય અવયવને નુકસાન પહોંચાડે છે એની ગણતરી રાખ્યા વિના આપવામાં આવતી દવાઓ.

- ૭) CONTRA INDICATED - હાર્ડ્બ્લલ, ડાયાબીટીસ, બ્લડપ્રેશર, હીડની કે લીવરની બિમારીઓ, ગર્ભાવસ્થા ઈત્યાદિ અવસ્થાઓમાં અનુક દવાઓ આપવાથી એ બિમારીઓ વધી જાય અથવા મુત્યુ પણ થાય - આવી દવાઓ સમજયા વિના આપવાથી આવતાં પરીષાગે.
- ૮) વિવિધ લેબોરટરી ટેસ્ટ્સના ગલત રીપોર્ટો, ગલત રીડિંગ, ગલત ઇન્ટરેપ્રેશન (Interpretations) એક્સ-રે, કાર્ડિଓગ્રામ, સોનોગ્રામી, સ્કેનિંગ, કોર્પ્સ્કુટરાઇઝ રીપોર્ટ્સ આ બધામાં મશીન દ્વારા થતી ભૂલો, ટેનિશીઅન્સ દ્વારા થતા ગોયણા રીપોર્ટોની અદલાબદી અને રીપોર્ટેનું ગલત રીડિંગ બાદ ગલત નિદાન અને ગલત સારવાર.
- ૯) ઇન્જેક્શન આપ્યા પછી ઉપજાતી ગાંઠ, નસમાં આરપાર સોથનું જવું, નસનાં ઇન્જેક્શનમાં હવાની પરપોઠીઓ જાય, નસમાં સીધા ઘાંધવામાં આવતા ગ્લુકોઝ-સલાઈનના બાય્ટાનું પ્રવાહી બગઢેલુ હોય. સબસ્ટાન્ડર્ડ હોય-બનાવી પણ હોય. નસમાં આપવાનું ઇન્જેક્શન નસની બહાર આપાય, ઇન્જેક્શનનું પ્રમાણ ન જણવાય, શીરીઓ-નીડલથી ઉપજાતાં ઇન્જેક્શનન્સ ઈત્યાદિ.
- ૧૦) પ્રીસ્કીપાનમાં સાવ ગંદા ગરબઠીયા અસરે લખેલી દવાઓના નામ, બનાવનારી કંપનીનું નામ, દવાની સહી માત્રા લિ. કેમીસ્ટ વાંચી ન શકે અને બદલીમાં એકને બદલે બીજી દવા આપી દે તેનાથી થતાં નુકસાન.

- ૧૧) દા.ત. દવાની માત્રા ૧.૦ મી.ગ્રામ આપવાની હોય એમાં વચ્ચેનું દરાંશનું બિંદુ બરાબર ન વંચાય અને ૧૦ મી. ગ્રામ દવા આપી હે એનાથી મૃત્યુ પણ નિપને.
- ૧૨) વારંવાર એક્સ-રે કે રેડીયો થેરેપીથી થતી લોહીની અને કેન્સર નેવી બિમારીઓ.
- ૧૩) સારાસારના વિવેક વિના આપવામાં આવતી વિદ્યારીન્સ, પ્રોટિન્સ, કેલ્ફીઅમ, આયર્ન, જુલાબની ગોળીઓ, જુલાબ બંધ કરવાની દવાઓ, એન્ટીબાયોટિક્સ, સલ્ફાફ્રુસ, હોમોન્સ, કોઈકોસ્ટોરોઇડ્ઝ, પેઈન કીલર્સ, સીડીઓ, ડ્રાન્કવીલાઈઝર્સ ઈ. ના લાંબા-કુંકા ગાળાના રીએક્ષન અને બિમારીઓ.

લગભગ દેરેક દવાના ફિયદાઓની લેમ એ દવાઓની આડ-અસરો પણ હોય જ છે. નેવી જ રીતે એ દવાઓ ક્યા સંનેગોમાં ન અપાય એ પણ દેરેક દવાવાળા દવાની સાથેના લીટેરચરમાં લખી જણાયે છે. આ ફરફરીઆના છાપેલા અસરોની સાઈઝ કીડીની ટાંગ જેવડી હોય છે અને ભાષા મેડીકલ અટપીને ગોળગોળ હોય છે. ડૉક્ટર આવા ફરફરીયાં વાંચતો નથી, વાંચે તો સમજતો નથી, સમજે તો અમલમાં મુકવાની અગત્ય સમજતો નથી.

પરીણામે હુદાઓની ગોળીઓથી પેટ ખરાબ થાય છે. આંતરડામાં રક્તક્ષાવ થાય છે. હાડ્કાનો ગર્ભ ગર્ભ જથ્ય છે. જુલાબ બંધ કરવાની દવાઓથી અંધાપો આવે છે. ડી.બી. ની દવાઓથી બહેરા થઈ જવાય છે. ડાયાબીટીસની દવાથી કીડની કે પેન્ફીયાજ ખરાબ થાય છે. બિલડ્રેશરની દવાઓથી હાર્ટથ્ર્યલ થાય છે. ઉઘની ગોળીઓથી મગજ ખરાબ થાય છે, દમની દવાથી હાઈ એટક આવે છે, એસીડીટીની દવાઓથી અલ્સર થાય

છે. બિલડ્રેશરની દવાઓથી નપૂસકતા આવે છે, હોમોન્સથી કેન્સર થાય છે - લીસ્ટ બહુ લાંબુ છે.

Berlington ના Vermont ની મેડીકલ સેન્ટર હોસ્પિટના એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે ત્યાંના જેટલા દર્દીઓને Chloramphenicol (ક્લોરમ્ફેનિકોલ) નામની એન્ટીબાયોટિક દવા આપવામાં આવી હતી એમાંના ૨૬ ટકા દર્દીઓને એ દવાની બિલકુલ જરૂરત જ ન હતી. આ દવાથી લોહીનાં લાલ રક્તકણો બનાવવાની ક્ષમતામાં ધરાય થાય છે પરીણામે લીવરની બિમારીઓ કે લોહીનું કેન્સર પણ થઈ શકે છે.

તનાવ-ટેન્શન માટે આપવામાં આવતાં સાયકોટ્રોપીક ડ્રગ્સ ની સૌથી વધુ જુદી જુદી જતની દવાઓ સાઈકોઆટ્રીસ્ટે ધૂથી પ્રીસ્કાઈબ કરે છે. સીડીઓ, એન્ટી ડિપ્રેસન્ટ્સ, ડ્રાન્કવીલાઈઝર્સ નેવાં ઇપાણાં નામ વાળી બધી જ દવાઓ માનવીના મગજ-Brain ને એક યા બીજી પ્રકારે નબજુનું-કમલેર કરે જ છે. ઉપરાંત આ દવાઓ નશીલી હોવાથી એની ખરાબ આદત પડી જાય છે. આવી દવાઓ લઈ મોટર ગાડી, એરોપ્લેન, ટ્રૂ, રેલગાડી ચલાવનાર કે ભારે ભશીનો પર કામ કરનાર અક્સમાતથી મૃત્યુ પામે છે, પોતાની સાથે હનરો નિર્દોષ માનવીઓના જન જેખમમાં મૃત્યુ પૂકે છે કે કાયમના અંગ બનાવી હે છે અને આવા અક્સમાતોની સંખ્યા હનરો અને લાખોની સંખ્યામાં થાય છે એમાંનો એક પણ અક્સમાત ડૉક્ટર આપેલી દવાને કારણે થયો છે એમ કોઈ કહેવા કે કખુલ કરવા માંગતું જ નથી.

ગબાવિસ્થામાં આવી દવાઓ આપવાથી થેલામાઈડ બેનીજ હનરોની સંખ્યામાં વિકૃતી ધરાવનારા બાળકોના જન્મ થયા હતા એ

હજુ નજીકના ભૂતકાળની વાત છે. ડૉક્ટરી સારવાર પણ રાક્ષસી કક્ષામાં ભયાનક હોઇ શકે છે એ વાતને હવે કોઈ પુરાવાની જરૂર રહી જ નથી.

દર્દીને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યારે ત્યાંના ડૉક્ટરો જુદી જુદી જતની પાવરકુલ એન્ટીબાયોટિક્સ છૂટ્યી લઈ આપે છે. એ આપણો બધાનો અનુભવ છે. (1957/98) iconedimage

આપરેશન દરમિયાન કે તત્પ્રાયાત્ સંબંધિત ચેપ Infection બી બચવા આવી દવાઓનો વપરાશ થતો હોય છે. હકીકતમાં આ દવાઓ ઈન્ફેક્શનનાં જંતુઓ કરતાં દર્દીના શરીરના અગત્યના પ્રતિકારાક્ષણના જીવંત કોષોનોજ વધુ વિનાશ કરે છે.

હવે અમૃક રોગનાં જંતુઓ એવાં પણ હોય છે કે ને આવી એન્ટીબાયોટીક્સને જરા પણ દાદ દેતાં નથી. આવાં જંતુઓને Antibiotic Resistant Bacteria કહેવાય છે. આવાં જંતુઓ પછી દર્દીના શરીરમાં બિનધાસ્ત ઘૂસી જય છે, ઘર મારે છે ને મોય પાયા પર પ્રણનન ની રોગ દર્દીના આખા શરીરમાં ફેલાવી હોય છે - આ વખતે પેલી એન્ટીબાયોટીક્સ તો કશા ઉપયોગમાં આવતી જ નથી પણ દર્દીની પોતાની પ્રતિકારા શક્તિને આ એન્ટીબાયોટીક્સે ક્ષીણ કરી હોવાથી એ પણ પેલા રોગની જંતુઓનો સમનો કરી શકતો નથી - પરિણામે દર્દીના રોગને શાયું લેવા વધુ પાવરકુલ દવાઓ અપાય છે, એનાં વધુ ખરાબ રીબોકાની આવે છે ને દર્દી મરી જય છે.

સિસ્ટેર વર્ષનાં સરલાબહેનને હૃદયના અનિયમિત ધબકારા-નિપાત્તિ કરવા મારે ડૉક્ટરની સલાહ મુજબ ડિઝિટોક્સિન (DIGITOXIN) નામની દવા આપવામાં આવી. અ દવાથી એમની ખાચ્છોખાસની તકલીફ લથી ગઈ, એટલે ડૉક્ટરોએ એમને ડાયુરેટીક્સ દવાઓ આપી, આ દવાથી

હજુ નજીકના ભૂતકાળની વાત છે. ડૉક્ટરી સારવાર પણ રાક્ષસી કક્ષામાં ભયાનક હોઇ શકે છે એ વાતને હવે કોઈ પુરાવાની જરૂર રહી જ નથી.

#### DIAGNOSTIC TEST નિદાન ચિકિત્સા

નિદાનાથે કરવામાં આવતી તપાસણી Investigation એક અભિજીવિયાનું કોલાંડથી ખદબદતું વ્યવસ્થિત ચંદ્રંત તો છે જ. મોટી હીલીલોમાં, ઘર્મદા સંસ્થાઓમાં, લાઘો કરોડેના ખર્ચ બેસાડેલાં મહાકાય મશીનો કેટલા દર્દીઓ ગેડા કરે છે એ એક શોધખોળનો વિષય છે - આ બધા જ રીપોર્ટોની સાર્વકતા કરતાં નિરર્થકતા વધુ પુરવાર થઈ છે.

ઉદાહરણ એક્સ રે ના રેડીએશનની આડ અસરો જણવા જતાં અમૃક ડૉક્ટરો હજુ પણ ડી.બી. ફેફસાંનું કેન્સર કે હૃદયરોગ જેવી બિમારીઓ મારે "એક્સ-રે કદાવથો જરૂરી છે" એવું પુંછું પકડીને બેઠા છે.

૧૯૭૮ માં અમેરિકાના જગૃત ડૉક્ટરોની એક કમિટીએ આ રોગોના નિદાન મારે સ્કીનિંગ કે એક્સ-રે ની કોઈજ જરૂરત નથી અને આ વણેય બિમારીઓ અન્ય ચકાસણીનાં સાધનોથી તપાસીને નિદાન કરી શકાય છે એમ સ્પષ્ટ શાદીમાં જણાવ્યું છે.

અમેરિકન કેન્સર સોસાય્ટીએ પણ આ વાત ને સમર્થન આપ્યું છે.

મુસીબત એ છે કે આપણે ત્યાંના ડૉક્ટરોને દુનિયામાં Latest Development તથીબી ક્ષેત્રે કેટલો વિકાસ થયો છે ? પદ્ધતિઓમાં કેવા ફેરફારો થયા છે ? નુની સારવારો કેટલી નુકસાનકારક પુરવાર થઈ છે અને આધુનિક સારવારો કેવા પ્રકારની છે એ ઊડાણપૂર્વક જણાવતાં

મેડિકલ જર્નલો વાંચવામાં ભાગેજ કોઈ હિલચસ્પી છે અને જ્યાં વ્યવસાયિક વળતર વધુ છે એ નુકસાનકારક પદ્ધતિઓ છોડવામાં એમને આર્થિક નુકસાન છે. પરીણામે જરૂરત કરતાં બિનજરી તપાસ વધુ ને વધુ થાય છે.

માની લઈએ કે આવી રીતે એક બિમારીનું નિદાન કરવા દસ જાતના રીપોર્ટો કદાવવા જરૂરી છે. એમ પણ માની લઈએ કે આવી રીતે વધુ રીપોર્ટો કદાવવાથી વધુ જરૂરી અને વધુ સચોટ નિદાન થાય, અને પરીણામે દર્દીની વધુ જરૂરી સચોટ સારવાર પણ થાય છે.

ને ખરેખર આવું બનતું જ હોય તો જેમના આવા ટેસ્ટ કરાયા હોય તે જરૂરીમાં જરૂરી સારા થઈ જ જવા જોઈએ. રોગમુક્ત થઈ મહિનામાં હરતા ફરતા થઈ જવા જોઈએ.

આપણે બધા જ જાણીએ તીએ કે આવું કશુંજ થતું નથી. સામાન્ય કાડીઓગ્રામ કદાવેલ, બાયપાસ સર્જરી કરાવે છે. વેળાસર મફત નિદાન કરાવનારી લીઓનાં આખાંને આપાં સ્તન અને ગર્ભરીશય કાઢી કચરાની હોપલીમાં ફેંકી દેવામાં આવે છે. પેટમાં દુઃખતું હોય ને અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યો હોય એ ચેન્કીયાજ, ગોલન્ઝેડ કે કીજનું ઔંપેશન કરાવી મરી જય છે કે જીવનભર મરવાને વહે જીવે છે.

આવા હજરો, લાઘો અને હવે તો કરેઠોની સંઘામાં રીબાતા અને મરતા દર્દીઓમાં ભાગ્યે જ કોઈ ડૉક્ટર જેવામાં આવે છે. એ તમે નોંધ્યું છે ખુ ?

કારણ ? આ બધી જ બિમારીઓ ડૉક્ટરજન્યે છે Iatrogenic છે. ભલાદમી એટલુંય સમજતા નથી ?

પચાસ વરસના પુનમંદને કોઈ પણ ખાસ કારણ વગર ડૉક્ટરે જરૂર લોહી તપાસવાનું કહ્યું. પુનમંદ પુછે છે “અને તો કોઈ તકલીફ જ નથી ડૉક્ટર, હું શું કામ લોહી તપાસાનું ?”

ડૉક્ટર કહે છે “રોગના જંતુઓ લોહીમાં પેસી ગયા હોય તો બહારથી ખબર ના પડે. લોહી તપાસીએ એટલે ખબર પડી જય”

પુનમંદે ન છુટે લોહી તપાસાવ્યું. રીપોર્ટમાં પુનમંદને એનેમીયા છે એવું નિદાન થયું. પુનમંદને બાલ્ય રીતે એનેમીયાના કોઈ લક્ષણો કે અપલક્ષણો દેખાતાં ન હતાં એટલે ડૉક્ટરે બીજું તીર માર્યું. “બેરીયમ એનેમાનો રીપોર્ટ લઈ આવો”

“આ વળી શું કામ” બિચારો પુનમંદ પુછે છે.

ડૉક્ટર પાસે જવાબ હાજર જ છે : આંતરડામાં રક્તત્વાવ થયો હોવો જોઈએ એ સિવાય લોહીના રીપોર્ટમાં એનેમિક ન આવે.”

બેરીયમ એનેમાનો રીપાઈ સાથ નોર્મલ આવ્યો એટલે ડૉક્ટર મુંજાયો - ફરી પાછો એકવાર બ્લડ ટેસ્ટ કરાવવા કહ્યું.

પુનમંદ શાશો માણસ હતો. બીજી વેળાનો રીપોર્ટ એણો બીજી કેકાણો કદાવ્યો તો ચાર દિવસ પહેલાનાં રીપોર્ટમાં આવેલ એનેમિયા ગુલ થઈ ગયો હતો. બ્લડ રીપોર્ટ નોર્મલ હતો.

આમ કેમ થયું ? આમ એટલા માટે થયું કે પહેલી વારનો બ્લડ રીપોર્ટ ઓણે હતો.

‘JAMA’ જર્નલ ઓફ અમેરીકન મેડિકલ એસોસીએશન ના ૧૯૮૪ ના ચંકમાં એક અહેવાત છપાયો છે :

અનુવાદ : '૧૯૮૨ માં પચીસ હોસ્પિટ્લોમાં કરાયેલા સર્વોચ્ચામાં જણાયું છે કે આ બધી જ હોસ્પિટ્લોમાં કરવામાં આવતા જુદી જુદી જાતના નિદાનના ટેસ્ટે બિનજરી તો હતા જ એટલું જ નહીં, આ જ પ્રકાર ના ટેસ્ટ્સ બીજે ડેકાઝે (પ્રાઈવેટમાં) કરવામાં આવત હતા જેણા કરતા પચાસ ટકા વધારે ચાર્ન લગાડીને કરવામાં આવતા હતા.

એ તો ઠીક જણો સમજ્યા. પરતું આ બધા જ રીપોર્ટોના જીથી કા રીપોર્ટો સાવ ગલત, ખોટ અને બોગસ હતા.




સેટર્ટે ઈવનિંગ પોસ્ટ ના તંત્રી અને જગપ્રસિદ્ધ પત્રકાર નોમન કર્ઝીન કહે છે :

"ડૉક્ટરો સર્વજી છે અને દર્દીઓ સાવ અભૂધ છે એમ માનવું ભૂલભરેલું છે.

ડૉક્ટરો અને દર્દીઓ વચ્ચે ને એક બનાવાયી હિવાલ ઊભી કરવામાં આવી છે તે સાવ જીની માટીની બનેલી છે અને એને મિલાવી હેવાનો સમય પાકી ગયો છે.

"હું તને સારવાર આપીને સાબે કરી દઈશ કે લુચાડી દઈશ ને મારી સલાહ કે સારવાર નહીં કે તો તું બિમાર પડીશ કે મરી જઈશ" આ બન્ને અંતિમ કષાના વિધાનોમાંથી ડૉક્ટરો અને દર્દીઓ જેટલા જલ્દી મુક્ત થાય એટલું દર્દીઓનું વધુ ભલું થાયો.



PROLONGED QT INTERVAL (HYPOKALEMIA)




ARTRIAL FIBRILLATION



SINUS BRADYCARDIA




COMPLETE A.V. DISSOCIATION



ACUTE MYOCARDIAL INFARCTION WITH VENTRICULAR EXTRASYSTOLES R ON T PHENOMENON



COMPLETE A. V. DISSOCIATION



SINO ARTRIAL BLOCK

E.C.G. નેણો સમગ્ર માનવ જતિ નું એટમ બોંબની શોધ કરતાં પણ વળું નુકસાન કર્યું છે.

૨૩

## અસ્પતાલ તેરી ચાદર મૈલી

### NOSOCOMIAL DISEASES

આયેટ્રોનેસિસનો બીજો સંગ્રહો, મા જણ્યો એક ભાઈ છે અને એ રોગનું નામ છે નોસોકોમીઅલ બિમારીઓ.

ડૉક્ટરો છુટ કુટ રીઠલમાં બિમારીઓ પેદા કરે છે અને આ જ ડૉક્ટરો દ્વારા ચલાવાતી હોસ્પિટલો, નર્સિં હોમ જથ્થાબંધ હોલ્સેલમાં રોગોનું ઉત્પાદન કરે છે. કુટ એટલોજ ફરક છે આયેટ્રોનેનિક અને નોસોકોમીઅલ બિમારીમાં. “હોસ્પિટલો એ તો દિન-કુભિયાં રોગોથી પણતાં માનવીઓને રાહત આપનારાં, રોગો મયાળનારા માનવતાનાં પથિત મંદિરો છે” એવી નેવફૂફીબરી બ્રમજામાં તમે રાચતા હો અને હોસ્પિટલો બાંધવાના નામે ઉદાર દિલે ડિપિયાના ફળાથી એમની જોળી જાલકાવી દેતા હો, તો પહેલાં આથિં વાંચી ને જાહી લેને કે “હોસ્પિટલો સાલ સારા માણસને બિમાર કરી શકે છે, એક બિમારી લઈને આવેલાને બીજુ દસ બિમારીઓ લાગુ પાડી શકે છે અને એક સાથે જણ બંધ બીજીઓને મારી પણ શકે છે.”

મુંબઈ શહેરની લગભગ દેક મોટી જાણીતી હોસ્પિટલમાં અચાનક કોઈ બધાનક બિમારી ફેલાઈ ગઈ હોય, સાંજ સારા દાદીઓ અચાનક કોઈ દેખીતા કારણ વિના ટ્રોટ્ય મરી જતા હોય, રાતો રાત આખી હોસ્પિટલ ખાલી કરી દરવાજે તાળાં મારી દીધાં હોય" એવા છાપામાં સમાચાર વાંચીને તમે બીજે જ દાઉ વિસરી ગયા હો, તો આવો તમારી યાદ્વાસાન ને થોડી તાળ કરી દઈએ.

અત્યાર સુધી છાપે ચેત્તી હોસ્પિટલોમાં પ્રઘાત કામા, જે.લે, નાયર, જસ્લોક અને બ્રીચ કેન્દી જેવી અપદુકે હોસ્પિટલો ના નામ આવી ચુક્યાં છે. બીજ ફાઈબ સ્ટર હોસ્પિટલોમાં કે પ્રાઇવેટ નસીબ હોમ માં છુટક તુટક આવું થયું જ હોય છે ને લીનું લીનું સ્કેલોઈ જાં હોય છે. પબ્લિકમાં થોડી ઉહાપોહ થાય છે. તપાસ કમિટીઓ નિમાય છે, લેનીન કમીશનો બેસાડાય છે ને એમના રીપોર્ટોની ફાઈલો ધૂળ આય છે.

રેહકોસ જેવી સંસ્થાઓ દ્વારા ચલાવાતી બ્લડ બેંકો, એઈજ જેવી બિમારીઓ ફેલાવનારાં રીતસરનાં કારખાનાં બની ગયાં છે.

સાંજ થવા હોસ્પિટલમાં દાખલ થયું છે? મરેલા બહાર આવવાના સંભેગો વધુ ઉજણા છે... વિચાર કરી જોને...

હોસ્પિટલોને હોલ્સેલમાં માનવીઓને મારનારાં કલલખાનાનું ઉપનામ આપી બદનામ કરવાનો કોઈ ઈરાહો નથી- ને બને છે તે શા કારણોથી બને છે તે પર જરા નજર કરીએ તો શા માટે આવું થાય છે તે સમજઈ જરો.

પેશાન્ટને ઇન્જેક્શન આપવા માટે વપરાતી સીરીઝ ને નીડલ, ફાયની હોય તો પાણીમાં ઉકાળીને વાપરવી પડે છે આ ડિયામાં ઘણી મતિઓ

હી જાપ છે. ઉકાળવામાં આવતું વાસણ, વાપરવામાં આવતું પાણી મને જંતુઓથી ભરેલાં હોઈ શકે છે.

હાલમાં ને પ્લાસ્ટીકની ડીસ્પોરેબલ સીરીને આવી છે એ માનીલાઈઝ કરી કાગળના કવરમાં સીલ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે કાગળનું કવર ન ખોલો ત્યાં સુધી એ જતું મુક્ત (સ્ટ્રાઇલ) હો છે. આ દાવા કેટલા સાચા છે તે પુરવાર કરવા માટે કોઈ માપયંત્ર નથી. વળી કાગળ છે એ ફાઢી પણ જાય, એમાં કાણાં પડી જાય, એને માનીલાઈઝ કરી કેટલા સમય પહેલા પેક કરી છે? એ કેટલા સમય સુધીમાં માપવી જોઈએ? અને કેવી રીત સ્ટોર કરવી જોઈએ? એનાં કોઈ ધારા પોરસો નિષ્ઠિત નથી. વળી બધી જ જાતના ઇન્જેક્શનોમાં પ્લાસ્ટીકને અડવાથી કોઈ કેંગીકલ રીએક્શન આવે છે કે નહીં તે કોઈ જાણતું નથી.

દદાને પેસાબ કરાવવા માટે વાપરવામાં આવતો રબર નાં કેથીટર્સ, જેનેમાની નળીઓ, ઓક્સીજન આપવાની નળીઓ, થર્મોપિટર્સ, પુનિનલ્સ, બેડ પેન્સ, સીજર, ફોર્મેચ્સ, આટલા પર પાથરવામાં આવતી ખાદ્યો, તડીઆ, પેશાન્ટસને પહેરાવવામાં આવતા ગાઉન, બારી બારણાના પુડા, ટેલ કલોથ્સ, ડૉકટરો નસોનાં નાં એપરોન્સ, થુનિફોર્મ, રબર ગલઝ, માંડ્ય-મચ્છર થી ઉભરાતા દાદીઓના ખાટલા અને વોઈનું ફીલીચર, ખુબજ ની હાલતમાં રહેતા બાથડ્રમ, પેસાબખાનાં ને સંડાસ, ઉદર, વાંદા થી જિરાતાં કીચન - રસોડાં, ડ્રેસીંગનાં સાધનો, હથીયારો, ઓનારો, કોલન, પોઝ, સેનીટરી નેડ્ઝીન્સ એક્ડો થાયેત કચરો, એટ્લવાડનો સહી નીકાલ થાય, મૃત્યુ પાયેલ વ્યક્તિને બોડીની જણવણી. આમાંની એક જી વીજ રોગોનાં જંતુઓ ભરપુર પ્રમાણમાં ચેદા કરી શકે છે, સંધરી જી એ અને વિજળીની જરૂરે ફેલાવી શકે છે.

આપણે ને સામાન્ય રોગોની વાતો કરીએ છીએ એનાં જરૂરું ઓશરીના અમૃત અવયવ પર જ જઈને બેસે છે ને ત્યાંન વૃદ્ધિ પામવાનું કાર્ય કરે છે. દા.ત. આંખમાં કન્જેક્ટિવાઈટીસ થાય, ગળામાં ઘેન્સીલ્સ પાકી જાય, ફેફસામાં ટી.બી.નાં જરૂરું ઓફ્લાય, આંતરડામાં થયફોઇટ નો રોગ થાય ઈત્યાદિ.

સામાન્ય માણસને જેની ખાસ અભર નથી એ રોગનાં જરૂરું ઓષાં છે કે એ કોઈ અવયવ પર બેસવાને બદલે સીધાં લોહીમાં બળી જાય છે. આ પ્રકારની બિમારીને મેડિકલ ભાષામાં BACTERIA IN BLOOD STREAM કહે છે અને એનાથી ઉપજતા રોગને BACTEREMIA બેક્ટેરીયા કહેવામાં આવે છે.

બેક્ટેરીયાનો દર્દી ભાયેજ લુંગ છે કારણ લોહીમાં ભજીને આપા શરીરમાં પ્રસરેલાં જરૂરું ઓને પકડીને મારવાં મુશ્કેલ છે.

અને આ જતની બેક્ટેરીયાની બિમારી થવાની વધુમાં વધુ હોસ્પિટલમાં શક્યતાઓ રહેતી છે. એટલે કે બેક્ટેરીયા એ હોસ્પિટલ જન્ય નોસોકોમીયલ રોગ છે.

બોસ્ટન ની હોસ્પિટલમાં કરવામાં આવેલા ૩૬ દર્દીઓના ઓપરેશનનો અભ્યાસ કરતાં એવું જાણવા મળ્યું કે આ છતીસમાંથી વીસ દર્દીઓ ઓપરેશન દરમિયાન યા ઓપરેશન પણ્ઠાત કરવામાં આવેલી ડાક્ટરોની ભૂલોને કારણે મૃત્યુ પામ્યા હતા. અને બીજા પાંચ ઓપરેશન કર્યી પણી એક થા બીજી રીતે હમેશાને માટે અપંગ Permanently disabled બની ગયા હતા.

આ સર્વેક્ષણમાંનો એક ફક્રો ધણું બધું સાનમાં સમજની હૈ છે. એટલે પહેલાં આપણે એની જ ભાષામાં વાંચી લઈએ.

Quote :

"There is substantial evidence too, that more operations are performed than justified".

અનુવાદ :


"નકર પુરાવાને આધારે એમ કહી શકાય છે કે અરે ખરી જરૂરત કરતાં ધણું વધારે પ્રમાણમાં (નિર્ધાર્થક) ઓપરેશનો કરવામાં આવ્યાં છે."

આજ રીપોર્ટમાં આગળ જાણાવ્યું છે કે: " ઓપર હાઈ સર્જરીનાં ઓપરેશનો પણ જરૂરત ના હોય ત્યાં કરવામાં આવે છે, અને આવા કેસોનું પ્રમાણ ધણું વધારે છે."

"Hysterectomy આંખું ગલબાય કાઢી નાંખવું જરૂરી છે" એમ એક સન્ધર્થને કહ્યું હોય અને એજ દર્દીએ એટલી જ ક્વોલીફિકેશનવાળા બીજા સન્ધર્થનની સલાહ લીધી હોય તો એણે "આ ઓપરેશન બિલકુલ જરૂરી નથી" એવો અભિપ્રાય આપ્યો હોય. એની નોંધ આ રીપોર્ટમાં લેવામાં આવી છે.

રીપોર્ટના સમાપન માં એમ જાણાવ્યું છે કે: "ઓપરેશન કરતી વખતે કે તે પછી આપવામાં આવતી સારવારના પરીણામે, ડાક્ટરોની અક્ષમ્ય ભૂલોને લીધે ડેટલાય પેશેનો કાયમના અપંગ બની ગયા હોય છે તો ડેટલાક નાં મૃત્યુ પણ થાય છે, એટલું નહીં, બેહેશ કરવા માટે આપવામાં આવતા એનેસ્થેસીના ના પરીણામે પણ જત જતની જીવનભર ભોગવાની પડતી હોય તેવી (Life Long) બિમારીઓ કે મૃત્યુ પણ થયાં હોય એવા નમૂના નજરચંદાજ કરી શકાય એટલે ઓછા પ્રમાણમાં નથીન.

ડૉક્ટરો અને હોસ્પિટલો દ્વારા ફેલાવવામાં આવતી બિમારીઓના આ પ્રકરણામાં જેણે “દર્દીની સુવિધા અને સલામતી માટે ગોઠવવામાં આવ્યાં છે” એમ કહીને લાગડેલાં એર કંડીશન મશીનો તો રોગોને ઉપાયતાં ઘરખમ મોટાં રીતસરનાં કારખાનાં જ છે, એનો વિગતવાહ ઉલ્લેખ કરવો હતો પરંતુ વિષયાંતર થાથ એટાં હમણાં એને મુલતાની રાખીએ અને આયોદ્રોજેનીક અને નોસોકોમીઅલ બિમારીના લોગ બનવામાંથી બચવા માટે શું તકેદારી રાખી શકીએ એનો વિચાર કરીએ.



DR. HENRY MELENY AND DR. MARY LYNN  
FRASER OF GAINESVILLE UNIVERSITY OF  
FLORIDA MEDICAL CENTRE પાંચસો દર્દીઓના એક  
સર્વેક્ષણ પરથી એવું તારણું કે :

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ પાંચસો દર્દીઓ માં ના  
૩૭ કા (૧૮૫ દર્દીઓને) દવાઓનાં રીચેક્શન આવ્યાં હતાં  
જેમાં નીચેની દવાઓનો સમાવેશ થતો હતો.

પેનિસીલીન કર દર્દીઓ, સલ્ફા ડ્રગ્સ ૩૪, કોડિન ૧૮, મીનસ  
ઇન્જેક્શન ૧૩, એસ્પીરીન ૧૩ - અન્ય દવાઓ ૪૫.

અમુક સમજદાર ચામડીના રોગોના નિષ્ણાતોનું એવું માનવું છે  
કે એમના દવાખાનામાં સલાહ લેવા આવનાર ચામડીની  
બિમારીઓના દર્દીઓમાંના અડધો અડધ દવાઓનાં રીચેક્શનનાં  
બોગ બનેલા હોય છે.

## સાવધાનિના સૂર્ય

હથ રોગ સિવાયના દર્દીઓ ને પણ નીચે જણાવેલ સૂચનો  
ભવિષ્યમાં ઉપયોગી થઈ પડ્યો એ હેતુથી માર્ગદર્શન રૂપે આપવામાં  
આવેલ છે.

- 1) ડૉક્ટરો દ્વારા, સ્વાસ્થ્યનાં સાહિત્યોમાં, રેઝિયો, ટીવી પરના  
વાર્તાલાપમાં, છાપાની જહેરખબરોમાં, સ્વાસ્થ્યની કોલમોમાં  
માનવ શરીરને જેઠણું કમજોર માંયકાંગળું અને રોગિણ બતાવવામાં  
આવે છે. એવું તમારું શરીર છે એમ માની લેવાની જરાય  
જરૂર નથી.
- 2) નાનામાં નાની બિમારી ની ભારેખમ સારવાર કરવી ખૂબ જ જરૂરી  
છે જ અને જે એમ નહી કરો તો એનાથી બિમારી મહાબંધકર  
સ્વરૂપ ધારણ કરી તમને આઈ જશે. એવી વાતો ઝાપટ માની  
ઉપચારોના મારા ચલાવવાની ઉતાવળ કરવી જરૂરી નથી.
- 3) હાંદ્રૂખલ, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, અસ્થમા, કેન્સર, ઈટ્યાર્ડ  
બધા જ રોગો બધાન્યક છે અને વર્ષોનાં વર્ષો સુધી એકધારી  
સારવાર નહી કરાવો તો તમને મારી નાંખશે. એવા બધાજ રોગોની

અસલીયત અને એનું સૌભ્ય સ્વરૂપ જેમ બને તેમ જરૂરી ઓળખી લ્યો. અને ભયભિત કરવામાં અવ્યા હોય તો શાંત ચિંતા વિચાર કરી પછી જ સારવારના ચક્કરમાં પડો.

- ૪) તમારા શરીર માટે, બિમારીઓના ઈલાજો-અખતરા માટે, ડૉક્ટર, વેદ, હકીમ, અડોસી-પડોસી, સગાબ્હાલાં, મિત્રો-હિતેચુંચો માંગી, વણામાંગી જેઠલી સલાહો આપે એટલી બદધીજ સલાહો આંખ અને અક્કલ બંધ રાખી માની લેવાની અને અમલમાં મુકવાની કોઈ આવશ્યકતા નથી. હકીકિતમાં તમારું શરીર જ તમને ઘણું બધું કહેવા માંગે છે. કહે પણ છે. પણ તમને સાંભળવાની કુરસદ નથી, સાંભળતાં આવહણું નથી કે બીજું કોઈ સાંભળવા દેતું નથી.

શરીરની ભાષા સાંભળતા શીખી લ્યો-બીજી કોઈની સલાહની ભાગ્યેજ જરૂર પડો. CONSULT YOUR BODY. BODY IS THE BEST OF ALL CONSULTANTS.

- ૫) શરીરની અને રોગોની પોગીટીવ સાઈટ જાણી લીધી-પછી દ્વાર્યો, ઈલાજો, અખતરાઓ, ઔંપેરેશનો, નિદાન ચિકિત્સાઓ વગેરેની નેગેટીવ-ડ્રી, ગંદી, ગંધાતી સાઈટે પણ ખૂબ જ નાલકથી ઓળખી લ્યો એટલે એ બધું જ તમારું બધું કરવા માટે છે એ ભૂસું ભગનમાંથી નીકળી જરો.
- ૬) દર્દીએ પોતાની જ સારવારમાં સંકીર્ણ ભાગીદાર Active Partner થવાનો સમય આવી ગયો છે. તમારો કાર્ડીઓગ્રામ તમે ન વાંચી શકો તો એમં જણાવેલ તકલીફો તમે મહેસુસ તો કરી જ રાકો-જો તમારી શરીરીક તકલીફો, કાર્ડીઓગ્રામ નાં લીયાં ને મળતી

ન આવે તો તમે નહીં, કાર્ડીઓગ્રામ ખોયો છે અને ઓથ કાર્ડીઓગ્રામની વાત માની હથને કમનેર માની લેવાની જરૂર નથી.

- ૭) તમને આપવામાં આવતી દ્વારા ખરેખર જરૂરી છે ? શા માટે જરૂરી છે ? એ કેટલો વખત લેવી પડો ? શા માટે લેવી પડો ? એના ફાયદા કેટલા ? નુકસાન કેટલું ? બધું રનેરજ વિગતવાર જાણી લ્યો, પુછી લ્યો. સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી એક ગોળી ગળવાની જરૂર નથી. દ્વારાઓ એ રસાયણ છે અને શરીરને એ લોહીમાં બળેલું રહે તે મંજુર નથી. પરીણામે એ રસાયણોની રને રન્ઝ એને બહાર ફેંકવી પડે છે અને એ Excretion બહાર ફેંકવાની ફીલ્યામાં શરીરના બધા જ અગત્યના અવયવોને ખૂબ જ પરિશ્રમ પડે છે. આ ડિયા કરતાં કરતાં ઘણા અવયવો ને રીપેર ન કરી શકાય તેવું નુકસાન પણ થઈ શકે છે. તમને આવી હોય કે તમારા ડૉક્ટરે તમને દ્વારા લખી આપતાં આ બધી વાતો ગણનીમાં લીધી છે, તમને શાંતિથી સમજાવી છે, તો જ સારવાર કરજો-નહીં તો પસ્તાશો.

- C) (A) POISON  
(B) SCHEDULE E. H. OR L DRUG  
(C) TO BE SOLD AGAINST PRESCRIPTION ONLY.

આવી ચેતવણીઓ લખી હોય તે બધી જ દ્વારા વાપરતાં પહેલાં ખૂબ વિચાર કરજો. ચામડી પર લગાડવામાં આવતા મલમો પણ આવી ચેતવણી રૂપે હોય તો એ નુકસાન કરવાને સમર્થ છે જ.

- ૬) ખોય ખોય રીપોરોટો કદાવવાનો અને દળતાંથી દવાઓ ખાવાનો આગ્રહ રાખી ડૉક્ટરને બેઈમાન બનવામાં મદદ ન કરો. આજની કથળતી પરિસ્થિતિ માટે ડૉક્ટરો જેટલા જ એમના દર્દીઓ અને એમના કુટુંબીનો જવાબદાર છે.
- ૧૦) એક ખૂબ જ સમજદાર અનુભવી અને ઈમાનદાર ડૉક્ટર ડેવીડ નેશ (Dr. DAVID NASH) કહે છે : "ધાર્દ રાખો, ડૉક્ટર તમને જેટલા સાંજ કરી શકે છે એટલા જ બિમાર પણ પાડી શકે છે, એની સારવારથી ભરણાપથારીએ પદેલો દર્દી નવજીવન ગ્રાપ્ત કી શકે છે તો એજ સારવાર સાંજ સાંજ સારા તંકુરસ્ત માનવીને બિમાર પાડી રીબાવી રીબાવીને મારી પણ શકે જ છે.

★ ★ ★

- ૧) સામાન્ય જુલાબની દવાઓથી ચામડીના રોગો, લીધરની કમળા જેવી બિમારીઓ થાય છે. અરે, શ્વાચ્છોષ્વાસની કિયા બાંગી પડવાથી. (COLLAPSE) જુલાબની ગોળીથી મૃત્યુ થવાનું પણ નોંધાયું છે.
- ૨) હદ્ય રોગથી થતાં મૃત્યુઓમાં ના કેટલાંક એન્ટી બાયોટિક, દવાઓની આડ અસરોને પરીણાગે થયાનું નોંધાયું છે.
- ૩) જુલાબ બંધ કરવાની, ગેલેરીયાની સારવામાં વપરાતી અને ઉત્તેજના શાંત કરવા માટે આડેઘડ આપવામાં આવતી પ્રાન્કવીલાઈકર્સની દવાઓની આડ અસરોને કારણે અંદાપો આવે છે. (LONG TERM REACTIONS)
- બધા જ ડૉક્ટરો આ વાત જણે છે કયુલ કોઈને કરવું જ નથી.

## ૨૫

### હદ્યાદેશ

- ૧) જેને માનવી 'જીવ' તરીકે ઓળખે છે તે જ હું છું.
- ૨) માના ગર્ભમાં રહેતા બાળકનું જે ક્ષણે 'હદ્ય' ઘબકતું થાય છે, તે જ ક્ષણથી શરીરમાં "જીવ"નો પ્રવેશ થાય છે.
- ૩) જે ક્ષણે "જીવ" શરીરમાં પ્રવેશ પામે છે તે જ ક્ષણે એ દાખલ થએલા શરીરમાં કેટલો સમય રહેવાનો છે એ વાત નિખિત થઈ ચૂકી હોય છે. શરીરમાં જીવને દાખલ થવાની અને એજ શરીરમાંથી જીવ ને વિદ્યાય થવાની કણણની કોઈને પણ "જીણ" નથી થતી. (નથી થતી એથું સારું જ છે).
- ૪) આ 'જીવ' માનવીના હદ્યને ઘબકતું રાખે છે અને એ જીવ જ પછી માનવીના સમગ્ર અસ્તિત્વનો "આત્મા" પણ બની જય છે. જે ક્ષણે 'જીવ' શરીરમાંથી વિદ્યાય લે છે તે જ સાથે "આત્મા" પણ શરીરમાંથી વિદ્યાય લે છે. અને જ્યાં સુધી આ બન્ને શરીરમાં સાથે રહે છે ત્યાં સુધી એ 'જીવાત્મા' તરીકે ઓળખાય છે.
- ૫) આ આત્મા એ પરમાત્માનો એક અંશ છે અને જેમ અણુ અને પરમાણુ અત્યંત શક્તિના ભંડાર હોય છે તેમ આત્મા એક

એવી પ્રચંડ શક્તિ છે જે માનવીને પોતાની એક આગવી ઓળખ ઘડવામાં સહાય કરે છે. આ એક એવી મહાન માયા છે જે માનવીની કાયા ને દૈવ અથવા હૈત્યનું સ્વરૂપ આપી શકે છે.

આત્માને ઓળખનાર, એનું સંજ્ઞાન કરનાર, એની પ્રચંડ શક્તિઓના બંડારનો સહૃદયોગ કરનાર ‘ધર્મતિમા’ બને છે તો એજ આત્માનું અપમાન કરનાર, અવગણાના કરનાર એનો દુરુપ્યોગ કરી એને બદનામ કરનાર “દુષ્ટાત્મા” બની જાય છે.

૬) જે કષેણે માનવી એના હદ્યને ઘબકનું રાખવા વ્યર્થ ધમપણાડા કરવાની ચેષ્ટા કરે છે તે જ કષેણે એ પોતાના આત્માનું અપમાન કરવાની, એને અભડાવવાની, બ્રાષ્ટ કરવાની ફૂર રમત રમવાનું શકું કરે છે અને આ ચેષ્ટાથી લુલ દુબાય છે.


૭) બ્રાષ્ટ થયેલ એ આત્મા અને દુબાયેલો લુલ પછી જેમાં એનો વાસ છે એ શરીર અને શરીરનું નિયંત્રણ કરતી બુદ્ધિ બન્નેને બ્રાષ્ટ કરે છે. પેલા આયુષ્યની રેખા ખેંચીને લંબાવવામાં તો એ રતિભાર પણ ઉપયોગમાં આવતું નથી જ નથી. પરંતુ જે કંઈ આયુષ્ય શેખ રહ્યું હોય છે તે સમગ્ર શરીરના અણુએ અણુને કલુષિત કરી મુકે છે.

૮) આત્માને જ્યાં સુધી શરીરમાં નિવાસ કરવો છે, ત્યાં સુધી જ એ શરીર પાસે પ્રાણવાયુ માંગીને લે છે. ત્યાં સુધી જ માનવી ખાસ લઈ શકે છે. જે કષેણે જીવાત્મા શરીરને ત્યજને જય છે તે જ કોઈ આવશ્યકતા રહેતી નથી. માનવી ખાસ લેવાનું બંધ કરી દે

છે. કોઈ ઓક્સિજન ના બાટલા એના હદ્યને ફ્રી ઘબકનું કરી શકતા નથી.

૯) “માનવી માત્રનું હદ્ય નબળું છે, કમલેર છે, રોગિએ છે ખોડખાંપણ વાળું છે, એના સ્નાયુઓમાં લોહી ગંધાઈ ગયું છે એની દિવાલોમાં કાણાં પડી ગયાં છે, એની બેટ્ટી ડાઉન થઈ ગઈ છે- અમારી પાસે આવો - અમારા ગેરેજમાં નવી નક્કોર બેટ્ટી ફીટ કરી આપીશું. ગાબડ-ગુબડ ઢોકીને સીંધું કરી આપીશું, પાઈ બગડી ગયા હશે તો નવા નકોર બદલી નાંખીશું. રંગના લપેડા લગાવી તમારા હથમાં એક નવીનકોર ગાડી આપીશું” આ વાત માની તેવા જેટલા તમે બોળા (ક બેકફેઝ) હો તો તમને હું તો શું તમને ખુદ બનાવવાવાળો ઈશ્વર પણ રોકી શકવાનો નથી. જાઓ ખુશાલ ગાડી ગેરેજમાં મુકી આવો.

૧૦) હા. એવા ગેરેજેલમાં ગાયેલી લાખો ગાડીઓ બિચે ઘણું બધું હું જાણું છું. એમાંની થોડી ઘણી પાછી આવેલી પણ મેં જોઈ છે, તમે પણ જોઈ હશે. એને ગાડી કહેવી એ ગાડીનું સરાસર અપમાન છે. હકીકતમાં એ હાલતો ચાલતો ખાતો પીતો ને શાસ લેતો માનવી નામના શરીરનો એક લંગાર છે. એનું પેલું હદ્ય હજુ પણ એટલા માટે ઘબકે છે કારણ કે એના ‘જીવાત્મા’ નો એના શરીરને ઢોકીને જ્યાંનો નિશ્ચિત સમય હજુ આવ્યો નથી પણ હા.... એક વાત નિશ્ચિત છે કે માનવ શરીર અને આત્મા વચ્ચેનો પેલો એક ટિવ્ય-અલીકિક સંબંધ હતો એ તો કયારને ચે તૂટી ને ધૂટી ગયો છે.



## શાબ્દાર્થ

ALLEViate	= રાહત આપે
ATHEROSCLEROSIS	= રક્તવાહિનીઓનું કડક થઈ જવું
ANGINA	= ધૂંઠન-ગુંગળામણા-ગબરામણા
ANOREXIA	= ભૂખ મરી જય
ARRYTHMIAS	= હૃદયના ધબકારાની તાત્ત્વબધિતામાં થતા ફેરફારો
BRONCHO SPASMS	= ખાસનળીનું સંકોચાવું
BLURRED VISION	= ધૂંધળું દેખાવું
BRADYCARDIA	= હૃદયના ધબકારા ધીમા પડી જય.
COFUSION	= ગુંગવણ - મુંગવણ
CONDUCTION DEFECTS	= ઇન્ન્ડ્રીયોની સંકેશા લાવવા લઈ જવાની કીયા ખોરવાઈ જય
CONTRAINDICATIONS	= કચા સંનેગોમા આ દવા ન અપાય
CARDIAC	= હૃદયને લગતું
CARDIOGENIC	= હૃદય દ્વારા ઉપજેલું
CYANOSIS	= ઓક્સિજન ઓછો પડવાથી હોઠ અને નખ કાળા પડી જય.

DIURETIC	= ને દવાઓથી પેસાબ છૂટ્યી થાય
DISORIENTATION	= માનસિક અસમતુલન
FATIGUE	= ફેરફારો
GREEN & YELLOW	
VISION	= લાલ પીળા દેખાય
GINGIVAL HYPERPLASIA	= પેદામાં સોન આવવા
GLAUCOMA	= આંખના ડોળાંનું અંદરનું દ્વારા વધે
HAEMORRHAGE	= રક્તત્વાખ
HYPOTENSION	= ઓષ્ણ બલદ્રોશાર
HYPERTENSION	= ઉચ્ચ બલદ્રોશાર
HYPERTROPHIC	= ધીસ્યૂ ની સાઈઝ માં વધારો થવો
ISCHEMIA	= લોહીનો પુરવઠો ઓછો મળે.
INDICATION	= કચા રોગમાં અપાય, આપી શકાય
IMPAIRED	= ખોરવાઈ જવું
METHAEMOGLOBINEMIA	= લોહીમાં ઓક્સિજન ઘૂંઠી જવાથી થતી તકલીફ
MYOCARDIAL	
INFARCTION	= હૃદયના અમુક ભાગમાં લોહીનું પ્રમણ અટકી જવાથી એટલા ભાગનું જુંઠું પડી જવું
MYOPATHY	= સ્નાયુઓને લગતું
OCCLUSION	= સંકોચાવું - બિડાઈ જવું
PALLIATIVE	= ને રાહત આપે અસલ રોગ ન મધ્યદે
PCTA	= રક્તવાહિનીઓ પર કરવામાં આવતી સર્જરી

PERIPHERAL	= આસપાસનું
SYSTOLES	= સંકોચાવાની કિયા (હદથની)
STENOSIS	= (સંકોચાવું - સ્નાયુઓ નું કે કૃતવાહીનિઓનું
SYNCOPE	= ચક્કર આવવા
SPECIAL PRECAUTION	= આસ ચેતવણી (દવાઓના સંદર્ભમાં)

\* \* \* \* HEMORRHAGE

ALLEVIATE HYSTERTENSION

HYSTERTONIC HYSTERTONIC

## REFERENCES

1. CECIL TEXT BOOK OF MEDICINE 18th EDITION.  
VOL. 1 by WYNGAARDEN AND SMITH.
2. HARRISON'S PRINCIPLES OF INTERNAL  
MEDICINE 12th EDITION (INTERNATIONAL)  
VOL. 1.
3. DISEASES OF LIVER & BILIARY SYSTEM by  
SHEILA SHERLOCK & JAMES DOOLEY.
4. THE WORLD BOOK ENCYCLOPAEDIA.
5. FITNESS by C. P. GILMORE.
6. STRESS.
7. THE HUMAN BODY.
8. HEALTH & DISEASE.
9. THE PHYSICIAN.

10. THE CELL.
11. THE GROWTH
12. PILLS PROFITS & POLITICS by MILTON SILVERMAN & PHILLIP R. LEE.
13. MATERIA MEDICA – PHARMACOLOGY & THERAPEUTICS.
14. DRUGS & THERAPEUTIC ENCYCLOPAEDIA.
15. CHEMICAL & DRUGS FORMULARY.
16. MEDICAL DICTIONARY NANCY ROPER.
17. NATURE OF CANCER by Dr. MANU KOTHARI & Dr. LOPA MEHTA
18. VARIOUS FOREIGN PRESTIGEOUS MEDICAL JOURNALS

અવયવ દર્શાવ  
એન્ટી ટેન્શન  
કેન્સર ગિતી  
એન્ટી અસ્થમા  
નો બી.પી.

